



R.N.I.No.: 11555 / 1966

Vol No. 64—Issue No. 5

Total—46 Pages

Price Rs. 1/-

૧

e-Jyotipunj

આગસ્ટ ૨૦૨૦



જ્યોતિપુંજ

સુદ - મહિમા

માણસને પોતાનામાં વર્ષી હોઠો અંગળો વિભાગ સુતાંત્રમાં હોય છે, તેથી શ્રી વિશ્વાંતું કથીને સુતાંત્રમાં મુદ્રિત રહ્યે છે.

માણસના પદ્યે કૃત્તું એવાં લીધે વિભાગ પેદા થાય છે, તેથી માણસ વિશ્વાંતું કથીને સુતાંત્રમાં વિભાગ રહ્યે છે.

સુતાંત્રમાં ઉત્સેચિં શ્વામતી ઘર્ણાંદ્રિ હોય છે, સુતો કથી શ્વીધતા વર્ષી કે દુઃખી અત્મા વર્ષી, સુતાંત્રની શુદ્ધાંતર શ્વામતી કથી નિષ્ઠાંત જતો વર્ષી, અને સુતાંત્રની શુદ્ધાંતી કથી નિષ્ઠાંત કેને એવ અત્મા વર્ષી.

સુતો જ સુતાંત્રી શ્વામતો ગરીબ આપે છે, સુતો જ અપ વડે ઘરતીને ઘરાણા કરે છે, એવાં મિશ્રાંતી ગરીબ પણ સુતો છે, સુતાંત્રની શુદ્ધાંતર સુતાંત્રી સુકંદર જતો વર્ષી.

સુતાંત્રનો પણ્યાં (ફ્રો) કથી નિષ્ઠાંત જતો વર્ષી, સુતાંત્રી કોઈના ઘર્ણાંતો વાણ અત્મા વર્ષી કે કોઈના માનનોંબા અત્મા વર્ષી.

શ્રી બાલાસિનોર નવયુવક સંધ્ય

અમને જણાવતાં ગર્વ થાય છે કે આપણા ઉમદા અને ઉદારદિલ દાતાઓ

સ્વ. શ્રી રસિકલાલ રમણલાલ કડકીઆ (આર. આર.)

ના સ્મરણાર્થે તેમના સુપુત્રો તરફ થી સંઘને Treatment for Cancer Scheme માટે રૂપિયા ૧૧,૦૦,૦૦૦/- (રૂ. અગિયાર લાખ) નું માતબર દાન પ્રાપ્ત થયું છે. હવે થી આ યોજના નું નામ નીચે પ્રમાણે રહેશે.

"શ્રી રસિકલાલ રમણલાલ કડકીઆ, Treatment for Cancer Scheme"

સ્વ. શ્રીમતી મૃદુલાબેન રમેશચંદ્ર ધારીઆ (શાહેરાવાળા)

દસ્તે તેમની પુત્રવ્યંધાઓ, પ્રીતિબેન, નીતાબેન, અમીબેન તરફથી સંઘ ને રૂપિયા ૧૧,૦૦,૦૦૦/- (રૂ. અગિયાર લાખ) નું માતબર દાન મહિલા વિભાગ માટે પ્રાપ્ત થયું છે. હવે થી આ યોજના નું નામ નીચે પ્રમાણે રહેશે.

"શ્રીમતી દ્વાંતાબેન કંઈતિલાલ લાલચંદ દોદ્ડી આને

શ્રીમતી મૃદુલાબેન રમેશચંદ્ર ધારીઆ (શાહેરાવાળા)

પુરુષકુત્ત મહિલા વિભાગ"

શ્રી બાલાસિનોર નવયુવક સંધ્ય ઉપરોક્ત બંને સખાવતી દાતાઓ અને તેમના કુટુંબીજનો નો હૃદય પૂર્વક આભાર માને છે.

મંત્રી—શ્રી ભાવેશ બીપીન મોદી

પ્રમુખ—શ્રી સૌમિલ જીતેન્દ્ર મોદી



અંગ્રેજી મિંડડીયમવાળા આપણાં નવયુવાનોં, બાળકો હેઠે 'જ્યોતિપુંજ' વાંચી શકશે ગુગલ ટ્રાન્સલેટ એપ દ્વારા.

સમય સાથે કદમ મિલાવવા 'શ્રી બાલાસિનોર નવયુવક સંધ્ય' હુમેશા તૈયાર હોય છે. જ્યોતિપુંજ ગુજરાતી સાથે અંગ્રેજી માં છપાય અથવા વર્તમાન જ્યોતિપુંજ માં અમુક પાના અંગ્રેજી માં છાપી શકાય તે માટે અમારા ભગીરથ પ્રયત્ન ચાલુ જ છે.

અમારા ધ્યાન માં છે કે ગુજરાતી વાંચતા ન આવડતું હોવાને લીધે મોટાભાગના યુવાનો, બાળકો જ્યોતિપુંજ વાંચવાથી વંચિત રહી જાય છે. સમગ્ર સમાજ અને

સમાજની સર્વ સંસ્થાઓને ઘબકતી રાખવાનું કાર્ય આપણા યુવાનો જ કરી શકે.

આપણા સમાજ અને સર્વ સંસ્થાઓની પ્રવૃત્તિઓથી નવયુવકો પણ વાકેફ થાય તે સમયની માંગ છે. દર મહિને બહાર પડતું આપણું મુખપત્ર જ્યોતિપુંજ સર્વ બાબતોનો ચિતાર સમાજ સમક્ષ રજૂ કરે છે.

હવે થી જ્યોતિપુંજ અંગ્રેજી ભાષામાં અનુવાદ કરી વાંચી શકાશે, ગુગલ ટ્રાન્સલેટ એપ દ્વારા. તમારા મોબાઈલ માં 'પ્લે સ્ટોર' માં જઈ ગુગલ ટ્રાન્સલેટ નામની એપ ડાઉનલોડ કરો. આ એપનો ઉપયોગ કરીને આપણી સંસ્થાનું દર મહિને પ્રકાશિત થતું જ્યોતિપુંજ તમારા દરમાં નવયુવાનો, નવયુવતીઓ, બાળકોને અચૂક વંચાવો.

આપણી જ્ઞાતિની સર્વ માહિતી ગુજરાતી અથવા અંગ્રેજી માં વાંચી લાભ લેવા વિનંતી.

મંત્રી - ભાવેશ મોદી

તંત્રી - બંકિમ પરીખ

જ્યોતિપુંજ



વર્ષ	અંક	તારીખ
૧૪	૫	૨૧-૦૮-૨૦૨૦

છૂટક કિંમત : ₹ ૧/- વાર્ષિક લવાજમ : ₹ ૧૦/-

બંકિમ રજનીકાંત પરીખ (તંત્રી) (જૂનાગઢવાળા)

જતીન દેસાઈ / પ્રશાંત પરીખ
તુખાર કડકીઆ / નિમીખા જી. કડકીઆ
પત્રવ્યવહારનું સરનામું

બંકિમ પરીખ (ફોન : ૨૨૦૫૬૬૦૧)

ડાયમંડ ઈલેક્ટ્રિક કંપની, ઈ/૨૧ બી,
નીરવ મેન્શન, બીજે માળે, ભાંગવાડી
કાલબાંદેવી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૨.

ફોન : ૯૮૨૦૪૩૪૩૨૨

.....* *

મંત્રી : ભાવેશ બીપીન મોદી (દાસરાવાળા)

એ. કે. એન્ટરપ્રાઇઝ

૫૪ - બી, ગૌરક્ષક ચાલ, ૧ લે માળે, રૂમ નંબર - ૧૩,

ફણસવાડી, મુંબઈ - ૪૦૦ ૦૦૨.

દે. (ઓ.) : ૨૨૦૫૦૦૦૮ (મો.) : ૯૮૯૬૦૮૦૨૭૯

.....* *

કાર્યાલય

૧૧૮/૧૨૦, અંદશર દાદી સ્ટ્રીટ, વી. પી. રોડ,
મુંબઈ - ૪૦૦ ૦૦૪. દે. નં. : ૨૩૮૮૭૦૦૯

.....* *

સમય

સોમવાર થી શનિવાર ર થી ૭ (સાંજે)

રવિવાર ૮:૩૦ થી ૧૧:૩૦ (સવારે)

૬૨ બુધવારે સંસ્થાની ઓફિસ બંધ રહેશે.

Visit us www.balasinor.org

bnssangh@gmail.com

શ્રી બાલાસીનોર નયાનક સંઘ - જ્યોતિપુંજ



તંત્રી સ્થાનેશી
MAHAPURUSH

બંકિમ રજનીકાંત પરીખ (જૂનાગઢવાળા)

મહાપુરુષો સુરાર જેવા હતોય છે

શ્રાવણ ની પૂર્ણિમા ઉમગ્રુમ પગલે આવી અને આંનદોસ્વ કરાવતી ગઈ.
શ્રાવણ સુદ પૂનમ એટલે ફક્ત રક્ષાબંધન, બળેવ જ નહીં પરંતુ આદિકાળથી આ
દિવસ નું માહાત્મ્ય રહ્યું છે. આ દિવસે વરુણાદેવની વિશિષ્ટ પૂજા-અર્થના થાય
છે, સાગરની પૂજા થાય છે. ખારવા, નાવિકો વગેરે વરુણાદેવની આરાધના કરે છે.

આ દિવસ એટલે વહાણવટા દ્વારા ઈજિન્ટ, ગ્રીસ, લંકા, બર્મા, ચીન, જાપાન
વગેરે દેશોમાં જઈ ભારત દેશની સંપત્તિ વધારનારા વેપારી પૂર્વજો તેમજ કલા-
કૌશાલ્ય, તત્ત્વજ્ઞાન, ધર્મ, દેવતાઓ વગેરે પ્રચાર વિદેશમાં કરનાર સંસ્કૃતિવિરોની
પવિત્ર, પ્રેરણાદાચી, સ્મૃતિ, સાગરમાં નાજિયેર ચઢાવતાં તાજુ કરવાની હોય છે.
ધાર્મિક-વિજય, હૃદય-પરિવર્તનો, પ્રેમશાસ્ત્ર, ધર્મનો પ્રચાર અને સંસ્કૃતિનો પ્રચાર
છેક મુનિ અગત્યના કાળથી ચાલ્યો આવે છે. ભગવાન મનુ એ કહ્યું છે કે, આ
દેશમાં જન્મેલા સંસ્કૃતિ-વીરો પાસેથી વિશ્વના સમગ્ર માણસોએ પોત-પોતાના
ચરિત્રો શીખવાં જોઈએ. સંસ્કૃતિ મશાલ લઈ દુનિયામાં ફરી વળનાર ધર્મવીરો
અને ચાત્રિકોનું સ્મરણ કરવાનો દિવસ એટલે શ્રાવણ-પૂર્ણિમા છે. ઋષિમુનિએ
કહ્યું છે કે 'સાગરે સર્વ તીથોનિ..... 'સરિતા કરતાં સંગમ અને સંગમ કરતાં સાગર
વધુ પવિત્ર છે:

જેમ પોતાના સર્વ પ્રકારની અસ્વચ્છતા સાથે નદીઓ સાગરને આવી મળે છે
તો પણ અચલ સમુદ્ર પોતાની પ્રતિષ્ઠામાંથી ચલિત થતો નથી તેમ સ્થિતપ્રફાન
પણ સર્વ કામનાઓ પોતાનામાં પ્રવેશ થવા છતાં પોતાની શાંતિ અને સ્થિરતા
ગુમાવતો નથી. દુનિયાના લોકો જેમની પાસે આવી પોતાના પાપ, દોષો છાલવી
નાંખે છે તેવા મહાપુરુષો નું પેટ સાગર જેવું વિશાળ છે. સર્વપ્રકારની સંપત્તિ
મળવા છતાં તે છીકી જતો નથી, તે ઉન્મત બનતો નથી, પેસા આવતાં ઉન્મત
બનીને કુટુંબ, સમાજ, રાષ્ટ્ર કે ધર્મની અને સંસ્કૃતિની મર્યાદા ઉડાવી દેવા ઉન્મત
થનાર છીછરા માણસોને માટે સાગરની આ નગ્રતા એક મોટું ઉદાહરણ પૂર્ણ પાડે
છે.

જે જે શ્રી ગાંધીને

મહાપુરુષો ખાર જેવા હોય છે

મુશ્કેલીમાં મિત્રનું પારખું થાય છે. ચુદ્ધ માં પરાકરી નું પારખું થાય છે. વિનયમાં વિદ્યાર્થીની પરીક્ષા થાય છે. દુકાળમાં દાનનું પારખું થાય છે. તેજ રીતે વેપારીની પરીક્ષા સંપત્તિમાં થાય છે. વૈભવ વધે પણ જે દુનિયાથી વિમુખ ન થાય તે વેપારી સંપત્તિની પરીક્ષામાં ઉતીર્ણ થાય છે. દરિયો ભરતી તેમજ ઓટમાં એક સરખી રીતે જ પ્રસત્ર થાય છે. નિરાશા, વ્યથા અનુભવતો માણસ સાગર કિનારે ફરવા જાય તો તે શાંતિ પ્રાપ્ત કરે છે. એક કવિએ કહ્યું છે કે, "પોતાની વ્યથાને અંતરમાં છુપાવીને મહાપુરુષો યહેરા પર પ્રસત્ર સ્મિત ધારણ કરે છે ને તેમની પાસે આવનારના દુઃખો દૂર કરે છે. આવા મહાપુરુષો ના જીવનગીત ને કોઈ સમજે કે ના સમજે તે તો સાગરની જેમ મસ્ત બનીને ગીત ગાતા જાય છે."

સાગર તો મૂંગો દાની છે એનું ગુપ્ત દાન ઝટ કોઈના દ્યાનમાં આવતું નથી. સાગરનું પાણી ખારું છે એમ કહીને એને ઉતારી પાડ્યો છે. સાગર તો રલોને છુપાવી રાખે છે. સમુદ્રમાં ઘણાં બધા જીવજરૂપો વસે છે જેમનું અસ્તિત્વ ખારા પાણીને આભારી છે. જો સમુદ્રનું પાણી ખારું ન હોત તો આપણાને નમક કચ્ચાંથી પ્રાપ્ત થાય? નમક તો સબરસ છે તે ખારું છે છતાં લોકો તેને મીઠું કહે છે. મહાસાગરમાંથી મોતી કે રલો મળે છે. તે જ રીતે મહાપુરુષોનું જ્ઞાન મેળવવું હોય તો તેમની પાસે બેસવું જોઈએ.

ભગવાન યોગેશ્વર સ્વમુખે કહે છે : 'સાગર નદીને શોધવા જતો નથી. નદીઓ પોતે આવીને સાગરને મળે છે તે જ રીતે સ્થિતપ્રણ કામનાઓ પાછળ ઢોડતો નથી. કામનાઓ જાતે એને શોધીને આવે છે. દરેક સંપત્તિ ઈશ્વરાપર્ણ કરવાનું સૂચયતો, સાગર પૂજન થી દરેક જીવનની મહાનતાના શીખરોનું દર્શન કરવાટો, મહાપુરુષો ના રક્ષણ ની પ્રતિક્ષા ની ચાદ આપતો શ્રાવણ-પૂનમ નો તહેવાર ગૌરવ લેવા જેવો દિન છે. આ ઉત્સવ ખરેખર ધન્ય છે. ધન્ય છે રલાકર, ધન્ય છે આપણા મહાપુરુષો.



જીત

આપણામાં એમ કહેવાય છે કે તુંડું તુંડું મતિ ભિત્રા. પણ જીતવા માટે બધાંની જ મતિ એક સરખી જ છે. માણસને મન જીતવું એટલે બીજાની હાર. જો સામે પક્ષે માણસ જીતતો હોય, તો એ કચારે ને કેવી રીતે હારે છે, બસ એ જ એનું એક લક્ષ્ય બની જાય છે. બીજાને હારતા જોવાની કોશિશમાં એ પોતાની જીત માણી નથી શકતો. પોતાની જીતનાં એ પૂરેપૂરો આનંદ ઉછાવી નથી શકતો.

બીજાની હાર એ જ પોતાની જીત એમ આ ભગવાન દ્વારા બનાવવામાં આવેલ, એની ઉત્તમ રચના, એટલે કે ધરતીપરનું બુદ્ધિશાળી પ્રાણી મનુષ્ય સમજે છે. મનુષ્ય માત્ર પોતાને જીતતો જ જોવા માંગે છે. અને એ એમ પણ સાથે સાથે વિચારે છે કે બીજું કોઈ પણ જીતવું નહીં જોઈએ. પોતાને એકલા ને જ જીતતો જોવા આ માનવ બીજાને નુકસાન પહોંચાડવામાં પણ કોઈ જ કસર છોડતો નથી. જીતની સીડી એ એકલો જ ચઢવા માંગે છે. અને એમ જ લાગે છે કે એ પોતે જ ફક્ત જીતને લાયક છે. એ બીજાને પોતાની સાથે રાખીને પણ જીતી શકે. પણ ના, એ એની સમજણા શક્તિ ની બધી જ તાકાત બીજાને હારતા જોવામાં લગાવી દે છે. આ જીતની સીડી સર કરવા માટે એ પોતાની સૂક્ષ્મભૂત, સામ, દામ, દંડ, બેદ, પોતાના સંબંધો, બધું જ દાવ પર લગાવી દે છે.

આ જીતની સીડી, આ કાળા માથાનો માનવી સર કરીને ટોચ પર તો પહોંચી જાય છે, પણ ત્યાં પહોંચીને તે એકલો પડી જાય છે. એની સાથે, એની સફળતામાં ખુશ થનાર કોઈ જ નથી રહેતું.

નિમીષા જીજોશ કડકીઆ (મરદા)

જે જી ગોકુલના

બંધન ની કેર્મેસ્ટ્રી

આરંભ કરીએ આજની અંતર્યાત્રા

સંકલન - પ્રશાંત પરીખ

(ગતાંકથી ચાલુ)

પ્રક્રિયા સમજો

આમ, અરચિકર રૂચિકર ભાસવા લાગે છે અને રૂચિકર અરચિકર ભાસવા લાગે છે. આજે એક વસ્તુ ઈન્ડ્રિયને સુખદ લાગે છે, અનુકૂળ લાગે છે તેથી પ્રીતિકર લાગે છે પણ કાલે તે અપ્રીતિકર પણ ભાસે. સુખ દુઃખમાં અને દુઃખ સુખમાં બદલાતું રહે છે. આ પ્રક્રિયા બરાબર સમજી લઈયું તો પ્રાપ્ત પરિસ્થિતિમાં ફરિયાદ કે ફેરફાર કર્યા વિના, દુઃખથી છૂટવાની મથામણા કે સુખની માંગ કર્યા વિના શાંત ભાવે રહી શકાશે. પરિણામે સુખ-દુઃખની પાર થઈ જવાશે. આ સમજ શરીરની ભીતર રહેલા એ અનુપમ તત્ત્વ સુધી પહોંચવામાં મદદરૂપ બને છે.

તેથી સુખની આકાંક્ષા અને દુઃખને હટાવવાના ખ્યાલ ન કરો. સુખને માંગો નહીં, દુઃખને દૂર કરો નહીં. સુખને જે માંગશે અને દુઃખથી જે ભાગશે તે જીવ શરીર સાથે બંધાયેલો રહેશે. સુખની માંગ જે નહીં કરે અને દુઃખ મળે તો એનો સ્વાગત-સ્વીકાર કરે તે સાધક શરીરથી છૂટી જાય છે.

બંધનના કારણનો બોધ

સુખની અપેક્ષા અને દુઃખનો ભય ઉપયોગને શરીરની બહાર લઈ જાય છે. દુઃખમાં નિર્ભયતા અને સુખમાં નિર્મમતા શરીરની ભીતર લઈ જવામાં મદદરૂપ બને છે. જે સુખ માંગો તે બહાર સંધર્ષ કર્યા કરે છે, તેને ભીતર પ્રવેશ મળતો નથી. તેને સદા બહાર ભટકવું પડે છે - મકાનમાં, ઘનમાં, પદમાં, વ્યક્તિમાં, બીજામાં! તપનો અર્થ છે વિવિધ પરિસ્થિતિઓમાં પોતાની જાતને મૂકી ઈચ્છાનિરોધપણું ઉત્પત્ત કરવું, વધારવું, ટાકાવવું, કાચકલેશ વગેરે તપનું પ્રયોજન એ જ છે કે વિવિધ પરિસ્થિતિમાં પોતાને મૂકી એ જોવું કે પ્રતિકુળતામાં દીનતા કે અનુકૂળતામાં લીનતા થાય છે કે નહીં. ઈચ્છાનું રોધન થાય છે કે નહીં. હવે દુઃખ પડે તો પણ ફેરફાર કરીને અને બદલવાની ઈચ્છા થતી નથી. ઘણાં સુખને દુઃખમાં પલટાતાં જોયાં છે તેથી હવે પ્રતિકુળ પરિસ્થિતિમાં સુખની માંગણી કે દુઃખને હટાવવાની વૃત્તિ થતી નથી. અનેક વાર દુઃખને હટાવી હટાવીને જોવું પરંતુ તે હટતું નથી. તો દુઃખને હટાવવાની ઈચ્છા ન થવી અને સુખની માંગ ન થવી એ મોક્ષનો માર્ગ છે.

સ્વીકારભાવમાં રહેતાં યાત્રા ભીતરની તરફ શરૂ થઈ જાય છે, બહાર કોઈ સંધર્ષ રહેતો નથી. આવી અંતર્યાત્રા શરીરથી છુટકારો અપાવી શકે છે.

કર્તા-અકર્તા

સુખ-દુઃખ માટે જે વ્યક્તિ ખૂબ પ્રયત્ન કરે છે, ફેરફાર કરવાની ખૂબ યોદ્ધા કરે છે તે કર્તા બની જાય છે. જે સુખ-દુઃખ માટે કિયાઓ કરે છે, જે માંગો છે કે સુખ મને મળે અને દુઃખ ન મળે તે કર્તા છે, અને જે એમ કહે છે કે જે થયું તે ઠીક, સુખ-દુઃખમાં જે બેદ કરતો નથી, જે બન્યું તે ન્યાય સમજે છે એ અકર્તા બની જાય છે.

અને જ્યારે વ્યક્તિ અકર્તા હોય છે ત્યારે પરમાત્મા કર્તા થઈ જાય છે. પછી પોતાના હાથની રેખાઓ સાથે તે વ્યક્તિને કોઈ લેવા-દેવા રહેતી નથી. તેને ભવિષ્ય સાથે કોઈ સંબંધ રહેતો નથી. કુશળ જ્યોતિષીઓ પણ હવે તેનું ભાગ્ય ભાખી શકતા નથી. અકર્તા થવાથી તેને સુખ-દુઃખમાં કોઈ બેદ ભાસતો નથી. બંનેમાં તે નિર્દેશ રહે છે, બંનેમાં તે અસંગ રહે છે, બંનેથી તે અપ્રભાવિત રહે છે. એવી નિર્દેશપતા કે હવે જાણો કંઈ કારવાપણું રહેતું નથી!

નિયતિનો સ્વીકાર

નિયતિનો તે સહર્ષ સ્વીકાર કરે છે. ગરદન પણ કપાઈ જાય તો તે એમ વિચારે છે કે આ સમયે આ ઘટના ઘટવાની હતી, એમાં કાંઈ પણ ખોદું થયું નથી. જે થાય છે તેનાથી અન્યથા થાય એવી કોઈ ઈચ્છા તેને થયી નથી. પ્રતિકુળતામાં પણ ન તે અન્ય સામેવાળાને દોષનો કર્તા માને છે, ન પોતે કર્તાભાવમાં સરી પડે છે. તેને પરમ સ્વીકારભાવ વર્તે છે. કર્તા વિલીન થઈ જાય છે. જો તેને ઝેર આપવામાં આવે તો પણ તે એમ સમજે છે કે આ સમયે આ ઘટના ઘટવાનું અવશ્ય નિયત હતું અને તેથી તેને અન્ય પ્રત્યે વિષમ ભાવ ઉત્પત્ત થતો નથી અને પરમ સ્વીકારભાવ વર્તે છે. દોષારોપણનો ભાવ પણ સમાપ્ત થઈ જાય છે અને કર્તા-બોક્તાભાવ પણ મટી જાય છે. જે કંઈ બને છે તે પરમ નિયતિ છે એમ સમજી તે પરમ શાંતિ અને પરમ સંતોષને ઉપલબ્ધ થઈ જાય છે.

પરમ સ્વીકૃતિ - total acceptance! જે બને છે તેનાથી અન્યથા હોવાનું કોઈ કારણ જ નથી, તેનાથી અન્યથા થઈ શકે પણ નહીં, તેથી અન્યથા થાય એવી કોઈ ઈચ્છા ઉત્પત્ત થતી નથી! આ સ્વીકારભાવથી ભીતર બધી લહેરો શાંત થઈ જાય છે.

- કુમશા

જે જે જી ગોકુલશ

આજનો સત્તાંગ પુરી વિના



તારે “શ્રીનાથજી”

- (૩) પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકોરજ દ્વિભૂજ છે. જે સ્વરૂપો ચતુર્ભૂજ છે તેમાં બે ભૂજાઓ સ્વામિનીજની છે. સહસ્ર ભૂજ પ્રસારી આપશ્રીએ જે અન્જુટ આરાગ્યો છે, તાં પણ આપશ્રી તો દ્વિભૂજ છે, બાકીની ભૂજાઓ ભક્તાની છે.
- (૪) ચતુર્ભૂજ સ્વરૂપમાં સ્વામિનીજની બે ભૂજા માત્ર પદ્ધત દર્શન આપે છે, બાકીનું શ્રીઅંગ તિરોછીત રહે છે.
- (૫) સ્વરૂપાસક્તિ એ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. માદાત્ય વધારવું એ પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત નથી.
- (૬) આપણા માથે જે સ્વરૂપ બિરાજતુ હોય તે સ્વરૂપમાં જો ન્યૂનતા જોઈ, તો આપણાં બધું ઘૂળમાં મળી ગયું એમ સમજવું.
- (૭) શ્રી મહાપ્રભુજ સેવક ઉપર સ્વરૂપ પદ્ધરાવી આપણી વેળાએ પંચમૂત્ર કરાવી, આરી ભરી ભોગ ધરી પોતે પ્રસાદ સેતા આ પુરાણો પ્રત્યક્ષ છે કે શ્રી ઠાકોરજ સાક્ષાત છે, નહિતર આપશ્રી પ્રસાદ કેમ લે ? ફક્ત તારે જ પ્રસાદ ન લેવાય કે જ્યારે અનાચાર દેખાતો હોય, અને જ્યાં અનાચાર હોય તાં શ્રી ઠાકોરજ આરોગે નહિં, અને શ્રી ઠાકોરજ ના આરોગે તો પછી આપણાથી કેમ લેવાય ?
- (૮) શ્રી ઠાકોરજની બે શક્તિઓ છે, એક ઇંદ્રાશક્તિ અને બીજી કૃપાશક્તિ. ઇંદ્રાશક્તિથી સૌ જગ્યોમાં ભાગ્યનું નિર્માણ થાય છે જ્યારે કૃપાશક્તિથી જે ભોગ ભોગવાના હોય છે તે અભ્ય સમયમાં ભોગવાની દે છે અને જગ્યાને પોતાના તરફ બેંચે છે.
- (૯) એક જગ્યાનો ઉદ્ધોર કરવા માટે તે જીવ જીવાં હોય તાં શ્રી ઠાકોરજ પદ્ધરારે છે અને તેની સાથે તેવા થાંને રહે છે. જગ્યાને બે જમ્નો અંતરાય હોય તો આપ પણ બે જમ્નો અંતરાય અંગીકાર કરે છે અને આપણી વચ્ચે તેટલા સમય સુધી આપણા જેવા થાંને બિરાજે છે અને આપણા થકી સેવા સે છે.
- (૧૦) ઈન્દ્રાંદ્રે જે વૃષ્ટિ કરી તેને શ્રી ઠાકોરજને સેવા માની, કેમ કે આટલું બધું આરોગ્યાં, તો જસ પણ એટલું બધું જોઈએ ને ?
- (૧૧) પ્રભુ તો જગ્યાનું હિત જ કરી રહ્યા છે પણ દુર્ભોગ્યની વાત એટલી જ છે કે જગ્યાને આ વાતની ગમ નથી.
- (૧૨) આટલો આટલો પરિશ્રમ શ્રી ઠાકોરજને પડે છે છતાંય આપ કશું ચિત્તમાં લાવતા નથી એ બધું નિભાવી જાય છે તે શ્રી મહાપ્રભુજની કાનીથી.
- (૧૩) શ્રી મહાપ્રભુજની કૃપા વગર કિયા વધે, પણ ભાવ તો ના જ વધે. ઠાકોરજ ભસે સાતુભાવ હોય પરંતુ શ્રી મહાપ્રભુજની કૃપા વગર પ્રજલીલાનો અનુભવ તો ના જ થાય.
- (૧૪) જીવ પાસે ઠાકોરજને બીજું શું નિવેદન કરવાનું હોય ? તે તો પોતાના પાપનો ભારો અને અપરાધો જ આગળ લાવીને ધરે છે અને અગ્નિસ્વરૂપે શ્રી મહાપ્રભુજ આ બધાં પાપોને તથા અપરાધોને ભસ્મ કરી નામીને તે જગ્યાને કંચન જેવો બનાવી શ્રી ઠાકોરજ સમુખ કરે છે.
- (૧૫) શ્રી ઠાકોરજના શ્રીઅંગ ઉપર શ્રી રામંદ્રજ કૌસ્તુભ સ્વરૂપે બિરાજે છે. શ્રી વામનજ કૃપા ધંટિકા સ્વરૂપે બિરાજે છે અને શ્રી નૃસિંહજ વાઘ નખ સ્વરૂપે બિરાજે છે.
- (૧૬) શ્રી રણાંદ્રોલાલજ મહારાજે એક વાર એક માજુને પુછ્યું કે “તમારા પગ આટલા જાડા હાથીના પગ જેવા કેમ થઈ ગયા ? તો માજુએ કછું, હું પારંવાર મારા લાલજની સેવા છોડીને મનોરથમાં દોડતી એ થેમને સોછાતું નહિ તેથી તેમણે આ લીલા કરી છે તેથી હવે મારાથી ચલાનું નથી, પણ લાલજની સેવા થાય છે.”

વત્તસભજ વત્તસભ જે કહે, ઠગ ઠાકોર ઓર ચોર,
કૃપાદ્રષ્ટિ વત્તસભ કરે, તો હો જાય બેઠો પાર,
નિર્મલ મનના ભાવથી, રસના રટે યદ નામ,
તે પર સદા પ્રસન રહે, શ્રી વત્તસભ પરમ કૃપાના!

જે હે શ્રી ગાંડુલને

નાથદ્વારામાં જે સ્વરૂપ બિરાજમાન છે એ પ્રગાટ પુરુષોત્તમ

છે. કોઈ મૂર્તિ નથી. શ્રીજ પ્રગાટ સ્વરૂપે બિરાજમાન છે. દ્વાપરયુગમાં કરેલી લીલાઓ જેમકે માપણ ચોરી વગેરે કળિયુગમાં પણ કરી છે. શ્રીમહાપ્રભુજ, શ્રીગુંસાઈજના સમયમાં શ્રીજ આપણી જેમ જ હરતાં ફરતાં સૌ જોડે વાતો કરતાં. નાથદ્વારામાં શ્રીજની મૂર્તિ પ્રતિષ્ઠા નથી થઈ. પોતાનાં ભજત એવા મેવાડનાં રાજકુમારી અજબુંઘર બાઈનું વચન પાડવા શ્રીજ સ્વયં પ્રજથી નાથદ્વારા પદ્ધાર્યા છે. માટે ‘શ્રીનાથજની મૂર્તિ’ એમ ક્યારેય ન બોલાતું, આ વાતની સાપણેતી જરૂર રાખવી.

‘ગર્બ સંહિતા’ જે આચાર્ય ગર્બ દ્વારા રચિત ગ્રંથ છે. ગર્બાચાર્યજ ગોલોકધામનાં દિવ્યાત્મા અને યદૃકુળનાં રાજ પુરોહિત હતાં, એમણે ભગવાને કરેલી લીલાઓ, ગોલોકધામનું વર્ણન વગેરે જોવી ધણા ઉલ્લેખો ગર્બ સંહિતામાં કર્યો છે. શ્રીજનું પ્રાગટ્ય આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં છે અને એમની ભવિષ્યવાણી હજારો વર્ષ પહેલાં દ્વાપરયુગમાં રચિત ગર્બ સંહિતામાં જોવા મળે છે.

ગુણ લીલા એ છે કે...

જ્યારે અકૂરજ ભગવાનને મધુરા લઈ જવાં માટે આપે છે. ત્યારે નંદબાપા તો દુદ્ય પર ભાર મુકીને પ્રભુને મધુરા જવાની પરવાનગી આપે છે, પરંતુ માતા પશોદા કોઈ વાતે માનતા નથી. પ્રભુ મનાવવાના ધણાં પ્રયત્નો કરે છે. છેવે જ્યારે પશોદાજ નથી માનતા ત્યારે ભગવાન એમની સામે ઠાડા (ભાભા) રહ્યાં.

ભગવાન કહે, “માં, અત્યાર સુધી મેં કેટલીયે લીલાઓ કરી. એમાંથી આપને કઈ લીલાં સૌથી વધું પરંદ છે?”

પશોદાજ કહે, “સાતા, જ્યારે ઇન્દ્રયાગ ના બદસે ગોવર્ધનયાગ કર્યો હતો અને ઇન્દ્રદ્યે વર્ષા વૃદ્ધિ કરી ત્યારે તે ગિરિરાજ બાપાને પોતાનાં શ્રીહસ્તમાં ઊંચી પ્રજયારસીઓની રક્ષા કરી હતી એ લીલાં મને અત્યંત પ્રિય છે. ત્યારે તુ ગોવર્ધનનાથ કહેવાયો.”

પ્રભુ એ જ રીતે પશોદા માં સામે ઠાડા થયા. ડાબો શ્રીહસ્ત ઊંચો કર્યો. જમણો શ્રીહસ્ત કર્મ પર ધર્યો અને ભગવાને પોતાનાં શ્રીઅંગમાંથી જ પોતાનું એ ગોવર્ધનનાથનું સ્વરૂપ પ્રગાટ કર્યું. માતા પશોદાને કઢ્યું, માં, હું આ સ્વરૂપે તારી સાથે રહીશ. આ હું જ હું. જેમ મને લાડ લડાવતી એમ મારા આ સ્વરૂપને પણ લાડ લડાવ્યું.

જ્યાં સુધી પશોદાજ અને નંદબાપા ભૂતસ પર હતાં ત્યાં સુધી એ સ્વરૂપ એમની સાથે જ રહ્યું અને જ્યારે આપ બંને એ ભૂતસનો ત્યાગ કર્યો ત્યાર બાદ એ શ્રીગોવર્ધનનાથજનું સ્વરૂપ

ગિરિરાજ પર્વત (ગિરિરાજ બાપા) ની અંદર ગુપ્ત રીતે સમાઈ ગયું. આ રીતે શ્રીગોવર્ધનનાથજ (શ્રીનાથજ) નું સ્વરૂપ પરેખર દ્વાપરયુગમાં પ્રગાટ થયું છે, અને એ જ સ્વરૂપ આજે નાથદ્વારામાં બિરાજમાન છે.

એ કોઈ મૂર્તિકારે સિદ્ધ કરેલું સ્વરૂપ નથી.

અજબ કુંપરું કંડું પકડી ચાલ્યો મારો શ્રીનાથજ ! આ કાબ્ય ઈંદ્રીરા બેટીજાનું પ્રસિદ્ધ છે.

નાથદ્વારાના હાસના શ્રીનાથજને લાવનાર અજબુંઘરી પરમ વૈષ્ણવ થઈ ગયા. અજબુંઘરી મૂળ સિંહાં ગામના હતા. શ્રી નાથજનું પ્રાકટ્ય શ્રી ગોવર્ધનગિરિની કંદરામાંથી થયેલું છે. અજબુંઘર બાઈની ત્યાં પ્રેમ વશથી શ્રીનાથજ ચોપાત રમવા આપતા હતા. એકવાર શરત મુકી કે જે ચોપટમાં હારે તે બીજાની શરત પાણે. ચોપાટમાં શ્રીનાથજ હારી ગયા. શરત મુજબ શ્રીનાથજ એ અજબુંઘર બાઈને વરદાન માંગવાનું કહ્યું લારે અજબ કુંપરબાઈએ કહ્યું કે પ્રભુ ! દ્વે આપ પ્રજમાંથી મારે ઘેર પદ્ધારો. શ્રીનાથજએ કહ્યું કે હું પ્રજ છોડી મેવાડમાં ડેવી રીતે આવું ?

અજબુંઘર બાઈએ કહ્યું કે તમો મેવાડમાં આવો તો માડ મેવાડ પ્રજ બને શ્રી નાથજએ કહ્યું કે હું ચોપાટમાં તમોને વચન આપી ચૂક્યો છું તેથી ૧૫૦ વર્ષ પછી મેવાડ આવીશ. પ્રભુ પ્રજ છોડીને નાથદ્વારા ૧૮૮૮-૧૮૯૪ માં આવ્યા. શ્રીનાથજ પ્રથમ શ્રી ગોવર્ધન પર બિરાજ્યાં હતા તે બધા સ્થાન શ્રીગોવર્ધનનાથજ શ્રીનાથજ ચરણ ચોડી તરીકે જાણીતાં છે. સં. ૧૯૨૩ના માઘ વર્ષી સાતમીને દિવસે. શ્રી ગુંસાઈજને ત્યાં મધુરામાં શ્રી નિરઘરજ ત્યાં બિરાજ્યા. જુના જ્યાસિયર રાજ્ય (માળવા)માં ચંબસ ઉપર દોંતથારમાં શ્રીજનો રથ અટક્યો હતો. ત્યાંથી કૃષ્ણપુરી (આગ્રા) લાંથી કિશનગઢ જોધપુર (મારવાડ) ચાંપાસે માં ત્યાંથી મહારાણા રાયસિંહના સમયમાં ઉદેપુર શ્રીજ બિરાજ્યા હતા ત્યાંથી સિંહાંડમાં ઇ.સ. ૧૭૨૮ માઘ વર્દીમાં બિરાજ્યા હતા. શ્રીનાથજને મેવાડ (નાથદ્વારા) માં પદ્ધારતા ૨૯ માસ અને સાત દિવસ થયા હતા. આજે જ્યાં શ્રીનાથજ બિરાજે છે તે અજબ કુંપર બાઈની કોટી (ઘર) છે. અજબુંઘરે શ્રી ગુંસાઈજના પરમ ભગવદીય સેવક હતા. આ મંદિરે રાયસીંહજએ બનાવી સં. ૧૭૮૮ના મહાવરી ૭ ને શનિવારે ૧૦-૨-૧૭ ના રોજ ૧૦ વાગ ઉપર બેસાડ્યા. આ દિવસ પુષ્ટિમાર્ગમાં ‘શ્રી નાથજ’ પાટોસ્વપ’ તરીકે ઓળખાય છે. રંગે રંગે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. શ્રીનાથજ બાપા જ્યારે પ્રજ માંથી મેવાડ પદ્ધારતા હતા તારે એમની સાથે ગુંગાબાઈ હતા અને જે રથ માં આપતા હતા એ રથ ની આગળ મોળનાથ મસાલ ઈંડ ચાલે છે. દુર્લભ તસવીર પણ જોય શકાય છે ઠાકોરજ ની સુખ માટે મોળનાથ પણ ચાલે છે.

- તુલાર મહેન્દ્રકુમાર કક્કાંશા (બહસ)

દુનિયાનું સૌથી સારું ઘરેણું સંસ્કાર છે.

દુનિયાનું સૌથી સારું કર્મ પ્રામાણિકતા છે.

દુનિયા નો સૌથી સારો સાથી તમારો નિર્ણય છે.

તમારો સ્વભાવ એ જ તમારું ભવિષ્ય છે.

જે જે શ્રી ગાંગલંશ

રૂદ્રાક્ષની ઉત્પત્તિ અને ફળકથન



નિમીષા જીજોશ કડકીઆ (મરધા)

શિવ પુરાણ પ્રમાણે મહાદેવજી સતીના મૃત્યુની વેદના સાથે રડતા રડતા હિમાલયની સૌથી ઉંચી અને ઊડી ગુફામાં હજારો વર્ષોની સમાધિ માટે ચાલતા ગયા. ત્યારે જે જે જગ્યાએ મહાદેવજીના અશ્રુ પડ્યા, ત્યાં ત્યાં રૂદ્રાક્ષનું આડ પ્રગટ થયું. જેમાં રૂદ્રાક્ષના અલગ અલગ ફળકથન બતાવેલ છે.

એક મુખી રૂદ્રાક્ષ: આ રૂદ્રાક્ષ ધ્યાન - યોગ કરનાર, સતત કાર્યશીલ રહેતા લોકો માટે ખૂબ જ ફળદારી છે. આ ઉપરાંત સૂર્યનાં દુષ્ખભાવોને દૂર કરવા માટે આ રૂદ્રાક્ષ પહેરી શકાય છે. આ રૂદ્રાક્ષ યશ અને કિર્તી અપાવે છે.

બે મુખી રૂદ્રાક્ષ: આ રૂદ્રાક્ષ અર્ધનારીશ્વર નું પ્રતીક છે. સ્ત્રી-પુરુષના સંબંધમાં પ્રેમ અને લાગણી વધારે છે. પારિવારિક સુખ વધારે છે અને ચંદ્રના દુષ્ખભાવોને દૂર કરે છે.

ત્રણ મુખી રૂદ્રાક્ષ: આ રૂદ્રાક્ષ ધારણ કરવાથી સ્વભાવ નિર્ભય બને છે અને સાહસમાં વધારો થાય છે. હીન ભાવનાઓથી મુક્તિ મળે છે. મંગળદોષ દૂર કરવા, સારા સ્વાસ્થ્ય માટે અને પાપનું શમન કરવા આ રૂદ્રાક્ષ પહેરવો જોઈએ.

ચાર મુખી રૂદ્રાક્ષ: આ રૂદ્રાક્ષ વિધાર્થીઓ માટે સર્વ શ્રેષ્ઠ છે. ખૂદ્ધ અને સ્ભરણ શક્તિમાં વધારો થાય છે. વૈજ્ઞાનિક, કલાકાર અને લેખકો તેને ધારણ કરે તો લાભ થાય છે. આ રૂદ્રાક્ષ બુધના દોષને દૂર કરે છે.

પંચ મુખી રૂદ્રાક્ષ: તે પ્રકૃતિમાં સૌથી વધુ જોવા મળે છે. તેના સ્વામી ગુરુ છે. માનસિક સ્વાસ્થ્ય સારું રાખવાની સાથે જ અકાળ મૃત્યુથી બચાવે છે. જ્યાત્પત્ર માં સૌથી વધુ આ રૂદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે.

છ મુખી રૂદ્રાક્ષ: આ જ મુખી રૂદ્રાક્ષને વિદ્યા અને જ્ઞાનનું પ્રદાતા માનવામાં આવે છે. તે બાળકોમાં ધ્યાન અને હોશિયારી વધારે છે. તે માનસિક કાર્ય કરનારા લોકો માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. જેમકે શિક્ષક વર્ગ, વેપારી, પત્રકાર, લેખક અને સંપાદક.

આ રૂદ્રાક્ષનું સંચાલક ગ્રહ થુક છે.

સાત મુખી રૂદ્રાક્ષ: જો તમે ધનને વધારવા માંગતા હોવ તો તેને પહેરો. તે શનિ દોષને શાંત કરે છે. જો તમને વાત, વ્યાધિ, જોડોનું દર્દ સંબંધિત પરેશાની હોય, તો પણ તે કારગર રહે છે. આ રૂદ્રાક્ષને રોકડા તૃપિયાની પેટીમાં રાખવામાં આવે છે.

આચ મુખી રૂદ્રાક્ષ: ગણેશજીની કૃપાવાળું આ રૂદ્રાક્ષ કોઈ પણ પ્રકારના નવા કામ માટે સારું રહે છે. તે રાહુના દુષ્ખભાવો સામે રક્ષા કરે છે. ફેફસાં સંબંધિત વિકાર, ત્વચા રોગ, કાળસર્પ દોષ અને ઈર્ષાના દુષ્ખભાવોથી મુક્ત કરે છે.

નવ મુખી રૂદ્રાક્ષ: આ રૂદ્રાક્ષ પહેરવાથી આત્મબળ વધે છે. સહનશક્તિ, શૌર્ય અને સાહસ વધે છે. નામ અને યશ ચારેય તરફ ફેલાય છે. ભક્તિભાવ વધે છે. પેટ સંબંધી રોગ અને શારીરિક પીડાને દૂર કરે છે. કાળસર્પ દોષને દૂર કરવામાં સહાયક છે.

દસ મુખી રૂદ્રાક્ષ: આ રૂદ્રાક્ષ નવગ્રહ શાંતિ માટે સારું છે. વાસ્તુ દોષ તથા વ્યક્તિની કુંડળીમાં સ્થિત બધા દોષનું નિવારણ આ રૂદ્રાક્ષથી થાય છે. ઉચ્ચ પદાવિકારીઓ અને ઉદ્ઘોગપતિઓ માટે લાભદારી છે.

અગિયાર મુખી રૂદ્રાક્ષ: હનુમાનજીની શક્તિનું પ્રતીક છે આ રૂદ્રાક્ષ. વ્યક્તિમાં બળ અને સાહસ વધારે છે. વ્યક્તિમાં વાક્ફુશણતા અને આત્મવિશ્વાસ વધારીને પ્રસિદ્ધ અપાવે છે. બધા પ્રકારના ભયથી મુક્તિ અપાવે છે. નેત્ર અને હૃદય રોગ માટે તે લાભદારી છે.

આમ રૂદ્રાક્ષનું ફળકથન અને વર્ણન શિવપુરાણમાં જોવા મળે છે. જે ગુફામાં મહાદેવે તપસ્યા માટે આસન જમાવ્યું, એ ગુફાનું અમરનાથ તરીકે વર્ણન છે. આજે પણ હજારો ભક્તો ત્યાં જાય છે અને ધન્યતા અનુભવે છે.

.....* * *..... * * *..... * * *

દરિયાએ ઝરણાં ને પૂછ્યું,

તારે સાગર નથી બનવું કે શું...?

ઝરણાં એ ખૂબ નમૃતા થી કહ્યું,

મોટા થઈને ખારું બનવા કરતાં સારું છે,

નાનો રહીને મીઠો જ રહું...!

જે જી ગોકુલશ



રફેલ યુદ્ધ વિમાન વાયુસેનાની નવી ટાકટ

ભારતીય વાયુસેનાનું જૂનું થઈ ગયેલ મિગ - ૨૧ યુદ્ધ વિમાનની જગ્યા હવે રફેલ લડાકુ વિમાન લેશે. તાજેતરમાં જ ભારત - ફાંસ વચ્ચે થયેલા કરાર મુજબ ફાંસે ભારતને ૩૬ રફેલ લડાકુ વિમાનમાંથી ૪ આપણાને આપી દીધા છે. ત્યારે આવો, રફેલ વિમાન વિશે થોડું જાણીએ...

રફેલ લડાકુ વિમાનનો ઈતિહાસ

રફેલને ફાંસની ડેસોલ્ટ કંપનીએ બનાવ્યું છે. ૧૯૭૦ માં ફાંસની સેનાએ પોતાના જૂના થઈ ગયેલાં લડાયક વિમાનોને બદલવાની માંગ સરકાર સમક્ષ જાહેર કરી. આથી ફાંસ અને બીજા ચાર જેટલા યુરોપીયન દેશોએ એક મળ્ટી રોલ ફાઈટર કાફિટ બનાવવા માટે યોજના ઘડી, પણ સમય જતાં અન્ય દેશો ફાંસથી અલગ થઈ ગયા અને ફાંસે જ આ યોજના પર આગળ કામ શરૂ કર્યું. ડેસોલ્ટ કંપનીએ રફેલની ડિઝાઇન બનાવીને તેને તૈયાર કર્યું. રફેલે પોતાની પહેલી ઉડાન ૪ જુલાઈ ૧૯૮૯ ના રોજ ભરી.

ઉત્તેખનિય છે કે ડેસોલ્ટ કંપની ઓક્ટોબર ૨૦૧૪ સુધીમાં ૧૩૩ રફેલ વિમાનોનું નિર્માણ કરી ચૂકી હતી. વર્ષ ૧૯૮૯ માં રફેલ વિમાન ફાંસની વાયુ સેનામાં સામેલ કરવાનું હતું પરંતુ તેને વર્ષ ૨૦૦૧ માં વાયુ સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું.

રફેલ વિમાનનો ઉપયોગ અત્યાર સુધીમાં અફધાનિસ્તાન, લીબિયા, માલી અને ઈરાકના યુદ્ધમાં થઈ ચૂક્યો છે.

ભારતને આ લડાકુ વિમાનની જરૂરત કેમ પડી?

ભારતીય વાયુ સેના પાસે હાલ મિગ-૨૧, મિગ-૨૭, મિરાજ અને જગુઆર જેવાં યુદ્ધ વિમાનો છે જે જૂના થઈ ગયા છે. વાયુ સેના આ વિમાનોને અપગ્રેડ (સમારકામ) કરાવી ને તેનો ઉપયોગ કરી રહી છે. વર્ષ ૧૯૮૯ માં સુખોઈ - ૩૦ નામનું યુદ્ધ વિમાન ભારતે ખરીદ્યું જે છેલ્લી ખરીદી હતી. ત્યાર પછી કોઈ યુદ્ધ વિમાન ખરીદાયું નથી. આ માટે ૨૦૦૧ માં નવા લડાકુ યુદ્ધ વિમાનો ખરીદવા માટે સરકાર દ્વારા ટેન્કર બહાર પાડવામાં આવ્યું. આમાં અમેરિકા એ પોતાનું એફ - ૧૬, એફએ - ૧૮, રશીયા એ મિગ - ૩૫, સ્વીડને ગ્રિપિન વિમાન ભારત સમક્ષ રજૂ કર્યા. આમજ ફાંસે રફેલ વિમાન અને યુરોપીયન સમૂહે યુરો ફાઈટર ટાઇફ્ન વિમાન રજૂ કર્યા હતા. જેમાંથી ભારતીય વાયુ સેનાને રફેલ વધુ પસંદ પડ્યું.

આગામી સરકારના સંરક્ષણ વિભાગે ૩૧ જાન્યુઆરી ૨૦૧૨ ના રોજ રફેલની પસંદગીની જાહેરાત પણ કરી દીધી હતી. હવે ભારતના વડાપ્રધાન અને ફાંસના રાષ્ટ્રપતિ સાથે રફેલ લડાકુ વિમાનનો સોંદો તૈયાર થઈ ગયો અને આજે આપણી વાયુ સેનાના હાથમાં રફેલ લડાકુ વિમાનોની પહેલી ખેપ પાંચ વિમાનોની મળી પણ ગઈ ને ભારતીય વાયુ સેનાનો હિસ્સો પણ બની ગઈ છે.




જે એ ગોકુલશ

રાફ્ફેલ યુદ્ધ વિમાન વાયુસેનાની નવી ટાકટ



રાફ્ફેલ વિમાનની ખાસિયતો

રાફ્ફેલ એક બહુ ઉપયોગી યુદ્ધ વિમાન છે.	રાફ્ફેલ એક મિનિટમાં 90,000 ફૂટની ઊચાઈ સુધી જઈ શકે છે.	રાફ્ફેલ યુદ્ધવિમાન પોતાની સાથે છ જોટલી મિસાઈલ લર્ડ જઈ શકે છે.
૨૩૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે.	ફેંચ ભાષામાં રાફ્ફેલનો અર્થ 'તૂફાન' થાય છે.	તે લદાખથી કન્યાકુમારી માત્ર એક કલાકમાં પહોંચી શકે છે.
૪૦થી ૫૦ હજાર ફૂટની ઊચાઈ સુધી જઈ શકે છે.	૧૩૧૨ ફૂટ સુધીના નાના રન-વે પરથી પણ ઊડી શકે છે.	આ વિમાન કોઈ પણ અતુમાં ઊડવાની ક્ષમતા ધરાવે છે.
રાફ્ફેલ માત્ર ૨૮ કિલોમીટર પ્રતિકલાકની ધીમી ઝડપે પણ ઊડી શકે છે. આ ધીમી ગતિમાંથી માત્ર એક પલમાં તે ૨૧૦૦ કિલોમીટરની ગતિ	હવાથી હવામાં અને જમીન પરથી હવામાં હુમલો કરી શકે તેવી મિસાઈલથી સજ્જ આ વિમાન પરમાણું હુમલો કરવામાં પણ સક્ષમ	આ વિમાન પર લાગેલી 'ગન' એક મિનિટમાં ૧૨૫ ફાયર કરી શકે છે. આ ગન એક સાથે અનેક લક્ષ્યો પર નજર પણ રાખી શકે છે.
રાફ્ફેલ વિમાન પોતાની સાથે લગાભગ ૨૯૦૦૦ કિલોગ્રામનું વજન લર્ડ જવાની ક્ષમતા ધરાવે છે.	રાફ્ફેલ પાકિસ્તાનના કરાચી પર હુમલો કરી માત્ર એક કલાકમાં પાછું આવી શકે છે.	આ બે એન્જિન ધરાવતું વિમાન છે. આ વિમાન વાયુસેના અને નૌસેના બંને માટે ઉપયોગી છે.
તે ૩૯૦૦ કિલોમીટરના રેડિયસમાં (વ્યાસમાં) ગમે ત્યાં હુમલો કરી શકે છે.	એકવાર તેમાં પૂરું બળતણ પુરાવ્યાં બાદ તે ૧૦ કલાક સતત આકાશમાં ઊડી શકે છે.	આ વિમાન ભારતની વાયુસેનામાં સામેલ થવાથી તેની શક્તિમાં અનેકગણો વધારો થશે.



તેનું વજન - ખાલી હોય ત્યારે: ૮૫૦૦ કિલોગ્રામ

ભાર ઊચકવાની ક્ષમતા : ૨૪૫૦૦ કિલોગ્રામ

લંબાઈ: ૧૫.૨૫ મીટર

ઝડપ: ૨૩૬૦ કિ.મી. પ્રતિ કલાક

ક્ષમતા : ૪૦ થી ૫૦ હજાર ફૂટ ઊચે ઊડવાની ક્ષમતા ૩૯૦૦૦ કિ.મી. વ્યાસમાં ગમે ત્યાં હુમલો કરી શકે

રાફેલ ચુક્કુ વિમાન વાયુસેનાની નવી ટાકટ

ભારતના દુષ્મનનો કાળ બનશે રાફેલ લડાકુ વિમાન

હેમર મિસાઈલ સહિત આ છે ખાસ ફીયર્સ કે રાફેલનું કોમ્પ્લેટ રેડિયસ 3900 કિમી, આ મિસાઈલ આકાશમાંથી જમીન પર વાર કરવા માટે અસરકારક સાબિત થશે.

રાફેલની ગણતરી આધુનિક સમયના સૌથી શ્રેષ્ઠ લડાકુ વિમાનોમાં થાય છે ત્યારે આ સંજોગોમાં તે ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ થાય તે ખૂબ મહત્વનું કહી શકાય. તેને ભારતની જરૂરિયાત પ્રમાણે તૈયાર કરાવવામાં આવ્યા છે અને ભારતીય વાયુસેનાના અધિકારીઓ એ તેના માટે ટ્રેનિંગ પણ લીધી છે.

નોંધ:- તમારા હાથમાં જ્યોતિપુঁજ નો આ લેખ જ્યારે આવશે ત્યારે ભારતને પ રાફેલ મળી ચૂક્યા હશે.

આ લેખ ને વાંચવાની, સમજવાની સરળતા રહે તે માટે હવે પછી થી આપેલી રાફેલ વિશે ની માહિતીનું વ્યાકરણ, સ્થિતિ, કાળ વગેરે સુધાર્યા વગર જ મૂક્યું છે, તેની ખાસ નોંધ લેશો.

ભારતને આજે જે પ રાફેલ લડાકુ વિમાન મળી રહ્યાં છે તેના અંગે આટલું જરૂર જાણો.

★ ભારતને જે પાંચ રાફેલ લડાકુ વિમાન મળશે તેમાંથી ત્રણ સિંગલ સીટર છે અને બે ડબલ સીટર છે. તેમને વાયુસેનાની ગોલ્ડન એરો 99 સ્ક્રોન્ડનમાં સામેલ કરવામાં આવશે.

★ રાફેલનું કોમ્પ્લેટ રેડિયસ 3900 કિમી છે. કોમ્પ્લેટ રેડિયસ એટલે પોતાના ઉડાન સ્થળોથી દૂર જઈને સફળતાપૂર્વક હુમલો કરીને વિમાન પાછું આવી શકે તે.

★ ભારતને મળનારા રાફેલમાં ત્રણ જાતની મિસાઈલ લાગી શકે છે. હવાથી હવામાં માર કરનારી મીટિયોર, હવાથી જમીન પર વાર કરી શકે તેવી સ્ક્રેપ્ટ અને હેમર મિસાઈલ. આ મિસાઈલો વડે સજ્જ થયા બાદ રાફેલ કાળ બનીને દુષ્મનો પર તૂટી પડશે.

★ ભારતે પોતાની જરૂરિયાત પ્રમાણે તેમાં હેમર મિસાઈલ લગાવડાવી છે. HAMMER એટલે Highly Agile Modular Munition Extended Range. તે એક એવી મિસાઈલ છે જેનો ઉપયોગ ઓછા અંતર માટે કરવામાં આવે છે. આ મિસાઈલ આકાશમાંથી જમીન પર વાર કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે.

★ HAMMERનો ઉપયોગ મુખ્યત્વે બંકર કે કેટલાક ગુપ્ત સ્થાનો તબાહ કરવા માટે થાય છે. ઈસ્ટર્ન લદાખની પહાડીઓમાં આ મિસાઈલ ખૂબ ઉપયોગી સાબિત થશે.



★ રાફેલ એક મિનિટમાં 98000 મીટરની ઊંચાઈએ જઈ શકે છે. જે પાકિસ્તાનના એફ - 9 કે ચીનના જે - 20 કરતા સારો આંકડો છે.

★ ચીન સાથે ચાલી રહેલા તણાવના કારણે રાફેલને અંબાલા એરબેઝ પર ઉતારવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અંબાલા એરબેઝ ઉત્તર ભારતમાં વાયુસેનાના સૌથી મહત્વપૂર્ણ એરબેઝમાંથી એક છે. આ કારણે જરૂરત પડે તો તરત જ તેનો ઉપયોગ થઈ શકે છે.

★ ભારતને અન્ય પાંચ વિમાનો બહુજ જટી એટલે કે થોડાક જ મળીનાઓમાં મળી જશે. વર્ષ 2021 - 2022 સુધીમાં ભારતને તમામ 39 વિમાન મળી શકે તેમ લાગે છે.

સંકલન-નોંદેશ નવીન્યાંદ્ર કેસાઈ (તેલવાળા)

જે કે ગ્રી ગોકુલશે

INDIA'S NATIONAL EDUCATION POLICY 2020



NATIONAL EDUCATION POLICY 2020

COMMENTS FROM EXPERTS

- તંત્રી મંડળ

નવો અભ્યાસક્રમ પ+૩+૩+૪ શું છે? તેના વિદો માહિતી

"પ્રાચીન જ્ઞાન પરંપરાને એક કિનારે મૂકીને ભારત એક રાષ્ટ્રના ઢુપમાં સબળ નથી થઈ શક્તું."

શિક્ષણ મંત્રાલયએ વૈદિક ગણિત, ફિલોસોફી અને પ્રાચીન ભારતીય પરંપરા સાથે જોડાયેલાં વિષયોને માન આપવાનું નવી શિક્ષણનીતિમાં કહેવામાં આવ્યું છે. નવી શિક્ષણનીતિ મુજબ

"આને તાર્કિક અને વैજ્ઞાનિક આધાર તપાસ્યા પછી જ્યાં પ્રાસંગિક હશે, ત્યાં પાછયક્રમમાં સમાવવામાં આવશે."

ભારત સરકાર દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે જે રાજ્યની જે ભાષા હોય, તેજ ભાષામાં તેમને ભણાવવામાં આવવી જોઈએ અમુક કલાસ સુધી એમ કહી ને તેનો સમાવેશ કરાવવામાં આવ્યો.

નવો અભ્યાસક્રમ પ+૩+૩+૪ શું છે?

સૌથી પહેલી શરૂઆત સ્કૂલના શિક્ષણાથી કરીએ છીએ. નવી શિક્ષણનીતિમાં પહેલાં જે ૧૦+૨ ની વાત હતી, હવે તેની જગ્યાએ સરકાર દ્વારા પ્રેરિત ૪+૩+૩+૪ ની વાત કરવામાં આવી છે.

પ્રેરિત ૪+૩+૩+૪ માં પનો અર્થ છે – ત્રણ વર્ષ પ્રી-સ્કૂલના અને પછી કલાસ ૧ અને ૨, પછીના ૩ નો અર્થ છે કલાસ ૩, ૪ અને ૫, પછીના ૩ નો અર્થ છે કલાસ ૬, ૭ અને ૮, અને છેલ્લા ચારનો અર્થ છે કે કલાસ ૯, ૧૦, ૧૧ અને ૧૨.

એટલે હવે બાળકો ક વર્ષની જગ્યાએ તૃતીય વર્ષની ઉત્તેરમાં ફોર્મલ શાળામાં જશે, હાલ બાળકો ક વર્ષ પહેલા ધોરણમાં જાય છે. નવી શિક્ષણનીતિ લાગુ થયાં પછી ક વર્ષ બાળક પહેલા ધોરણમાં આવશે, પરંતુ પહેલાંના ૩ વર્ષ પણ ફોર્મલ એજ્યુકેશનવાળા હશે. પંચ-સ્કૂલના શરૂઆતનાં વર્ષો પણ હવે સ્કૂલના શિક્ષણમાં જોડાશે.

આ સિવાય સ્કૂલના શિક્ષણમાં એક બીજો મહત્વપૂર્ણ બદલાવ છે ભાષાનો. નવી શિક્ષણનીતિમાં ૩ ભાષાની ફોર્મ્યુલાની વાત કરવામાં આવી છે, જેમાં ધોરણ પાંચ સુધી માતૃભાષા/સ્થાનિક ભાષામાં શિક્ષણની વાત કરવામાં આવી છે.

સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સંભવ હોય, તો ધોરણ ૮ સુધી આ પ્રક્રિયાને અપનાવવામાં આવે. સંસ્કૃતની સાથે તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં ભણાવા પર જોર આપ્યું છે. સેકન્ડરી સેક્રેશનમાં સ્કૂલ ઈચ્છશે તો વિદેશી ભાષાનો પણ વિકલ્પ આપી શકશે.

શાળાઓનાં શિક્ષણમાં ત્રીજી વાત બોર્ડની પરીક્ષામાં ફેરફારની છે. ગત ૧૦ વર્ષોમાં બોર્ડની પરીક્ષામાં અનેક પ્રકારના પરિવર્તન કરવામાં આવ્યા છે. કયાંક ૧૦માની પરીક્ષાને વૈકલ્પિક બનાવવામાં આવી, ક્યારેક નંબરની જગ્યાએ ગ્રેડની વાત કરવામાં આવી. પરંતુ હવે પરીક્ષાની રીતમાં ફેરફારની વાત નવી શિક્ષણનીતિમાં કરવામાં આવી છે. બોર્ડ પરીક્ષા થશે, અને હવે બે વાર થશે. પરંતુ આને પાસ કરવા માટે કોચિંગની જરૂરિયાત નહીં પડે.

પરીક્ષાનું સ્વર્ણપ બદલીને હવે વિદ્યાર્થીઓની 'ક્ષમતાઓનું પરીક્ષણ' કરવામાં આવશે, ના તેમની ચાદશક્તિનું કેન્દ્રની દલીલ છે કે માકર્સનું દબાણ ઘટશે. ૨૦૨૨-૨૩ ના સત્રથી આ બદલાવને લાગુ કરવાની સરકારની આશા છે.

આ બોર્ડ પરીક્ષાઓ ઉપરાંત રાજ્ય સરકાર ધોરણ ૩, ૫ અને ૮માં પણ પરીક્ષા લેશે. આ પરીક્ષાઓને કરાવવા માટે ગાઈડ લાઇન બનાવવાનું કામ નવી એજન્સીને સૌંપવામાં આવશે, જે શિક્ષણ મંત્રાલય હેઠળ કામ કરશે.

આ પ્રકારના ફેરફાર ઉચ્ચ શિક્ષણમાં પણ કરવામાં આવ્યા છે. હવે ગ્રેજ્યુઅનેશન (અંડર ગ્રેજ્યુઅનેટ) માં વિદ્યાર્થીઓ ચાર વર્ષનો કોર્સ ભણશે, જેમાં વચ્ચે કોર્સ છોડવાની તક પણ આપવામાં આવશે.

પહેલાં વર્ષમાં કોર્સ છોડશે તો સર્ટિફિકેટ પણ મળશે, બીજા વર્ષ પછી એડવાન્સ સર્ટિફિકેટ મળશે અને ત્રીજા વર્ષ પછી ડિગ્રી, અને ચાર વર્ષ પછી ડિગ્રી હશે સંશોધનની સાથે.

આ પ્રકારે પોસ્ટ ગ્રેજ્યુઅનેટમાં ત્રણ પ્રકારના વિકલ્પ હશે.

જે જી ગોકુલશ

NATIONAL EDUCATION POLICY 2020

COMMENTS FROM EXPERTS

પણેલો હશે બે વર્ષનો માસ્ટર્સ, તેમના માટે જેમણે ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ કર્યો છે. બીજો વિકલ્પ હશે ચાર વર્ષનો ડિગ્રી કોર્સ સંશોધનની સાથે કરવાવાળા માટે. આ વિદ્યાર્થીઓ એક વર્ષનું માસ્ટર્સ અલગાથી કરી શકે છે. અને ત્રીજો વિકલ્પ હશે, પછી વર્ષનો ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામ, જેમાં ગ્રેજ્યુઅશન અને પોસ્ટ ગ્રેજ્યુઅશન બંને એક જ સાથે જઈ જશે. સંશોધનની સાથેની ચાર વર્ષની ડિગ્રી પીએચડી માટે જરૂરી હશે.

ઉચ્ચ શિક્ષણમાં સ્કોલરશિપ માટે નવી શિક્ષણનીતિમાં પ્રસ્તાવ છે. આના માટે નેશનલ સ્કોલરશિપ પોર્ટલને વિસ્તારવાની વાત છે.

ખાનગી સંસ્થાઓ, જે ઉચ્ચ શિક્ષણ આપશે તેમણે ૨૫ ટકાથી લઈને ૧૦૦ ટકા સુધીની સ્કોલરશિપ ૫૦ ટકા વિદ્યાર્થીઓને આપવાની રહેશે એવી જોગવાઈ શિક્ષણનીતિમાં કરવામાં આવી છે.

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ગ્રાન્ટ આપવાનું કામ હાયર એન્ડેજ્યુકેશન ગ્રાન્ટ કમિશન કરશે. એ ઉપરાંત તે આ સંસ્થાના અલગ-અલગ વિભાગોના નિયમ, કાયદા અને ગાઈડલાઇન બનાવશે

- તંત્રી મંડળ

ક્યારેક તમે આવો

તમે આમ કરો તો જ સારા

ક્યારેક અમે આવીએ

અમે આમ કરીએ તો જ સારા

ક્યારેક તમે કંઈક મોકલાવો

આવા સ્વભાવને હવે

ક્યારેક અમે કંઈક મોકલાવીએ

ગંગામાં પદ્ધરાવીએ

ચાલોને ચાર સ્વાર્થ વગર

નફો નુકસાન હવે જવા દો

આપણે મનથી સબંધ નીભાવિએ.

પહેલા શું થયું? રહેવા દો

હવે કેટલા વરસ જીવશું?

જીવનના અંતીમ પડાવને

ને કેટલું સાથે લઈ જશું?

સુખદ સુમનથી સજાવીએ

ઈર્ધ્યા અહુકાર મુકિને

ચાલોને “આપણા સ્વભાવને”

હૃદયથી એકમેકને સ્વિકારીએ

હવે શાંત સરળ બનાવીએ

મુક્તાંક

શ્રીજની અનછં ફૂપાથી

સ્વસ્થ છું

કોરોનાના કાળમાં પણ

બ્રહ્મ છું

કોઈ પણ વાતે નથી છું

ત્રસ્ત ને

શ્રીજના સાનિધ્યમાં

હું મસ્ત છું

~~~~~

સંસારથી વિમુખ થવાની

તક મળી

આત્માભિમુખ થવાની

તક મળી

વાચન શ્રવણ મન થયું

શાખતરો તણું

પરભવનું લાઘુ બાંધવાની

તક મળી

~~~~~

આપદાને અવસરમાં

બદલયાની તક મળી

પુરૂષાં ચારે સાધવાની

તક અનાયાસે મળી

કોરોનાના કાળમાં

અર્થ સાધવો

મુશ્કેલ છે પણ

ધર્મ કામ ને મોકા સાધવા

સુંદર તક મળી

સતિષભાઈ પરીમ (વકીલ)

જે જે શ્રી મારુલને

વાદળ

ત્રણ અક્ષરનાં આકાશો, આ બે અક્ષર વીજ,
 વાદળ થઈ ધેંરાવું તુજને ગમે ને, બે અક્ષરનો મોર છેડતો,
 સાત અક્ષરની ચીજ, ત્રણ અક્ષરનું માવહું,
 મુજ સંગ, અટકળ અટકળ રમે.

આકાશ : આકાશ આજે મન ભરીને વરસ્યું, ને ભીજાયું, ધરતીનું રોમરોમ.

રોમાંધિત થઈ ધરતીની કોર-કોર, નાચી રહ્યાં મનનાં મોરમોર.

વાદળ : કાળી ભમ્મર વાદળીએ પણ રૂપાળી કોર છે. વાદળાં કાળા ડિબાંગ થઈ જાય ને વર્ષાનાં આગમનનાં સમાચાર સાંભળતા જ, આકાશ તરફ મીટ માંડતા, ખેડૂતોનાં મોઢે હરખ દેખાય. રોજ જેની રાહ જોતાં તાં, જેનાં પર ખેડૂતોનું તકદીર છે એ વાદળાં આજ તો જરૂર વરસણો. વાદળની ધન્યતા વરસવામાં છે.

વાદળા જ્યાં સુધી જળસંગ્રહ કરે છે. ત્યાં સુધી જ કાળા છે, જળ વરસતાં જ ઉજળા બને છે. પ્રકાશ પાથરે છે. આપણો બોલીએ છીએ, એ કાળા ડિબાંગ વાદળા બરાબર છે, ઓળખવામાં થાપ ખાઈ જઈએ છીએ. વરસ્યા પછી ઊજળા બને છે એ કામ બોલે છે.

વાદળા : મનમૂકીને વરસીને, ધરતીને લીલીછમ બનાવી દેવા બદલ ચારેય બાજુથી ધન્યવાદ પામતાં વાદળોને, કદાચ ખબર પણ નથી હોતી કે આ ધન્યવાદનો સાચો યશભાગી તો સૂરજ છે કે જેનાં કારણે અમારું અસ્તિત્વ સંભવિત બન્યું છે.

-સંકલન

અંધળી માનો કાગળ

અમૃત ભરેણું અંતર જેણું, સાગર જેયું સત્ત
 પૂનમચેંદના પાનિયા આગળ ડોશી લખાવતી ઘત,
 ગગો એનો મુંબદી કામે; ગીગુભાઈ નાગાજ નામે. ૧
 લખ્ય કે, માડી ! પાંચ વરસમાં છોંચી નથી એક પાઈ,
 કાગળની એક ચબરખી પણ, મને મળી નથી, ભાઈ !
 સમાચાર સાંભળી તારા; રોણું મારે કેટલા દા'ડા ? ૨
 ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેણો થાય,
 એ આપો જાય દાડિયું પેંચવા, રાતે છોટામાં ખાય,
 નિત નવાં લૂગડાં પેરે, પાણી જેમ પૈસા વેરે. ૩
 છોટસનું આણું ખાઈશ મા, રાખજે ખરચીખૂટનું માપ,

દવાદાઝા દોકડા આપણો કાઢશું ક્યાંથી, બાપ !
 કાયા તારી રાખજે ઝડી; ગરીબની ઈજ છે મૂડી. ૪
 ખોરડું વેચ્યું ને પેતર વેચ્યું, કૂખામાં કર્યો છે વાસ,
 જારનો રોટલો જડે નહિ તે દિ' પીઠે છું એકલી છાશ,
 તારે પડવાનું ભાણું; મારે નિત જારનું ખાણું. ૫
 દેખતી તે દિ' દળણાં - પાણી કરતી ઠમેઠામ,
 અંખ વિનામાં આંધળાને દેવે કોઈ ન આપે કામ,
 તારે ગામ વીજળીદીવા, મારે આંદી અંધારાં પીવાં. ૬
 લિખિતંગ તારી આંધળી માના વાંચજે આજા જુદાર,
 એકે રહ્યું નથી અંગનું ઢાકણ, ખૂટી છે કોઈએ જાર,
 દેવે નથી જગવા આરો, આવ્યો ભીખ માંગવા વારો. ૭

ઇંડિસાલ ગાંધી - સંકલન

દે દે ગી ગોકુલનાથ

પ્રેરક પ્રસ્તુતિ

‘વિચાર મંથન’ - શ્રી સતીશભાઈ

આટલો પ્રેરક દીક્ષણે કર્યો હોત તો?

સંત તુલસીદાસના જીવનનો આ પ્રસંગ છે.

તુલસીદાસનાં નવાં નવાં લખ થયેલા. એમની પત્ની રત્નાવલી થોડા દિવસ માટે પિયર ગયેલી. તુલસીદાસથી પત્નીનો વિરણ સહન ન થયો ને રાતે જ રત્નાવલીને મળવા નીકળી પડ્યા.

હવે એ ચોમાસાના દિવસો હતા. ધોઘમાર વરસાદ વરસતો હતો. નદીમાં પૂર આવેલું. તુલસીદાસે એમાં ઝંપલાબ્યું ને નદી તરીને સામે પાર ગયા. સસરાના ઘરે રાત્રે બારાણું ન ખખાડવતાં ઝાડ પર ચકીને રત્નાવલીના ખંડમાં જવાનો નિશ્ચય કર્યો. સાપને દોરડું માનીને એ પકડી તુલસીદાસ રત્નાવલીના ખંડમાં ગયા.

રત્નાવલીને નવાઈ લાગી કે આટલી રાતે વરસતા વરસાએ કેવી રીતે આવ્યા? ને શું કામ આવ્યા? તુલસીદાસે બધી વાત કરી.

રત્નાવલી કહે "મને મળવા આટલી મહેનત કરી એનાથી અદ્ધી મહેનત કરી હોત તોયે ભગવાન મળી ગયા હોત."

તુલસીદાસની આંખો ઉઘડી. તેમને સાંસારિક પ્રેમની વર્થતા અને નશ્શરતા સમજાઈ. તાત્કાલિક ત્યાંથી ચાલી નીકળ્યા અને સંસાર ત્યાગ કરી સંન્યાસની દીક્ષા લીધી.

પગાર કેટલો હોવો જોઈએ?

જાણીતા અણુવિજ્ઞાની આઈન્સ્ટાઇનના જીવનની શરૂઆતનો આ પ્રસંગ છે.

આઈન્સ્ટાઇનને પ્રિન્સટન યુનિવર્સિટીમાં જોડાવાનું આમંત્રણ મળ્યું. સંશોધન માટેની પૂરતી સગવડ મળે એ માટે આઈન્સ્ટાઇને ત્યાં જોડાવાનું સ્વીકાર્યું. એ વખતે પણ આઈન્સ્ટાઇન વિજ્ઞાની તરીકે જાણીતા હતા. યુનિવર્સિટીના અધ્યક્ષે કહ્યું કે, "તમારે જેટલો પગાર જોઈએ તેટલો અહીં લખો. યુનિવર્સિટી તે આપવા તૈયાર છે."

આઈન્સ્ટાઇને એક રકમ લખી એટલે અધ્યક્ષે કહ્યું કે, "આટલો પગાર તે લખાતો હોશો?"

આઈન્સ્ટાઇન કહે, "લાવો તેમાંથીય થોડીક રકમ ઓછી કરી નાખું."

અધ્યક્ષ કહે, "હું રકમ ઘટાડવાનું નથી કહેતો. તમે જે રકમ લખી છે એટલી તો અમે ચુનિવર્સિટીના મામુલી કારકૂનને આપીએ છીએ.

પછી અધ્યક્ષે એ રકમની આગળ એક મીઠું વધારીને રકમ દસ ગણી કરી નાખી અને એટલો પગાર આઈન્સ્ટાઇન માટે નિયત થયો.

સુખ-સગવડો અમુક હેઠે જરૂરી છે. પણ એના કરતાં વધારે હોય તો સર્જક-સંશોધકના કામમાં વિદ્ધનો ઊભા કરે છે.

એક રાતની વાત

વરસમાં એક જ વાર એક રાત માટે ખીલતા બ્રહ્મકમળ નામના ફૂલને જોવા હું ગયો. મને થયું, કેવું કહેવાય? વરસમાં એક જ વાર ખીલે, એ પણ થોડા કલાકો માટે?

બ્રહ્મકમળ કહે, "મને તો આનંદ છે ભલેને થોડા સમય માટે, પણ દુનિયા તો જોવા મળે છે ને!"

મેં કહ્યું, "પણ આટલા સમયમાં શું ખીલવું ને શું જોવું? એમાંય તારું કોઈ ખાસ રૂપ નહીં."

"તોય બધા મને જોવા આવે છે ને!" બ્રહ્મકમળે કહ્યું "આખું વર્ષ ખીલતાં ફૂલો જોવા ખાસ કોણ જાય છે?"

"એ વાત સાચી, પણ તને ટ્યૂકી આવરણનો અફ્સોસ થતો નથી?" – મેં પૂછ્યું.

"ઉપરથી હું તો ખુશ છું કે આટલા થોડા સમય માટે પણ હું વાતાવરણને મારી સુગંધથી મહેકાવી શકું છું." બ્રહ્મકમળ કહે, "તમે અફ્સોસ કરવામાં સમય વેડફ્ફવાને બદલે જે મળ્યું છે તે માણો ને? નહીં તો એટલુંચ નહીં થઈ શકે."

મને થયું કે એની વાત સાચી છે ને મેં દ્યાનથી એનું નિરીક્ષણ કરવા માંડયું. એને જેમ દ્યાનથી જોતો ગયો એમ હું મુગધ બનતો ગયો. સફેદ રંગના જ વિવિધ 'શેડ' બ્રહ્મકમળમાં જોવા મળ્યા. એની વાત સાચી હતી. આપણે સામે જે છે એને માણવાનું જ ભૂલી જઈએ છીએ ને નકામી પાતોમાં અટવાયા કરીએ છીએ.

.....* * *

જે કે જી ગોકુલના

સંગીત ના સ્થાનો

સંગીતનાં વાજિંત્રોની સુરીલી સરવાણી

ગુગલ ઉપરથી સંકલન

દસ્તે - નિલેશ નવીનચંદ્ર દેસાઈ (તેલવાળા)

(ગતાંકથી ચાલુ)

રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર અછા સિતારવાદક હતા તેમ દિલીપકુમાર પણ સિતાર વગાડી જાણો છે. ૧૯૬૦માં ૨૪ થયેલી ફિલ્મ 'કોહિનૂર'માં શાસ્ત્રીય રાગ હમીર પર આધારિત મધુબન મેં રાધિકા નાચે રૈ ગીતમાં ઉસ્તાદ અખ્ટુલ હલીમ જાફરખાંએ સિતાર વગાડોલી એટલે નિર્દેશકે શૂટિંગમાં એ સંગીતકારના હાથ સિતાર વગાડતા હોય એવા કલોઝઅપ દૃશ્યો લેવાનું નક્કી કર્યું. પરંતુ દિલીપકુમારે જાતે સિતાર વગાડવાનું બીજું ઝડપી લીધું. ત્રણેક અઠવાડિયાં પછી ગીતના શૂટિંગ માટે દિલીપકુમાર આવ્યા ત્યારે હાથની આંગળી પર પાટા બાંધેલા હતા. અખ્ટુલ હલીમ જાફરખાં પાસે સિતારના એ મુશ્કેલ ટુકડાની રોજના દસ દસ કલાકની પ્રેક્ટિસ કરવા જતાં એની આંગળીઓ ચિરાઈ ગઈ હતી. એના પરથી ખ્યાલ આવશે કે સિતાર-સરોદ જેવાં વાજિંત્રો કેટલી મહેનત માગી લે છે !

ઉસ્તાદ વિલાયત ખાંએ તો પોતાની સિતાર અને ઉસ્તાદ બિસ્મીલ્લા ખાંની શરણાઈની ખાસ જુગલબંદી યોજીને અલ્દૃત કાર્યક્રમ ૨૪ કરેલો. એ જમાનામાં એચ.એમ.વી. કંપનીએ એ જુગલબંદીની ખાસ રેકર્ડ બહાર પાડી હતી. ઉસ્તાદ બિસ્મીલ્લા ખાં રિયાક્ઝને તપસ્યા ગણી કાશી વિશ્વનાથ મંદિરમાં રોજ મધ્યરાત પછી શરણાઈ વગાડવા જતા.

મંદિરો અને ચોઘડિયાં તરીકે શ્રેષ્ઠીઓને ત્યાં વાગતી શરણાઈને બિસ્મીલ્લા ખાને શાસ્ત્રીય સંગીતની મહેફુલોમાં ગૌરવભર્યું સ્થાન અપાવ્યું. ખાંસાહેબ પહેલીવાર યુરોપના પ્રવાસે ગયા ત્યારે ત્યાંના સેંકડો લોકોએ કાર્યક્રમ પછી સ્ટેજ પર આવીને ખાંસાહેબની શરણાઈની ફેરવી ફેરવીને તપાસી જોયેલી - આમાંથી આવું મધુર સંગીત શી રીતે સર્જય છે? થોડા વર્ષ પહેલા રોજ સવારે છ વાગ્યે આકાશવાણી (રેડિયો) પર 'મંગલ ધવનિ' માં બિસ્મીલ્લા ખાંની શરણાઈ સાંભળવા મળતી હતી. ખાંસાહેબ દમના વ્યાધિનો ભોગ બન્યા છે. પરંતુ એકવાર શરણાઈ વગાડવા બેસે ત્યારે વ્યાધિ-ઉપાધિ બધું ભૂલી જાય છે. તેમના ભત્રીજા અલી અખ્ભાસે વાતવાતમાં કહ્યું : 'ધતૂરાના આડની લાકડીમાંથી બનતી શરણાઈ કેટલા મધુર સ્વરો છેડે છે! ધતૂરો સ્વાદમાં કડવો અને તીખી વાસ ધરાવતો હોવા છતાં

કર્ણાંપ્રિય સંગીત ઉત્પત્ત કરે છે!

બિસ્મીલ્લા ખાન બનારસના હોવાથી બનારસમાં બનતી શરણાઈ સારી ગણાય છે. જો કે આસામ બાખ્યુ તરીકે ઓળખાતા વાંસમાંતી પણ શરણાઈ બને છે. અલહાબાદ તરફ જંગલી લાકડાની અને હવે તો સાગની પણ શરણાઈ બને છે. અલબત્ત, શરણાઈનું વેચાણ વધુ થતું નથી કારણ કે બિસ્મીલ્લા ખાન તો એકાદ સદીમાં એક જ પેદા થાય. આટલી સિદ્ધિ છતાં બિસ્મીલ્લા ખાન ઘણીવાર કહે છે : 'રસોઈ, રાગ ઔર પાદ (પાઘડી) કબી કબી બન જત હૈ!

રોજ ઘરમાં દાળ બનતી હોવા છતાં રોજેરોજ તેનો સ્વાદ સરખો છોતો નથી. તેમ કુશળ કલાકાર પણ કાયમ એક સરખું સંગીત પીરસી શકતો નથી. સંગીતનો ઉદ્ય તો માનવીના હૃદયમાં થાય છે એ મદ્ધામૂલ સત્ય સમજાવતાં બિસ્મીલ્લા ખાને કહ્યું છે - 'અંતરમે હો તો જંતરમે આતા હૈ! માણસ ઉદાસ હોય તો તેને ગંભીર રાગની અસર વધુ થાય. જોગિયા નામના રાગની 'પિયા મિલન કી આશા' હુમરીમાં વિરહિણી સ્ત્રીની મનોવેદના વ્યક્ત કરતા ઘણીવાર ટોચના ગાયક પંડિત ભીમસેન જોશી પોતે રડી પડે છે.

સિતાર અને વીણા વચ્ચેનું ગણી શકાય એવું એક વાજિંત્ર સરોદ છે. આ વાદ્ય આરબ રાષ્ટ્રોમાંથી આપણે ત્યાં આવ્યાનું મનાય છે. અરબી પ્રજા તેને રબાબ કહે છે. રબાબમાં તારી તરીકે બકરીના આંતરડાની નસો વપરાય છે. એમાંથી ઊપજતાં સ્વરોમાં સિતારનું માધ્યર્થ અને વીણાનું ગાંભીર્ય બંને અનુભવી શકાય છે. કેટલાકના મત મુજબ એ વગાડવાનું મુશ્કેલ છે કારણ કે સિતારમાં સ્વરોનું સ્થાન દર્શાવતા પિતળના પડતા હોય છે. સરોદમાં સખત મહેનત કરીને વાગડનારે અંદાજથી સ્વર પકડવાના હોય છે. એટલે 'કાન પાકા હોય' તો જ સરોદ વગાડી શકાય. રવિશંકરના સાણા એટલે કે ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાંના પુત્ર અલી અકબર ખાં ટોચના સરોદવાદક ગણાય છે. ઉપરાંત ઉસ્તાદ અમજદ અલી ખાં પણ મોખરાના સરોદવાદક છે.

'અમેરિકી ટેલિવિઝન સંસ્થાએ જે ચાર ભારતીય સંગીતકારોના જીવન અને સંગીત વિશે ખાસ દસ્તાવેજુ ફિલ્મ ઉત્તરી છે તેમાં ઉસ્તાદ બિસ્મીલ્લા ખાં અને ઉસ્તાદ અલી અકબર ખાંનો સમાવેશ છે.'

લગભગ દરેક મરાઠી તથા દક્ષિણીના ઘરમાં હોય છે એ વાદ્ય એટલે હાર્મોનિયમ. મૂળ પરદેશના એવા આ વાદ્યની આજે કદાચ

જે જે ગોકુલનાં

સંગીત ના સ્થાયનો

સૌથી વધુ બોલભાલા છે. રામલીલા હોય, ભવાઈ હોય, નાટક હોય, ભજન-ગગ્ઠ કે કીર્તન હોય યા શાસ્ત્રીય સંગીતની મહેફિલ હોય હાર્માનિયમ વિના કોઈનું કામ થતું નથી.

જો કે ૧૯૪૮ સુધી આકાશવાણી પર શાસ્ત્રીય ગાયનના કાર્યક્રમમાં હાર્માનિયમના ઉપયોગ પર પ્રતિબંધ હતો. સંગીતના ઉત્સાદો પોતાના શિષ્યોને કહેતા : 'હાર્માનિયમ સે દૂર રહેના. હાર્માનિયમ સંગીતદ્રોહી હૈ'! હાર્માનિયમ શા માટે સંગીતદ્રોહી ગણાયું છે એ સમજવા તેની રચના સમજવી જોઈએ. હોર્માનિયમનું મૂળ છે શેંગ તરીકે ઓળખાતું ચીની વાદી. એ શેંગ મોઢેથી વાગતા માઉથ ઓર્ગન જેવું એક ટયૂકડું વાદી હતું. એમાં એક બાય છ ઈંચની લાકડાની ખોલી વચ્ચે 'રીડ' તરીકે ઓળખાતા પિતળના સૂરની પતરી ધૂજે અને એ ધૂજારી થી સ્વર પ્રગટે.

માઉથ ઓર્ગન વગાડનારને લાંબો સમય શાસ રોકવાની પ્રેક્ટિસ કરવી પડતી એટલે ઈ.સ. ૧૯૭૮માં વિયેનાના એક કલાકાર અનેન્ટ હેકીલે વિચાર આય્યો કે હાથ કે પગની ધમણાથી હવા પૂરીને વગાડી શકાય એવું વાજિંત્ર કેમ ન બનાવવું? એમાંથી હાર્માનિયમનો જન્મ થયો. (હાર્મની એટલે સ્વર-સંવાદ). હેકીલના રીડ ઓર્ગનમાં સુધારાવધારા કરીને ૧૯૮૦માં પેરિસના વિકટર મુસ્તેલે બનાવેલું વાજું વધુ લોકપ્રિય થયું.

એક ફૂટ બાય દોઢ ફૂટની સાગાની પેટીના તળિયે એક મજબૂત સ્પ્રિંગ ગોઢવામાં આવે જે ધમણા દ્વારા અંદર આવતી હવાને દબાણપૂર્વક ઉપરની તરફ ધકેલે. વગાડનાર જે સફેદ-કાળી પર્ચી દબાવે તે સ્વિચના નીચે પિતળનું રીડ બોર્ડ હોય. ધમણા ખેંચીને હવા ભરે એ હવા રીડની પતરીને ધૂજારી આપે અને એ સૂર સ્વિચના છિદ્રમાં થઈને મધુર અવાજ તરીકે બહાર આવે.

આપણે ત્યાં પેરિસ-અમેરિકાથી હાર્માનિયમ કચારે આવ્યું તેનો ચોક્સ ઈતિહાસ મળતો નથી પણ ફિલ્બ સંગીતના બીખ્પિતામણ જેવા સંગીતકાર 'નૌશાદના' કહેવા પ્રમાણે ગ્રામોફોન કંપની (એચ.એમ.વી.) એ પોતાની રેકડોનું વેચાણ વધારવા ભારતના સ્થાનિક કલાકારોનું રેકોર્ડિંગ શરૂ કર્યું ત્યારથી એટલે કે ૧૯૮૫-૮૦ની આસપાસ કે વધુમાં વધુ ૧૯૦૦માં હાર્માનિયમ અહીં આવ્યું. ૧૯૭૧-૧૩માં દાદાસાહેબ ફાળકેએ મુંગી ફિલ્બો બનાવવા માંડી તેની સાથે વાજાપેટી કે પગાપેટી તરીકે ઓળખાતું હાર્માનિયમ જાણીતું થયું. હાર્માનિયમ બનાવામાં મોટી કાન્તિ મુખેઈમાં ડી.એસ. રામસિંઘ કંપનીવાળા

માસ્ટર દયાસિંધે કરી. જ્યારે તમે મહેમદ રફી, મુકેશ, મત્રા કે, હેમંતકુમાર, મહેંદી હસન, ગુલામ અલી કે લેસ્ટરના ચંદુભાઈ મટાણીના કોઈ કાર્યક્રમનો ફોટો જુઓ તો હાર્માનિયમ પર ડી.એસ. રામસિંધની કંપનીનું નામ જોવા મળશે.

મુળ અમૃતસરના દયાસિંધ કોઈ વાજિંત્રની દુકાનમાં નોકરી કરતા ત્યાંથી હાર્માનિયમ બનાવવા શીખ્યા અને તેમણે કરેલી કાંતિની નકલ દેશમાં બધે થવા લાગી. ૧૯૩૮-૪૦ની આસપાસ તેમણે 'સ્કેલ ચેંજર' નામે ઓળખાતું હાર્માનિયમ બનાવ્યું. એમાં ગોઢવેલું રીડ બોર્ડ ગાયકની અનુકૂળતા મુજબ ડાબે જમણે સરકી શકે એટલે કે સૂરો ઊચાનીયા થઈ શકે છે. એથી કોઈ પણ ગાયકના ગળાને એ ફિંક થઈ શકે છે.

દ્વાલ દયાસિંધ તો હૃદાત નથી પરંતુ તેમના વારસદારો કિસનસિંધ, પરમજિતસિંધ અને પવનસિંધ એ પ્રકારના હાર્માનિયમ બનાવે છે. ત્યાર પછી સૂટકેશ જેવી ફોલિંગ બેગ જેવું હાર્માનિયમ બનાવવાનો યશ કલકત્તાની પોલ એન્ડ કંપનીને ઘટે છે. આવાં હાર્માનિયમ કોઈ પણ કલાકાર એકલપંડે બિજાની મદદ વિના ગમે ત્યાં લઈ જઈ શકે છે.

હાર્માનિયમમાં વપરાતાં રીડ બોર્ડ આખા હિન્દુસ્તાનમાં સર્વશ્રેષ્ઠ કપોલિટીના પાલિતાણામાં બનતા હતા કે હજુ બને છે, એ જાણીને ગુજરાતીઓ જરૂર ગૌરવ અનુભવશે. જૈનોના તીર્થધામ સમા પાલિતાણામાં રીડ બોર્ડ બનાવવાનો ફુટિર ઉદ્યોગ છે. આમાં પૂરેપૂરી હાથની કારીગરી છે. મશીનથી કંઈ પણ બનતું નથી. રીડ બોર્ડ બની જાય તો કોઈ પણ કારીગર હાર્માનિયમ બનાવી શકે કારણ કે બાકીનું કામ તો મિસ્ત્રી કે સુથાર જેવું હોય છે.

હાર્માનિયમમાં વપરાતા આ પિતળના રીડ બોર્ડને સંગીતના વિદ્વાનો ટેન્ચર્ડ સ્કેલ (વિકૃત સપ્તક) કહે છે. એની ગમે તે સફેદ-કાળી ચાવીને 'સા' ગાણીને માણસ ગાઈ શકતો હોવાથી કે એનો બદજ સ્થિર હોતો નથી એવા કારણસર સંગીતકારો તેને સંગીતદ્રોહી કહે છે.

તો પછી ગાયક બનવા ઈચ્છનારે શું કરવું? 'તાનપુરા સાથે ગાઓ' એમ વિદ્વાનો કહે છે.
તાનપુરો નારદીય વિણાનું આધુનિક સ્વરૂપ છે. એ ચાર તારવાળી વીણા છે. એમાં પણ તાર બદજના અને એક (રાગ અનુસાર) મદયમ (મ) કે પંચક (પ)નો હોય છે. બે પિતળના અને બે લોઢાના તાર એમાં વપરાય છે. મુંબઈમાં તો માત્ર બી.ડી વૈદ્ય નામની કંપની આ વાજિંત્રોના તાર બનાવે છે. તંબુર નામના દેવ હતા તેમના નામ પરથી નારદીય વીણાને તંબુર અથવા તાનપુરો કહે છે. પાશ્વાત્ય

જે જે ગોકુલને

સંગીત ના સ્વધનો

સંગીતજ્ઞો જેને વોઈસ કલ્યાર કહે છે એ ગળાનો સ્વર પાકો કરવા તાનપૂરો અનિવાર્ય ગણાય છે. ગાનારના ગળાની તાનમાં સાથ આપે તે તાનપૂરો. અગાઉના ગાયકોએ તાનપૂરાથી જ પોતાના કંઠને બુલંદ બનાવેલા. સંગીતમાર્ટ પંડિત ઓમકારનાથ ઠાકુરના અવાજમાં તો એટલું ઓજ (તેજ) પ્રગટેલું કે એક સાથે ચાર તાનપૂરા છેડાતા હોય અને પંડિતજી ફક્ત પ્રથમ સ્વર સા ગાવાની શરૂઆત કરે એ સાથે બધા તાનપૂરાનો અવાજ દબાઈ જાય. એ જ રીતે પંડિતા ગુરુ વિષણુ દિગંબર પળુસ્કરજીનો અવાજ એવો બુલંડ કે ૧૯૮૮માં કૌંગ્રેસના લાણોર અધિવેશન વખતે ૨૫૦૦૦ની મેદની સમક્ષ તેમણે માઈક વિના 'વેંડે માતરમ' ગાયેલું જે છેલ્લી હોળમાં બેઠેલા માણસને પણ સંભળાયું. વોઈસ કલ્યાર (કર્કસંસ્કાર)ની ભારતીય પદ્ધતિ એટલી સચોટ છે કે બેજુ બાવરા ફેમ ઉત્તાદ અમીર ખાં અને મુગાલે આઓમ ફેમ ઉત્તાદ બર્ડ ગુલામ અલી ખાં અગાઉ સંગીતવાદક હિતા તે તાનપૂરા પર રિયાઓ કરીને ટોચના ગાયકો બની શક્યા.

દ્વાર્માનિયમ પછી સૌથી વધુ વેચાણ દેશમાં તાનપૂરાનું થાય છે. એટલું જ નહીં, દ્વાર્માનિયમ કરતાં તાનપૂરો સસ્તો છે. મુંબઈ, પૂના તથા બેંગલોરમાં હું ચે ૮ થી ૧૦ ઈંચના ઈલેક્ટ્રોનિક તાનપૂરા પણ મળે છે. પ્લાગમાં ભરાવી બટન દબાવી તેને રહાઅણાતો કરી શકાય છે. હિન્દી ફિલ્મોના ટોચના સંગીતકાર સી. રામયંદ્રના આસિસ્ટન્ટ રહી ચુકેલા દત્તા ડાવજેકરના દીકરાએ મુંબઈમાં આવા ઈલેક્ટ્રોનિક તાનપૂરા બનાવ્યા હતા.

શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત બંનેના ગાયન-નર્તનમાં અનિવાર્ય ગણાતું વાજીંત્ર છે સારંગી. કેટલાક વિદ્વાનો એને ઝડ્પ વીણાનું હાલનું સ્વરૂપ ગણાવે છે. કદમાં આ વાદ્ય વીણા કે સિતાર કરતાં નાનકડું છે. પરંતુ એ કોઈ પણ ગાયકના કંઠીની છૂભહૂ નકલ કરી શકે છે. સારંગીનું સંસ્કૃત નામ કિતરી છે. નાનકડી તુંબી પર ચામડું મહેલું હોય તેના પર હાથીદાંતની ધોડીને આધારે તાર બાંધવામાં આવે છે. તેના ઉપરના તાર બકરાના આંતરડાની નસમાંથી બને છે.

તમામ ભારતીય વાદોમાં વીણા પછી આ વાદ્ય વગાડવાનું સૌથી મુશ્કેલ કામ છે. તેની દાંડી ટૂંકી-બેઠી દડીની પણ પહોળી હોય છે. ધોડાના વાળમાંથી બનતા ગજ દ્વારા તેને છેડવામાં આવે છે. જમણો હાથ જ છેડે છે અને ડાબો હાથ પરદા વગરની દાંડીમાં છુપાયેલાં સ્વરસ્થાનો પર અંગળીનાં ટેરવાં તથા નખની વચ્ચેનો હિસ્સો દબાવીને સ્વર ઉત્પત્ત કરે છે. તારને નખનો સ્પર્શ થતાં મધુર સ્વર નીકળે છે.

અગાઉ રાજ્યદરબારોમાં થતા નૃત્યના કાર્યક્રમમાં સારંગીની સંગત થતી. જો કે એ વાદકોનું બહુ માન નહોતું એ કારણસર કેટલાક નામી વાદકોએ સારંગી વગાડવાનું છોડી દીદ્યું. મૂળ રાજ્યસ્થાનના પંડિત રામ નારાયણ આજે દેશના ટોચના સંગીતવાદક છે જેઓ કોઠાનું સાજ ગણાતી સારંગીને સંગીત મહેફુલમાં લઈ આવ્યા. જો કે તેમનો પુત્ર બ્રિજનારાયણ સારંગીને બદલે સરોદ વગાડે છે. બીજુ બાજુ તેમનાં પુત્રી ઈન્દ્રા પિતાના પગલે સારંગી વગાડે છે. આજકાલ સંગીતનું બહુ વેચાણ નથી કારણ કે ખૂબ ધીરજ અને મહેનત માગી લેતું એ સાજ છે.

ઉત્તાદ બર્ડ ગુલામઅલી ખાં એક જમાનામાં બેગમ અખ્તર સાથે સારંગી વગાડતા. એકવાર અખ્તરીબાઈ તેમને ગાતાં સાંભળી ગયા અને સલાહ આપી કે તમારું ગળું સારું છે માટે સારંગી છોડીને ગાવા માંડો. બર્ડ ગુલામઅલીએ તપશ્ચર્યા આદરી અને આપણને ઉત્તમ ગવૈયો મળ્યો. એ જ રીતે અમીરખાં પોતાના પિતા શાહમીર ખાં પાસે સારંગી શીખતા. એકવાર શાહમીર ખાંના કોઈ શિષ્યે મેણું માર્યું કે સારંગી તો કોઠા પર બેસીને વગાડવાનું સાજ છે. શાહમીર ખાંને બહુ ખરાબ લાગ્યું. તેમણે કંઈક કરી બતાવવા બીજું ઝડપ્યું. સારંગી પોતાના ખાનદાનનું પેઢીઓ જૂનું સાજ હોવા છતાં તેમણે પુત્ર અમીર ખાંને ગાયનની તાલીમ આપી. પાછળથી અમીરખાં ચુગસર્જક ગાયક બન્યાં.

અને છેલ્લે મૂંદંગ, તબલાં તથા પખવાજ, પુરાણા કથા પ્રમાણે ભગવાન શંકરના ડમરુ પરથી ગણપતિએ પહેલીવાર મૂંદંગ બનાવેલો. એક લંબગોળ નળી જેવા સાગના લાકડાની બે બાજુ જનાવરનું ચામડું મઢીને આ વાદ્ય બને છે. એક તરફ સાંકડા મોઢાવાળી બાજુએ ચામડું તંગ-ઢીલું કરીને એને ગાયક વાદનના સ્વર સાથે મેળવી શકાય છે. જેને માદા ગણવામાં આવે છે. બીજુ બાજુ પહોળા મોઢાવાળા ચામડા પર ચોખા કે ઘઉંના લોટની લુગાદી મૂકી ત્યાંથી ગંભીર ધ્વનિ પેદા કરાય છે, જે બાયું કહેવાય છે. મૂંદંગ સૌથી પ્રાચીન ગણાતા વાદોમાં છે. બંગાળ અને ઈશાન ભારત તરફ એનું અંગ લાકડાને બદલે માટીનું બનાવે છે. રામાયણ, મહાભારત અને કાલિદાસનાં નાટકો સુદ્ધાર્માં મૂંદંગના ઉલ્લેખ છે.

સિતાર શોધક મનાતા અમીર ખુસરોને કેટલાક વિદ્વાનો તબલાં બનાવવાનો યથ આપે છે. તેણે મૂંદંગના બે ભાગ કરીને તબલાં બનાવ્યાની વાત છે. એક લોકકથા પ્રમાણે અકબરના દરબારમાં બે મૂંદંગવાદકો વચ્ચે સ્પર્ધા થતાં જે હારી ગયો તેણે ગુસ્સામાં

સંગીત ના સ્થાનો

પોતાનું વાદ્ય ઉપાડિને ફુંકયું એ વાદ્ય જમીન પર પછડાતાં ભાંગીને બે ટુકડા થયા. એમાંથી તબલાં બન્યાં. બંને કથાઓનું કોઈ પ્રમાણ મળતું નથી પરંતુ આટલું સ્પષ્ટ છે કે તબલાં ૧૦૦૦ વરસથી વધુ જૂના નથી. ઢોલ, ઢોલકી, નાળ, ખોળ, નગારા, ડફ, ખંજરી વગેરે નામે ઓળખાતી લયવાદ્યમાં કોઈ હાથેથી વગાડ્યા છે તો કોઈ લાકડીના પ્રહારથી વાગે છે. તબલાં-મૃદુંગ ગાયન, વાદન અને નર્તન ત્રણેયમાં અનિવાર્ય છે. દેશભરમાં તબલાંનો વપરાશ વધુ હોવા ઉપરંત તેની પરદેશોમાં નિકાસ પણ વધુ થાય છે.

તબલાંને સ્વતંત્ર સોલો આઈટમ તરીકે લોકપ્રિય બનાવનારા કલાકારોમાં ઉસ્તાદ અછુમદ જાન થિરકવા, ઉસ્તાદ અલ્લારખા, પંડિત ચતુરલાલ અને પંડિત કંદે મહારાજના નામ લઈ શકાય. અલ્લારખાએ પણ પોતાની વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત ફિલ્મોમાં સંગીતકાર તરીકે કરેલી. એ સમયે એમનું નામ એ.આર. કુરેશી તરીકે જાણીતું હતું અને આશા ભૌસલેને ૧૯૫૦માં ફિલ્મ 'સભક'માં સર્વપ્રથમ ગીત ગવડાવવાનો થશ અલ્લારખાને ઘટે છે.

ઉપર જણાવેલા તબલાના ચારેચાર કલાકાર તેમની હૃયાતીમાં જ દંતકથા સમાન બની ગયેલા. તેમાંથી ઉસ્તાદ થિરકવા અને કંદે મહારાજ આજે હૃયાત નથી. કંદે મહારાજ પાસે તબલાં-શાસ્ત્ર પાણી ભરતું એમ કહેવાય છે. પાછલી ઉંમરે તેમને અવસ્થા થવાથી એકવાર સાડા ત્રણ ડિગ્રી તાવ હતો. લગભગ અર્ધબેહોશીમાં પડેલા. ડોકટરોના અનેક પ્રયત્નો છતાં તાવ ઊતરતો નહોતો ત્યારે તેમના ભત્રીજા પંડિત કિસન મહારાજે કંદે મહારાજને પ્રિય તબલાંની જોડ લાવીને તેમના બિધાના પાસે મૂકી. મહારાજશ્રીએ ઊઠીને ઈશ્વર સ્મરણ કરી તબલાં વગાડ્યા માંડ્યા. સમયનું ભાન રહ્યું નહીં. સતત ચાર-છ કલાક તબલાં વગાતડા રહ્યા. પછી ઊઠીને હરતાફરતા થઈ ગયા. ડોકટરે થર્મોમિટર વડે ટેમ્પરેચર તપાસ્યું તો તાવ જ નહોતો. આવા કંદે મહારાજે એકી બેઠકે કલાકો સુધી આંખનું મટકું થ માર્યા વિના તબલાં વગાડ્યાની નોંધ દેશભરમાં છાપાઓએ લીધી હતી. જો કે એ જ કંદે મહારાજની છેલ્લે તબિયત બગડી ત્યારે ત્યારના વડા પ્રધાન ઈન્ટિરાજુએ સારવાર કરવા માટે મદદ કરવાની ખાતરી આપેલી. પરંતુ નવી દિલ્હીની એક હોસ્પિટલના બાંકડા પર જ કંદે મહારાજે દેછ છોડ્યો કારણ કે હોસ્પિટલમાં દાખલ થવાના તેમની પાસે પૈસા નહોતા.

દક્ષિણ ભારતમાં મૃદુંગ તરીકે જાણીતું વાદ્ય ઉત્તરમાં મોગાલ

અસર હેઠળ પખવાજ તરીકે જાણીતું છે. બરે રામદાસજી, પાગલદાસજી અને છેલ્લે છેલ્લે મુંબઈમાં વસાત અર્જુન સેજવલ પખવાજના નામી કલાકાર છે. સામાન્ય રીતે સમાજમાં એવી છાપ છે કે માણસ બીમાર હોય ત્યાં ધોંઘાથ થવો ન જોઈએ પણ તે વખતે લેંકેસ્ટર (અમેરિકા) માં મહર્ષિ હોસ્પિટલ ચલાવતા મૂળ ભારતીય ડોક્ટર દીપક યોપડા મ્યુઝિક થેરાપી વોર્ડમાં રોગીને પખવાજ કે મૃદુંગ સંભળાવીને સાજા કરવાનો પ્રયોગ કરી રહ્યા હતા. તેમના કહેવા પ્રમાણે પખવાજ પર આડા યોતાલ, ધમાર તાલ અને સુલ તાલ સંભળાવવાથી અનિંદ્રા, ટેન્શન તથા હિસ્ટીરિયાના રોગીને આરામ થાય છે. કબજીયાત અને તાપના રોગીને રાગ બૈરવ સંભળાવવાથી રાહત થાય છે. હાઈ બ્લડપ્રેશના દર્દીને સવારનો રાગ તોડી અથવા બપોર પછીનો રાગ મુલતાની સંભાળવતાં બ્લડપ્રેશર નોર્મલ થાય છે.

પિતની બીમારીમાં ગુજરાતનો રાગ સારંગ અને શાસની તકલીફ કે દમ જેવા રોગોમાં માલકાંસ તથા બાગેશ્રી નામના રાગો મહૃત્વના છે. ડોકટર દીપક યોપડાની આ મ્યુઝિક થેરાપીને અગાઉ કહ્યું તેમ ડોકટર દયિન્સન તથા ડોકટર પોડોલાન્સીનું પણ પીઠબળ સાંપદ્યું છે. આ ડોકટરોએ 'એકોડિંગ' ફોર રિલેક્શનેસન, રિફ્લેક્સન, રિસ્પોસ અને રિકવરી નામે ખાસ સારવાર પદ્ધતિ વિકસાવી હતી. એક ડોકટરે દરર્દીને બેભાન કર્યા વિના તેના માનીતા કલાકારનું વાયોલિનવાદન સંભળાવીને ઓપરેશન કરેલું એવા સમાચાર ન્યુયોર્ક ટાઇમ્સ તથા વોશિંગટન પોસ્ટે ત્યારે પ્રગટ થયેલા.

વાજીંનો વિરો લખવા બેસવું એ એક મહાગ્રંથ તૈયાર કરવા જેણું છે - લોકસંગીત, શાસ્ત્રીય સંગીત અને ધાર્મિક સંગીત ત્રણોમાં એક ચા ભીજા પ્રકારનું વાજીંને અનિવાર્ય થઈ પડ્યું છે. એ વિષયનો વ્યાપ આકાશ જેવો છે. પંડિત ઓમકારનાથ ઠાકુરને ટાંકીએ તો -

નાદ સાગર હું અપાર,

કિન્હીં કો પાયો ન પાર,

સરસ્વતી દેખો તૈર રહી,

લેઈ તુંબીકો આધાર,

આ આધાર લઈને આપણે પણ અહીં જ અટકીએ.

ચિત્રા ની પુત્ર ને શ્રેષ્ઠ હોલ્ડિન્ગ

- ★ જીવનમાં કંઈ પણ કરે ત્યારે સંપૂર્ણતા માટે નહીં, શ્રેષ્ઠતા માટે કોશિશ કરજે.
- ★ પોતાના ગુજરાન માટે મહેનત કરતા દરેક માણસ સાથે સન્માનથી વર્તજે. ભલે એનું કામ બિલકુલ નજીવું લાગતું હોય.
- ★ એવી રીતે જીવજે કે તારા પ્રામાણિકતાનો વિચાર કરે ત્યારે તેઓ તને યાદ કરે.
- ★ વિચારો મોટા કરજે, પણ નાના-નાના આનંદ માણી લેજે.
- ★ ઘસાઈ જજે, કટાઈ ન જતો. પોતાની જાતને સતત સુધારતા રહેવાની કોશિશ કરજે.
- ★ જેમને એ વાતની કચારેય જાણ ન થવાની હોય એવા લોકો માટે કશુંક સારું કરવાની આદત કેળવતો રહેજે.
- ★ ભીજાઓની સફળતા વિશે ઉત્સાહ અનુભવજે. ભીજા લોકોને અભેદનું મહત્વ ભાસે એનું કરવાની તક શોધતો રહેજે.
- ★ તારા ફુંકુંબને તું કેટલો પ્રેમ કરે છે એ દરરોજ શબ્દો વડે, સ્પર્શ વડે અને તારી વિચારશીલતા વડે દર્શાવતો રહેજે.
- ★ હારમાં ખેલદિલી બતાવજે, જીતમાં ખેલદિલી બતાવજે.
- ★ કોઈની પણ પ્રશંસા જાહેરમાં કરજે પણ ટીકા ખાનગીમાં કરજે.
- ★ તારી નજર સામે સતત કશુંક સુંદર રાખજે, ભલે પછી એ નાનકું ફૂલ હોય.
- ★ આપણાથી સહેજ જેટલું થઈ શકે એમ છે એનું લાગો માટે કશુંજ નહીં કરવું એમ નહીં રાખતો. જે થોડુંક પણ તારાથી થઈ શકે એ કરજે જે.
- ★ કોઈપણ વિશે કચારેય આશા સમૂળગી છોડી દેતો નહીં. યમલારો દરરોજ બનતા હોય છે.

લાંબા સિદ્ધાંતોને યાદ રાખવા માટે મહત્વપૂર્ણ સંકેત પદ્ધતિ

લાંબા સિદ્ધાંતોને યાદ રાખવા એ વિદ્યાર્થીઓ માટે એક સામાન્ય સમસ્યા છે, વિદ્યાર્થીઓની હંમેશા ફરિયાદ હોય છે કે એક વાર વાંચા બાદ તેનો એક અંશ પણ યાદ રહેતો નથી. સામાન્ય રીતે આપણું મગજ બધી જગ્યાએ પહોંચી જાય છે. પરંતુ સિદ્ધાંત વ્યાખ્યા પર રહેતું નથી અને એટલે જ લાંબી વ્યાખ્યાઓ તેમજ સિદ્ધાંત દ્યાનમાં રહી શકતાં નથી.

એકાગ્ર કેવી રીતે રહેશો? અથવા દ્યાનરત કેવી રીતે રહેશો?

જવાબ : મહત્વપૂર્ણ સંકેત પદ્ધતિ.

આવો તેને એક પછી એક સમજુઓ.

(૧) અધ્યાયના શિર્ષકને વાંચો અને થોડોક સમય તેની પાછળ લગાવો. શિર્ષક દ્વારા જે કંઈ ઝાન તમને મળે છે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. ઉદાહરણ માટે અધ્યાયનું શિર્ષક છે Thermodynamics. શક્ય છે તેનો અર્થ તમને ન સમજાય તેમ છતાં કોઈ અર્થ કાઢવાનો પ્રયાસ કરો. શિર્ષક પર ઊંડાણપૂર્વક નજર નાખો. Thermo નો અર્થ છે heat. તેનો અર્થ એ નીકળે કે આ અધ્યાય dynamics સાથે સંબંધિત છે. અધ્યાય માટે એકાગ્ર થવા અને અનુમાન લગાવવાથી તમે તમારા અયેતન મનમાં અધ્યાયને ગ્રહણ કરવા એક પ્લેટફોર્મ નિર્મિત કરો છો. એ જરૂરી નથી કે, દર વખતે તમારું અનુમાન બિલકુલ સાચું હોય. તેમ છતાં આ અભ્યાસ તમને અધ્યાય માટે એક ભૂમિકા તૈયાર કરવામાં મદદ કરશો. એટલે માનસિક રીતે તૈયાર થઈ જાવ.

(૨) હવે તમે થિયરીના દરેક પેરેગ્રાફને એ રીતે વાંચો કે, તેમાંથી તમને મહત્વપૂર્ણ સંકેત મળી જાય. જે મહત્વપૂર્ણ સંકેત હશે તે સમગ્ર પેરાગ્રાફનું પ્રતિનિધિત્વ કરશો.

(૩) વિશ્વાસ કેળવો કે, આગાળના પેરેગ્રાફ વાંચતા પહેલાં પાછળના પેરેગ્રાફના મહત્વપૂર્ણ સંકેતને સારી રીતે ગ્રહણ કરી લેશો. જે તમને પૂર્ણત્વપે અધ્યાયમાં દ્યાનમન થવામાં મદદ કરશો.

(૪) માની લો કે, સમગ્ર અધ્યાયમાં ૧૫ પેરેગ્રાફ છે તો તેનો અર્થ એ છે કે ૧૫ અથવા તેનાથી વધુ મહત્વપૂર્ણ સંકેત એકત્ર થયા. હવે આ સંકેતોને દ્યાનથી જુઓ. પછી તેમની મદદથી સમગ્ર અધ્યાય યાદ રાખવાનો પ્રયાસ કરો.

(૫) ફરી વાર જ્યારે તમે અધ્યાયનું પુનરાવર્તન કરશો તો આ મહત્વપૂર્ણ સંકેત ઝડપી પુનરાવર્તન માટે મદદ કરશો.

જે જી નાકલેણ

મને કઈ પ્રવૃત્તિ કરવી ગમણે?

નામ

પ્રવર્ત્તિઓ

બાળકો

જાદુ, ટ્રેક્સિંગ, પેપરકલા, તરવું, સીરામીક આઈ, શિલ્પકળા,
બેડમિન્ટન, સાઇકલીંગ, સ્ટેમ્પ કલેક્શન, કેન્દ્રલમેક્ટીંગ,
વેસ્ટમાંથી બેસ્ટ, વક્તૃત્વ, નેતૃત્વ.

મહિલા

પર્યાણ, સ્ટાફિંગ, ખેલ ગ્રૂપ, કેલિગ્રાફી, ભાષાંતર, ઈ-બિઝનેસ,
સગપણ કેન્દ્ર, હેલ્પ લાઈન, જ્યોતિષ, ટેલીમાર્કટીંગ, સોફ્ટ
ટોયસ, હર્બલ ઉત્પાદન, નૃત્ય, ચોકલેટ્સ, ડેમો આયોજન.

યુવાનો

ચર્ચાસત્ર, પ્રોગ્રામિંગ, વેબ-ડિઝાઇન, મેડિકલ કેમ્પ, વ્યક્તિત્વ
વિકાસ, ધર્મ, યોગસાધના, ધ્યાન, માનસ શાસ્ત્ર, માર્ગાલ આઈ,
વિચાર - વિનિમય, કારકિર્દી માર્ગદર્શન, વિદેશ - ઈન્ટરનેટ
માર્ગદર્શન, હેલ્પકેર, બેંક - એલ.આઈ.સી. માર્ગદર્શન,
સામાજિક પ્રગતિ, આયાત - નિકાસ.

વડીલો

હળવું, મળવું, ખોરાકી નિયંત્રણ, ધાર્મિક મુલાકાતો, મનોરંજન,
બાગકામ, યોગાસન, કસરત, સ્વયંસેવક, આત્મ - ઝાન,
જીવન શ્રેણી, મનનું સમાધાન, આયુર્વેદિક/નૈસર્જિક ઈલાજ,
નવેસરથી વ્યવસ્થા, સકારાત્મક વિચાર - સરણી.

ઈ-કોમર્સ

બેટયોજના, ડી.ડી.પી., ગ્રાફિક્સ, શિક્ષણકેન્દ્ર, ઓપરેટર,
જાહેરખબર, વેપારી મદદ, ફરિયાદ કેન્દ્ર, ઉત્પાદન વધારવું,
સ્ટોર હાઉસ, માર્કટીંગ ડેટા, વાંચનાલય, અધિકારી વહીપટ
કેન્દ્ર, રેલવે/વિમાન સેવાના બુકિંગ, માલ પહોંચાડનાર,
રહેવાની/જમવાની વ્યવસ્થા, લોકર્સ (ખાના) આપવા, વસ્તુઓ
ભાડે આપવી, જરૂરી - લોન, માહિતી - સંદેશા, બીલની
ચુકવણી, પ્રદર્શન નું આયોજન.

કૃમાલ

"ગુલાબી ગુંથેલ રૂમાલ"

બચપણમાં મા એ આપેલ....

"મન" એ ગુંથેલી રેશમ દોરે એની કોર,

સાહેલીઓ મનકે વખાણતી ચારેકોર,

કોલેજમાં જોતા મિત્રો એ રૂમાલ

સરી પડયો હાથે રહ્યો ન ખ્યાલ

એણો ઉપાડી છુપાવ્યો તલાલ

મારા હૈયાએ કર્યો ઘણો બબાલ ..

રૂમાલ આપ્યો સુગંધી અત્તર છાંટી,

જોઈ રહી હું એમને મીટ માંડી

રમતાં મેં મૂકયો રૂમાલ દાવે

જોઉં કોણ એને જુતી જાવે

લઈ ગયા એ સૌની નજર બચાવી

જોઈ મારી સામે આંખ મચાવી

રૂમાલની યાદે "મન" મુખદું રીસાયું


"તું મારી" શબ્દો જોતાં મન લોભાયું.

છજુ અકબંધ રહી એ સુગંધ ની મ્હોર,

એ લખેલ શબ્દોની "મન" હૈયે શોરબકોર.....!!

- "મન" મનિષા

જી જી ગોકુલનાથ



LOWER
CANCER
RISK
•
PROTECT
AGAINST
ASTHMA
•
PREVENT
FRACTURES
•
LOWER BLOOD
PRESSURE



જાળવાતો દ્વારા 'રોગ' નો ટૉકાર બની રહ્યું છે!!!

મારા એક થંગ ફેરે વર્ષો સુધી એ.સી. ઓફિસ માં બેસી કામ કર્યા પછી, લોકડાઉન માં વર્ક ફ્રોમ હોમ શરૂ થયું. ઘર માં જ બેસી, ઘર ના લોકો સાથે આંદ્ર પ્રમોન્ડ કરતાં કરતાં ઓફિસનું કાર્ય પણ પૂરું થતું. બધું ધીમે ધીમે નવી રીતે એડજસ્ટ થઈ રહ્યું હતું. દોઢ-બે મહિના પસાર થતાં ઝર માં એક બાજુ થાપા ના હાડકા ની ઉપર અને એ જ પગમાં ઘૂંઠણ ની નીચે ધીમે ધીમે દુઃખાવો રાત થયો. ઘરગથ્થું ઇલાજો-પ્રયોગો રાત થયા. દુઃખાવો વધતો જ ગયો. એ પગ પર ભાર મૂકી ને ચચાય નહીં. તે બાજુ સ્વા-ઉદ્યવા-બેસવામાં તકલીફ વધવા લાગી. પંદર-વીસ ડિવસ ડૉક્ટર ની દવા, પેઇન કીલર દવા ઘણણું કર્યું. એક્સ્યુપ્રેશર ની ટ્રીટમેન્ટ લીધી. ત્યાં ના દુઃખાવા ને અનુરૂપ યોગના આસનો કર્યા. યોગાસન થી ચાર પાંચ ડિવસ થોડી રાહત થઈ પણ દંડ કેઠો નહોતું મૂકતું. પીડા વધતી ગઈ. એક્સ-રે, બીજા મસમોટા એમ આર આઈ રિપોર્ટ કરાયા. તેમાં એમ સમજાયું કે જ્યાં દુઃખાવો થાય છે ત્યાં સુધી બલડ-સરક્યુલેશન વ્યવસ્થિત થતું નથી.

આપું ફેમિલી તોબા તોબા પોકારી ગયું. રોગ પકડાતો નહોતો. દવા અને ટ્રીટમેન્ટ માટે નો ચોક્કસ વિકલ્પ જરૂરો નહોતો. બધા કંટાયા. હે બીજા ડૉક્ટર ને બતાવવાનું નક્કી કર્યું. બીજા ડૉક્ટરે આખી છિસ્તરી, રિપોર્ટ્સ ચેક કર્યા પછી ચાર-પાંચ નવા ટેસ્ટ કરાવવા જણાયું. જેમ કે ઈફ્ફેક્શન નો રિપોર્ટ, વિટામિન-'ડી' નો ટેસ્ટ, યુરિક એસિડ માટે નો રિપોર્ટ વગેરે વગેરે. હે આ બધા રિપોર્ટમાં આખી બાબત ધ્યાન માં આવી. કઈ તકલીફ છે તેના પર પ્રકારા પડ્યો ને રોગ પકડાયો.

શરીર માં વિટામિન-'ડી' ની ઉણપ, ખામી શરૂ થઈ હતી. રોજબરોજ ની જીવન-પદ્ધતિ, કાર્ય-પદ્ધતિ, એ.સી. ઓફિસ માં અને ઘર ના બંધિયાર ઝામ માં ભરાઈ ભરાઈ ને ફરજ પૂરી કરવામાં ડિવસ પૂરો થઈ જતો હતો. રાત પડી ગઈ છે તેનું ભાન રહેતું નહોતું. વર્ક-સ્ટોડ અને બોસ ના પ્રેશર દેઢળ ડિવસ નો ઉજાસ ઓક્સિન થઈ ગયો હતો. જ્વાતો જાગતો દેવતા સૂર્ય રોજ રોજ તેજ-પ્રકારા-ઉર્જા પ્રદાન કરવા આપણી સમક્ષ પ્રગતિ

થાય છે. પરંતુ આપણે એવા બંધનો માં બંધાઈ ગયા છે કે ક્ષણાભર તેના દર્શાન કરવાનો પણ આપણી પાસે સમય નથી. ઘરે થી એ.સી. કાર માં ઓફિસ જરૂર, આપો ડિવસ અને ઉગતી રત સુધી ઓફિસે જ અને પાછા એ.સી. કાર માં ઘરે. આમાં વિટામિન-'ડી' થી સભર સૂર્યપ્રકારા ક્યાંથી મળે?

ડૉક્ટર ના કહેવા મુજબ યુવાનો જીંગળીની રેસ માં, શરીર ની કાળજ સેવાનું ચૂકી જાય છે, જેના પરિણામો અનેક યુવાનો ભોગવી રહ્યા છે.



સ્વસ્થ રહેવા માટે ડેલિયમ અને વિટામિન-'ડી' ની મહત્વતા શું?

વિટામિન-'ડી' એટસે શું?


વિટામિન-'ડી' માણસનાં હાડકા માટેનું ખૂબ અગત્યનું વિટામિન છે. એ ઘણાં જુદાં જુદાં સ્વરૂપે હોય છે પણ માણસ માટે ડી-3 તરીકે ઓળખાનું કોલેકેટસીફોલ નામનું વિટામિન-સ્વરૂપ સૌથી અગત્યનું છે.

વિટામિન-'ડી' ક્યા ખોરાકમાંથી મળે?

પ્રાણીજ ચરબી અને માઇલીમાંથી આ વિટામિન સૌથી વધુ પ્રમાણમાં મળે છે. જો કે, હે રાસાયણિક શુદ્ધ સ્ફીટક તરીકે પણ આ વિટામિન મળે છે. જો ખોરાકમાં વિટામિન ડી-3 પૂરતા પ્રમાણમાં લેવામાં આવે તો આ વિટામિન ખોરાકમાંથી લોછીમાં શોખાઈને લીપરમાં જાય છે. ત્યાં એની પર થોડીજ રાસાયણિક પ્રક્રિયા (દાઇડોક્સિસેક્શન) થઈને પછી ફરી લોછી વાટે એ કિડનીમાં પછોંચે છે. કિડનીમાં બાડી રહેત રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ જાય છે. અને પછી જુદા જુદા અવયવો પર આ પ્રક્રિયા પામેસ વિટામિન કામ કરવા લાગે છે.

જે જી નાકલણ

VITAMIN D FOODS



વિટામિન-'ડી' ખોરાક સિવાય શેમાંથી મળે?

ખોરાકને બદલે બીજા રસ્તે પણ શરીરમાં વિટામિન ઉપલબ્ધ થાય છે. આ રસ્તો છે સૂર્યપ્રકાશનો આપણા શરીરની ચરબીમાં અથવા ખોરાકમાંથી બનેલ ચરબીમાં રહેલ ડીહાઇડ્રોકોલેસ્ટરોલ નામના ચરબીના ઘટક પર જ્યારે સૂર્યપ્રકાશમાં રહેલ પારજાંબલી (અસ્ટ્રોવાયોસેટ) કિરણો પડે છે ત્યારે એમાંથી વિટામિન-'ડી' ઉત્પત્ત થાય છે સામાન્ય રીતે જો આપણા શરીર પર એટસો સૂર્યપ્રકાશ પડે કે જેથી ચામડીમાં સહેજ લાલાશ આવે, તો એનાથી આશરે 10,000 ઇન્ટરનેશનલ યુનિટ જેટલું વિટામિન ડી-3 મળે છે. શિવાળમાં ઘણી વખત સૂર્યપ્રકાશમાં રહેલ અસ્ટ્રોવાયોસેટ કિરણો વાતાવરણમાં જ શોખાઈ જાય છે અને ત્યારે શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન ન બને એવું બનતું હોય છે. નમાના બાળકો અને પદદા ધૂંઘટમાં રહેતી સ્ત્રીઓને ઘણી વખત પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળતો નથી અને આને લીધે વિટામિનની ઊણાપ્ચી રોકેટ્સ અથવા ઓસ્ટ્રિઓમલેસિયા જેવી હાડકાની તકલીફો ઊભી થાય છે.

વિટામિન-'ડી' ની દૈનિક જરૂરિયાત કેટલી?

પુષ્ટ બ્યક્ટિટ કરતાં બાળકોમાં વિટામિન-'ડી' ની જરૂરિયાત વધારે હોય છે. કારણ કે હાડકાંઓનો વિકાસ આ તબક્કામાં સૌથી વધુ થતો હોય છે. પુષ્ટ બ્યક્ટિટ ને રોજના 900 ઇન્ટરનેશનલ યુનિટ તથા બાળકોને રોજના 200 યુનિટ વિટામિન-'ડી' ની જરૂર પડે છે. સગર્ભા અને ઘાત્રી માતાને રોજના 400 યુનિટ વિટામિન-'ડી' ની જરૂર પડે છે.

શારીરિક ફંક્શન્સ સારી રીતે બને તે માટે મહત્વના પોષક તત્ત્વો ખનિજોમાંથી મેળવાય છે. જે હાડકાં અને દાંતને મજબૂત રાખે છે, આપણા શરીરને માટે બે સૌથી અગત્યના ઘટકો કેલિયમ અને વિટામિન ડી છે. પૂરતા કેલિયમ અને વિટામિન ડી મજબૂત અને ગાંધ હાડકાં બનાવવા માટે જરૂરી છે અને આપણને આપણી ઉંમર પ્રમાણે

તંદુરસ્ત રાખે છે. અદી કેલિયમ અને વિટામિન-'ડી' વિશે તમારે જાણવું જોઈએ એ જરૂરી છે.

કેલિયમ શું છે?

કેલિયમ એક ખનિજ છે, જે હાડકાં બનાવવા અને તેને તંદુરસ્ત રાખવા માટે જવાબદાર છે. આપણા શરીરમાં આશરે 20 ટકા કેલિયમ આપણા હાડકાં અને દાંતમાં છે. દરેક દિવસે આપણે ચામડી, પેશાબ, તકલીફો અને મળ દ્વારા કેલિયમ ગુમાવવાનું વલણ ઘરાવે છે. એ નોંધવું અગત્યનું છે કે આપણું શરીર તેના પોતાના પર કેલિયમ ઉત્પત્ત કરી શકતું નથી. તે ચોક્કસ ખોરાક પર આધારિત છે જે દરરોજ જરૂરી કેલિયમ મેળવવા માટે આપણને મદદ કરે છે.

વિટામિન-'ડી' શું છે?

વિટામિન-'ડી' એ એક મહત્વપૂર્ણ પોષક તત્ત્વ પણ છે જે આપણા હાડકાને સુરક્ષિત કરવામાં એક સમાન મહત્વપૂર્ણ ભૂમિકા માટે છે; તે કેલિયમ શોષણ કરવા માટે શરીર દ્વારા જરૂરી છે તેથી, જો તમારા શરીરમાં વિટામિન-'ડી' ની ઉણપ હોય, તો આપણા શરીરમાં કેલિયમનો અભાવ પણ હોય છે. વિટામિન-'ડી' મુખ્યત્વે સૂર્યપ્રકાશ શોષણ દ્વારા આપણી તચા દ્વારા સેન્ટ્રિય છે. જો કે, અમુક ચોક્કસ ખોરાક અને પૂરવણીઓ છે જે ઉણપના ડિસાયોમાં તમને તંદુરસ્ત રાખવા માટે વિટામિન-'ડી' ના અમુક પ્રમાણમાં મદદ કરી શકે છે.

વિટામિન-'ડી' ના સ્ત્રોતો

વિટામિન-'ડી' નો મુખ્ય સ્ત્રોત સીધો સૂર્યપ્રકાશ છે, આ સિવાય વિટામિન-'ડી' કેટલાક ખોરાકમાં ઉપલબ્ધ છે જેમાં સોંમાન, ટૂના, ડેરી ઉત્પાદનો જેવા કે દૂધ, પનીર, ઈંડા અને સોયામિકનો સમાવેશ થાય છે. વિટામિન-'ડી' ઇન્ટેક માટે, ઉપલબ્ધ વિવિધ પૂરવણીઓ છે; તેમ છતાં, આપણે આપણા ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન પિના તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

મૂળભૂત રીતે, હાડકાં માટે માળખાડીય બિટિંગ બસોક તરીકે કેલિયમ કાર્ય કરે છે, જ્યારે વિટામિન-'ડી' શરીરમાં કેલિયમનું શોષણ કરે છે. નેશનલ એડમિનિસ્ટ્રેશન મેડિસિન સંસ્થા અનુસાર, સામાન્ય પુષ્ટ બ્યક્ટિટ એ કેલિયમ 1000 મિલિગ્રામ વિટામિન એ દિવસ બંને શરીરની સમાન રીતે મહત્વના ઘટકો છે; તેથી, દરરોજ તમે કેલિયમ અને વિટામિન ડી બનેમાં યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છો તેની ખાતરી કરવા આવશ્યક છે.

પૂરક માન્દઠી - ગૃહાલ પરથી

જે જે ગોકુલને



**DRAGON
FRUIT**



દૈરીને સ્વાસ્થ્ય બહારનું ગુણકારી **ડ્રેગન ફૂટ**

ડ્રેગન ફૂટ એક ભારમાસી, ચાત્રા નિકોલાન્ડાની સાથે માપવાળું (ફ્લેશી), વેલા પ્રકારનું કેકટસ પ્રજાતિનું ફળ છે, જે વિશેખમરમાં પ્રથમ, એક સજાપટી છોડ તરીકે અને પછી ફળપાક તરીકે માન્યતા પ્રાપ્ત કરેલ છે. તેના ફળ મોટાભાગની લીસા ભીગડા અને નાના ડાળા બીજ સાથે સફેદ કે લાલ રંગના ફ્લેશ (માપા) સાથે સંયુક્ત તેજસ્વી લાલ ત્યા સાથે સુંદર અને સ્વાદિષ્ટ લાગે છે. ફૂલ તેથે પણ વધુ સુંદર છે કે જે 'નોબલ વુમન' અથવા 'રાતરાણી' તરીકેના હુલામણાં નામે પણ ઓળખાય છે. ડ્રેગન ફૂટ સારી રીતે ઓસ્ટ્રેલિયા, ચાઇના, ઇઝરાયેલ, મલેશિયા, નિકારાગુઆ, તાઈવાન અને ખાસ વિષેતનામ માં તો એક નવા પાક તરીકે સ્થાપિત થયેલ છે. વિષેતનામમાં તે એક મુખ્ય નિકાસ પાક છે, ભારતમાં, આ ફળનું વ્યાપારીક ઘોરણે વાપેતર તેજી થિ શરૂ થયેલ છે.

પિતાયા ફળ સામાન્ય ભાષામાં ડ્રેગનફૂટ તરીકે ઓળખાય છે. આ ફળ મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાનું ફળ છે. એશિયાઈ મૂળના લોકોમાં આ ફળ અત્યંત લોકપ્રિય છે. તેનો સ્વાદ થોડો મીઠો હોય છે. આ ફળનો દેખાવ અત્યંત ધારા રંગનો અને ફૂલ મન્મોછક હોય છે. સ્વાદ સિવાય આ ફળ વધુ પ્રમાણમાં પાણી અને તત્ત્વો ઘરાપે છે, જે દૈનિક આધારમાં જરૂરી હોય છે.

Nutrition Dragon fruit આધારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)



આ ફળ કાંઠાવાના થોરાપર ઉંગલોએ હેઠળું ફળપણ કાંઠા હોતા નથી

શક્તિ	1,104.6 kJ (264.0 kcal)
કાર્બોહિટ પદાર્થો	82.14 g
શર્કરા	82.14 g
રેણ્ઝ	1.8 g
ચરબી	0.0 g
નત્રસ (પ્રોટીન)	3.57 g
વિટામિન-સી (8%)	6.4 mg
મિનરલ ડેટિન્યુમ (11%)	107 mg
લોહતત્ત્વ (0%)	0.00 mg
સોડિયમ (2%)	30 mg

તેજું બીજું નામ સ્ટ્રોબેરી એક પિયરના નામે ઓળખવામાં આવે છે. તે અત્યંત ધારા રંગ તેમજ મન્મોછક ખૂશબુદ્ધ ધરાપતું એક ફળ છે. તેનો દેખાવ ઉપરથી ધારું ખરબચૂડ દેખાવનાર આ ફળ અંદરથી ધારું મુદ્દાયમ અને સાથે સ્વાદ માં સ્વાદિષ્ટ હોય છે.

ફોટો ગોકુલનાથ



આંદોલના પદ્ધતિનું
ડ્રેગન ફળ પ્રણાલીના લોયાં

ડ્રેગન ફૂટ

ભારતમાં અને તેમાં ગુજરાતમાં સાહસિક પેડૂતોએ ડ્રેગન ફૂટનું વાવેતર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં શરી કર્યું છે. તેમના અનૂભવ પ્રમાણે આ ફળ સારો નફો રણી આપે છે. આ ફળથી આરોગ્યતકી ફાયદાના અને તેના પદ્ધતિમાં થી જ્યુસ બનનું હોવાથી તેની માંગ વધુ રહે છે. આ ફૂટથી ડાયાબિટીશ-બી ના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે મધુપ્રમેષ મટાડતું નથી, પરંતુ લોઢીમાં સુગારસું પ્રમાણ નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે. તે કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રાખે છે. તે ફુદ્યની બિમારી ઘટાડે છે. ડેમોંગોબિન્દું જોખમ ઘટાડે છે. વજન નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. બ્યક્ઝિની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. શરીરના કોષોની સારવાર કરે છે. આમ આરોગ્યપ્રદ ના અનેક ફાયદાકારક છે.



આ ફળ મલેશિયા અને થાઈલેન્ડમાં વિશેષ જોવા મળે છે

સફળતા બીજમાંથી ઉગેલા છોડ કરતાં વધુ રહે છે. બે રોપા વચ્ચેનું અંતર ઓછામાં ઓંધું ૨ મીટર X ૨ મીટરનું રાખ્યું હિતાપછ છે. છોડ રોપવા માટે દ૦ સે-ટીમીટર X દ૦ સે-ટીમીટર X દ૦ સે-ટીમીટરનો ખાડો કરવો જોઈએ. રોપ વાયાં પછી ખાડો ટોપ સોઇલ થી ભરો લારે તેની સાથે ૧૦૦ ગ્રામ સુપર ફોસ્ફેટ ખાતરનું મીશ્રણ કરી નાંખો. આ ફળના સારા ઉત્પાદન માટે છોડને લાકડી કે સીમેન્ટનો કોલમનો ટેકો આપો. હજુ આ ફળને કોઈ રોગ લાગવાના કે જંતુથી નુકશાનના સમાચાર પ્રાપ્ત થયાં નથી. પ્રથમ વરસે જ તેને ફળ બેસવા શરીર થાય છે. તેમાંથી મે થી જૂન વચ્ચે ફૂલ બેસે છે અને ઓગષ થી ડિસેમ્બરની વચ્ચે ફળ આપે છે.

એક એકર જમીન ઉપર ૧૭૦૦ જેટલા છોડ વાવી શકાય છે. ડ્રેગન ફૂટના અનેક પ્રકાર છે જો કે બે મુખ્ય જાત જોઈએ પીક છાસ અને પીક પદ્ધત નથી પીક છાસ અને સફેદ પદ્ધત, તે બજારમાં અંદાજે રૂપીયા ૧૨૫.૦૦ થી ૩૦૦.૦૦ રૂપીયા કિલોના ભાવે વેચાય છે. રોપાની ખરીદી થી લઈ લણણી સુધીના તમામ પ્રકારના વર્ચુલ ગણીએ તો



ગુજરાતના કચ્છમાં મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે

પ્રતિ એકર અંદાજ રૂપીયા

૭૦.૦૦ થી ૮૦૦૦૦.૦૦ જેટલો આવે છે. પ્રતિ છોડ પ્રતિ વર્ષ ભગભગ ૨૦ થી ૨૫ કિલો ફૂટનું ઉત્પાદન આપે છે. આમ પ્રતિ એકર ભગભગ પાંચ ટન ફૂટનું વાર્ષિક ઉત્પાદન થાય છે. અગાર માત્ર રૂપીયા ૧૨૫.૦૦ પ્રતિ કિલોનો ભાવ પણ પકડીએ તો

ખેડૂતને વર્ચુલ બાદ કરતાં ઓછામાં ઓછો પ્રતિ એકર રૂપીયા પાંચ લાખનો નફો શાંતિથી રણીને આપે છે.

ભારત અને ગુજરાતમાં તેનું વાવેતર માટે એવું કહેવાય છે કે ભારતમાં સર્વ પ્રથમ કરતાના ખેડૂતોએ ડ્રેગન ફૂટની પેતી આજ થી પાંચ સાત વર્ષ પહેલા શરી કરી હતી. આ ઉપરાંત દ્વે પરિયમ બંગાળ, મધ્યાધ્રેશ, મધરાઝ્રમાં આ ફૂટની બાગાયતી પેતી વધી રહી છે. જ્યાં સુધી ગુજરાતનો સપાસ છે, કચ્છમાં તેનો સર્વપ્રથમ પ્રયોગ થયો અને છેલ્સા ત્રણ-ચાર વર્ષથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આ બાગાયતી પાક ઉગાડવાનું શરી કર્યું છે. રાજ્યમાં અંદાજે ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ છજાર છોડ ઉગાડયાં છે તેવો પ્રાથમિક અંદાજ છે, દજુ સુધી તેના સરકારી અધિકૃત આંકડા જાહેર થયા નથી. દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો ખૂબ સારો અનૂભવ રહ્યો છે, અને સારો નફો મેળવી રહ્યાંના સમાચાર છે. દેશમાં ભગભગ ૧૦૦ મેટ્રીક ટનનું વાર્ષિક ઉત્પાદન થાય છે. વૈશ્વિક બજાર વિશેનું જે દેશોમાં આ ફૂટનું ઉત્પાદન થાય છે, તેમાં વિયેતનામનું ટોચ પર છે. ત્યાં ૨૦૦૦૦ હેક્ટર જમીન ઉપર વરસે નવ લાખ ટન ફૂટનું ઉત્પાદન થાય છે. જે મોટા ભાગે ચીન, સીઙાપોર, યુરોપના દેશો, અમેરિકા, જાપાન, કેનેડા અને હંડાનેરિયા જેવા દેશોમાં નિકાસ થાય છે. વિયેતનામે ૨૦૧૬ માં ૮૮૫ મિલિયન યુચેસ ડોલરની કિંમતના ડ્રેગન ફૂટની નિકાસ કરી હતી, જે તેના ફળોની ફૂલ નિકાસનો ૫૦ ટકા જેટલો હિસ્સો છે.

ઘોડા વર્ષથી આ ફળની માંગ વધી છે. કારણ કે ગ્રાહકોમાં તેના સ્વાસ્થ્યને ઉગતા લાભ વિશે જાગૃતી આવી છે. અમેરીકા નીકારાગુયા, કોલંબિયા, ઇક્વાડોર, વિયેતનામ, થાઇલેન્ડ અને મલેશિયાથી આ ફળની આયાત કરે છે. આ ઉપરાંત ઘરાંગણે પણ ખેડૂતો આ ફળની પેતી શરી કરી દિધી છે. અચાર સુધી ૮૫ ટકા ફળ કાચા ખવાતા હતાં જો કે હેવે તેના સફેદ કે પીક પદ્ધતમાં થી જ્યુસ બનાવી તેનું વેચાણ શરી થયું છે. તેથી તેની માગ વધી રહી છે.



એક લાલ વચ્ચે સફેદ ગર. નીજુ લાલ છાલ-લાલ ગર. નીજુ પીળી છાલ-સફેદ ગર ધરાવે છે

તુલસીવાણી

તુલસી હાય ગરીબકી કબ્બૂ ન ખાતી જાય,
મૂઢે દોરકે ચામસે લોહા ભરમ હો જાય ! ~૧

તુલસી યછ સંસારમે ભાત ભાત કે લોગ,
સબસે હિંતમિલ ચાલિયે, નદીનાપ સંજોગ ! ~૨

દ્વા ઘર્મ કો મૂસ હૈ, પાપમૂસ અભિમાન,
તુલસી દ્વા ન છોડિયે જબલગ ઘર્મે પ્રાન ! ~૩

એક ઘડી આધી ઘડી, આધીસે ભી આધ,
તુલસી સંગત સાધુકી કટે કોટિ અપરાધ ! ~૪

તુલસી કહે ઈસ જગતમે સબસે મિલિયે ધાય,
ક્યા જાને કીસ બેસમે રામચંદ્ર મિલ જાય ! ~૫

તુલસી યછ સંસારમે પંચ તત્ત્વ હૈ સાર,
સંતસમાગમ, દરિભજન, દ્વા, દાન, ઉપકાર ! ~૬

જાંદાં રામ તાંદાં કામ નહિ, કામ તાંદાં નહિ રામ,
તુલસી દોનો ના રહે દિન રજની એક ઠામ ! ~૭

નીચનીય સબ તર ગયે, સંતશરણ લવલીન,
જાતિ કે અભિમાનસે બુડે બછોત કુલીન ! ~૮

કામ કોષ મદ લોભકી જબલગ મનમે ખાન,
તુલસી પંડિત મૂર્ખા, દોઉ એક સમાન ! ~૯

બિનમાંગે મોતી મિલે, માંગે મિલે ન ભીઘ,
તુલસી જો વિશ્વાસ કરે તો મિલિયે વિશ્વાદીશ ! ~૧૦

દાનકાંદેકા

એટસા કડવા ના બનો જેથી લોકો થુંકી નાખે, એટસા મીઠા ના બનો
જેથી લોકો ચાવી નાખે !

.....* *.....
સ્મરણ કરવું આપના હાથની વાત છે અને જીવન મરણ પ્રભુના હાથની
વાત છે !

.....* *.....
લાકડાનો અજિ લાકડાને બાળે છે, તેમ દેછમાનો અજિ દેછને બાળે
છે !

.....* *.....
આજના ચુરજને આપતી કાલનાં વાદળ પાછળ છૂપાવવો તેનું નામ
ચિંતા !

.....* *.....
સ્વતંત્ર થાઓ પણ સ્વધંદી ના થાઓ, કરકસર કરો પણ કંજુસાઈ ના
કરો.

.....* *.....
ઉદાર બનો પણ ઉડાઉ ના બનો, નન્દ બનો પણ નમાલા ના બનો !

.....* *.....
કપડા ભસે જીર્ણ પદેરો પણ દિલ કરી ફાટેનું રાખતા નહિ !

.....* *.....
સ્વ માટે પ્રાથીએ તે તો માત્ર યાચના છે, સૌ માટે યાચીએ તે જ સાચી
પ્રાર્થના છે !

.....* *.....
પ્રાર્થના આત્માનો ખોરાક છે, નન્દતા વિનાનો માણસ પાણી વગરની
નદી જેવો છે!

.....* *.....

લહુવાત

ઉત્તમ પુરુષ

- (૧) પોતાના ચારિત્રણનો વિચાર કરે છે.
- (૨) ન્યાય ઈચ્છે છે.
- (૩) પોતાની પાસેથી અપેક્ષા રાખે છે.
- (૪) સદાચાર નું ચિંતન કરે છે.
- (૫) પોતે જે નથી જાણતો તેનો ઝેદ કરે છે.

ફેદી ગાડુલણું

અધમ પુરુષ

- (૧) પોતાના પદ નો વિચાર કરે છે.
- (૨) મહેરબાની ઈચ્છે છે.
- (૩) બીજા પાસેથી અપેક્ષા રાખે છે.
- (૪) સુખ સગવડ શોધતો ફરે છે.
- (૫) પોતાને બીજા નથી જાણતાં તેનો ઝેદ કરે છે.



હથેળીના પર્વતો ના ફળો

(૧) ગુરુ નો પર્વત :-

જે જાતક નો ગુરુ નો પર્વત ઉંચો અને પ્રબળ હોય આવો જાતક બીજા લોકો પર પોતાનો પ્રભાવ બહુજ જલ્દી થી પાડી શકે છે. કાર્યક્ષમતા સારી, સમાજમાં સારું સ્થાન બનાવી શકે છે. સત્યપ્રિય, વ્યાપાર, વાણિજ્ય માં ઉંચો હોદો, જલ્દીથી બીજા ને આવિન થતા નથી. પોતાના આદર્શો જાળવી રાખે છે. સ્વાર્થી, સ્વતંત્રતાવાદી, અર્થોઉપાર્જન ની વૃત્તિ વાળા. આ પર્વત બધા પર્વતોમાં ઉંચો હોય તો જાતક અતિશય શંકાશીલ, મદમસ્ત. સ્ત્રીઓમાં આ પર્વત સૌથી ઉંચો અને પહોળો હોય તો તે સ્વભાવે નમ્ર, માચા રાખવાવાળી, સાથે સાથે અહુકારી પણ હોય છે. ગુરુ નો પર્વત નબળો હોય તો આંતરડા ના રોગો, હૃદય, ગળુ અને વા (દા.ત. સંધિવા વગેરે) ની માંદગી જોવા મળે છે. આવા જાતકો ના વિવાહ નાની ઉંમર માં થઈ જતાં હોય છે.

(૨) શનિ નો પર્વત :-

શનિ પર્વત ઉંચો હોયતો જાતક ભાગ્યવાન, ઝાની, ધની (ધનવાન) હોય છે. શનિ નો પર્વત દબાયેલો હોયતો કાર્યશક્તિ નબળી હોય છે. ખૂબ જ વાતો કરનારા હોય છે. આવા જાતક ને સાધારણ સ્નેહ કે મમતા મળે તો તેઓ વિચલિત બની જતા હોય છે (ઇમોશનલી વીક હોય, શનિ એકલો પાડો) જો પર્વત વધુ પડતો ઉંચો હોય તો જાતક ખૂબ જ ધાર્મિક (spiritual), વિવિધ ગુઢ રહ્યસ્યો જાણવાની ઈચ્છાવાળા, અર્થ સંચય સારો, ધારુ વિદ્યા માં નિપુણ. (મંત્ર, તંત્ર, ધાતુ) કૃષિ વિશેષણ, વૈજ્ઞાનિક. શનિ નો પર્વત અવિકસિત હોય તો દાંત, પગ, સાંઘાની પીડા થાય છે. છતાં આ જાતકો દદ થી કંટાડતા નથી કે થાકતા નથી (સહનશક્તિ આપે ઽ શનિ)

(૩) સૂર્ય નો પર્વત :-

સૂર્ય નો પર્વત બીજા પર્વતો જેટલો જ સાધારણ હોય તો જાતક બીજા સાથે જલ્દીથી ભળી શકે છે. (માણસને સાથે લઈ ને ચાલે, અહુકારી ન બનાવે). પર્વત સારો હોય તો જાતક પાંચ માં પૂછાય એવો બને. લોકોમાં પ્રશંસા થાય છે. જેમ જેમ આ પર્વત ઉંચો હોય તેમ તેમ જાતક પ્રતિભા, ચશ તથા સફળતા પ્રાપ્ત કરે છે. નેતા, લેખક બને છે. જ્યાં જાય ત્યાં પોતાનો પ્રભાવ પાથરીશકે છે. આ લોકોને છળકપટ, ચાલાકી, મિથ્યા, હંસીમજાક પસંદ નથી. આવા જાતક સ્વમાની, સ્વાભિમાની,

મોટાઈ, તડકભડક પસંદ. બધું મોટું અને ભપકાદાર જોઈતું હોય છે. સૂર્યનો પર્વત બગડેલો હોય તો જાતકને આંખ, હાડકાને લગતા દદોં ની વ્યાધિ રહે છે. અને માન સન્માન માં ઉણપ વર્તાય છે. (ખુશ કરવા પ્રશંસા કરો - ઉપાય)

(૪) બુધ નો પર્વત :-

બુધ નો પર્વત સારો હોય તો જાતક સારો ભાષણકાર, વક્તા, બુદ્ધિ માં પરાજીત ન થનારો ચતુર, લેખન, પઠન, વાણિજ્ય, વિજ્ઞાન માં દર્શાન પ્રાપ્ત કરનારા, આ જાતકો કોઈપણ બાબતમાં લાંબું વિચાર કરતા નથી. નાની નાની બાબતમાં બગડી જનારા, જો બધા પર્વતો કરતાં બુધ નો પર્વત ઉંચો હોય તો આવા જાતકોને માપી શકાતા નથી (જજ નથી કરી શકાતા) કયારેક નમ્ર તો કયારેક ઉગ્ર બની જાય છે. કયાંક પ્રેમ નો કયાંક નફરત વરસાવે છે. બાળક જેવું વર્તન કરનારા. વાસ્તવવાદી (મહેનતુ, જમીન પર જીવનારા, કલ્પનામાં ન રહેનારા) હોવા છતાં કલ્પનામાં રાચનારા. ખેલકુદ માં દક્ષતા, બુદ્ધિશક્તિ ખૂબજ સારી. નાની ઉંમરથી ઝાનની પ્રાપ્તિ કરનારા. પરિવર્તન પ્રિય. આ જાતકોનું વૈવાહિક જીવન સુખી હોતું નથી. વિચારો માં બદલાવ. અભિનય શક્તિ સારી, કલાકાર. બુધ નો પર્વત કમજોર હોય તો હુંમેશા અભાવ નો શિકાર બને છે. માથાનો દુઃખાવો, જવર (તાવ), શરદી, આમાશય (ગોલ બ્લેડર) તથા ચામડી ના દદોં અને નર્વસ સિસ્ટમ ને લગતા વ્યાધિ.

(૫) મંગળ નો પર્વત :-

મંગળ નો પર્વત સારો અને ઉંચો હોય તો જાતક તેજવાન અને સાહસિક હોય છે. જાતકને કોઈની શોહમાં રહેવું ગમતું નથી. કોઈનો આદેશ માનવો ગમતો નથી. ઉપરેશ પસંદ નથી. બધા પર પોતાનું પ્રભુત્વ સ્થાપવાનો પ્રયત્ન કરનારા. મંગળ પર્વત બાકી બધા પર્વતો કરતા ઉંચો હોય તો આવો જાતક અવિચારી સાહસ કરનારા. આંધજુ સાહસ કરનારા, સ્વભાવે ફૂર, ઉગ્ર, કોઢી હોય છે. આ જાતકો ને ફક્ત મીઠી વાતો થી જ કાબુ માં કરી શકાય છે. શરીર માં લોહી ને લગતા વ્યાધિ થાય છે. (મંગળ એટલે લોહી નો કારક) મંગળ સારો હોય તો ફૂર, ઉગ્ર, કોઢી. (મંગળ જુસ્સો, જોમ આપે એટલે કોઈ પરિસ્થિતિ માં ગભરાય નહીં.) (બીજો મંગળ ખરાબ હોય તો જોમ, જુસ્સો ઓછાં).

જે જી ગોકુલને

હથેળીના પર્વતો ના ફળો

(૬) ચંદ્ર પર્વત :-


સારો અને પુષ્ટ હોય તો (પહોળો) જાતક કલાપ્રિય બને છે. લેખકો, કવિ તથા કલાકાર બને છે. આવા જાતકોને વિજાતીય પાત્ર પ્રત્યે વધુ પડતું આકર્ષણ હોય છે (પુરુષ/સ્ત્રી બને). આવા જાતકોને આનંદ, પ્રમોદ ખૂબજ ગમે છે. પરિવર્તન પ્રિય, સફેદ વસ્તુઓના ચાહકો. જાતકો રૂપાળા હોય છે. રૂપ વધુ ગમતુ હોય છે. બજારોને લગતા વ્યવસાય કરનારા. પાર્ટી, પિકનીક પસંદ, જાતકોને પાત્ર સારુ મળે, ખૂબજ ભોલકણાં, ઉંચાઈ સારી હોય, ચંદ્ર નો પર્વત અવિકસિત હોય તો મનો-રોગી, માનસિક રીતે અસંતુલિત તથા જળ તત્ત્વ ના રોગો નો ભોગ બને. (જલંધર, હૃથપગ વગેરે ના સોજા, શરદી વારંવાર જઈથી થાય)

(૭) શુક નો પર્વત :-

શુક નો પર્વત સારો અને ઉંચો હોય તો જાતકો સૌંદર્ય ના પુજારી બને છે. ખૂબજ ભાવુક હોય છે. સંગીત, ગાયન, વાદન, વિણાવાદન, કવિ, નર્તકો, સજુંદાઓ, અભિનેતા અને ગાયકો બની શકે છે. આ પર્વત અતિશાય ઉંચો હોય તો જાતક ખૂબજ વિલાસી, કામુક તથા વિજાતીય પાત્ર ને આકર્ષિત કરનારા હોય છે. શુક પર્વત જો વધુ પડતો વિસ્તારીત હોય તો આવા જાતકો શૂરા, સુંદરી ના ચક્કરમાં આવી જાય છે. ખૂબજ સ્વૈચ્છાધારી બને છે. સારા પોશાક ના શોખીન, પરિવર્તનશીલ હોય છે. આવાજાતકોના યુવાન થવાની સાથે જ લગ્ન કરી દેવા જોઈએ અન્યથા ચરિત્રભ્રષ્ટ બને છે. શુક નો પર્વત સમતોલ હોય તો આવા જાતકો સારા અધ્યાપકો અને રાજનીતિઝા, ચિકિત્સકો બને છે. શુક પર્વત અવિકસિત હોય તો જાતકોને નાક, ગળુ અને ઈન્દ્રિય ને લગતા વ્યાધી થાય. શુક ના પર્વત પર અતિશાય આડી અને ઉભી રેખાઓ જાતકને પ્રેમમાં ઉણાપ (ખામી) દર્શાવે છે.

(૮) રાહુ નું ક્ષેત્ર :-

આ ક્ષેત્ર પુષ્ટ હોય તો જાતક ખૂબજ મોટો સાહસી હોય છે. સંજોગો અનુસાર વર્તનારા પોતાના સ્વાર્થ માટે ગુપ્તતા જાળવનારા. આ લોકો પાસે શારિરીક શક્તિ કરતાં માનસિક શક્તિ વધારે માત્રામાં હોય છે. આ લોકો હૃથપાઈમાં ના ઉત્તરતા શત્રુઓને ચતુરાઈ થી કે બુદ્ધિથી માત આપતા હોય છે. ઉચ્ચ કોટિ ના ઉપદેશકો, હાજર જવાબી વ્યક્તિત્વ, સારા સલાહકાર, ગુસ્સાપર કાબુ રાખવાની ત્રેવડ વાળા. સામેવાળાના કોધ ને મરક મરક હસી ને શાંત કરનારા, પૂર્ણ ચતુરાઈ, બુદ્ધિવાળા, ધન સંચય કરનારા, દરેક ક્ષેત્ર માં પારંગત બનનારા. રાહુ નું ક્ષેત્ર વધુ પડતું ઊંચું હોય તો જાતક (૧) નંબર નો ચીટર (ધૂર્ત), ઉભી અને



ગ્રહોના પર્વત દર્શાવતી હૃથેળી

3. ગુરુ નો પર્વત
9. મંગળ ૨ નો પર્વત
11. શુક નો પર્વત
12. રાહુ નું ક્ષેત્ર
14. માણિબંધ
19. શનિ નો પર્વત
20. સૂર્ય નો પર્વત
21. કંતુ નું ક્ષેત્ર
22. બુધ નો પર્વત
26. મંગળ ૧ નો પર્વત
28. ચન્દ્ર નો પર્વત
4. હૃદય રેખા
5. મસ્તક રેખા
7. જીવન રેખા
10. મંગળ રેખા
24. સૂર્ય રેખા
25. અંતઃસ્કુરણ રેખા
27. સ્વાસ્થ્ય રેખા
30. ભાગ્ય રેખા

અહેંકારી બને છે. રાહુ નું ક્ષેત્ર નબળું હોય તો જાતક અત્યંત કામી, કૂવૃતિ વાળા, રક્તવિકારી, ગૃહિત રોગનો શિકાર (ગમે નહીં તેવા) બને છે. દમ તથા શ્વસન તંત્ર ના રોગ નો ભોગ બને છે.

(૯) કંતુ નું ક્ષેત્ર :-

કંતુ નું ક્ષેત્ર સારુ હોય તો જાતક ખૂબજ મોટા જમીનદાર કે ભૂ સંપત્તિવાળા હોય છે. આ જાતકોને જીવનમાં આર્થિક સંકટ કે કષ્ટ જોવું પડતું નથી. આ જાતકો પાસે પૈન્થિક સંપત્તિ (બાપ-દાદા) ની ખૂબ સારી હોય છે. અંકશાસ્ત્ર માં નિપુણ. એકંકદરે જીવન માં સુખ ભોગે છે. કંતુ નું ક્ષેત્ર નબળું હોય તો જાતક ખૂબજ સ્વાર્થી હોય છે. આ જાતકોને યુવાન થતાની સાથે જ ઠેકાણે પાડી દેવા જોઈએ અન્યથા ચરિત્ર ને લગતા વાંદા આવી શકે છે. જીવનની પ્રત્યેક બાબતમાં નફા, તુકસાન નો હિસાબ રાખનારા. આ જાતકોને કોઈ ને કોઈ પ્રકારની અલર્જી (સંવાહન રોગ) થી પીડાતા હોય છે. તથા ના ઓળખાય તેવા રોગ નો ભોગ બને છે.

કાલ ગણના :-

આયુષ્ય ની ગણના આયુષ્ય રેખા માં ગુરુ ના પર્વત પર થી શરૂ થઈ માણિબંધ પર પૂરી થાય છે. મસ્તક રેખાની શરૂઆત મંગળ-૨ અથવા આયુષ્ય રેખાની શરૂઆત થી શરૂ થઈને મંગળ-૧ પર પૂર્ણ થાય છે. હૃદય રેખા ની શરૂઆત ગુરુના પર્વત થી શરૂ થઈ બુધ ના પર્વત પર પૂર્ણ થાય છે. ભાગ્ય રેખા માણિબંધ થી શરૂ થઈ શનિના પર્વત પર પૂર્ણ થાય છે. વિવાહ રેખા કનિષ્ઠકાં ની નીચેના ભાગ થી શરૂ થઈ ને હૃદય રેખા પર પૂર્ણ થાય છે. સ્વાસ્થ્ય રેખા શુક ના પર્વત પર થી શરૂ થઈ ને બુધના પર્વત પર પૂર્ણ થાય છે. સૂર્ય રેખા ની શરૂઆત સૂર્ય પર્વત પર થી શરૂ થઈ ને, પૂર્ણ જ્યાં અંત થાય ત્યાં.

જે જી ગાન્ગોલેણું



મોબાઈલ ફોનવે લગતી અણત્યની જણાડાયી...!!!

- સંકલન

સૌથે જાણવું ખૂબ જ જરૂરી છે, પણ મોટા ભાગના મોબાઈલ વાપરનારાઓ આ ચારેય થી અજાણ છે. દસમાંથી નવ જણા જાણતા નથી કે મોબાઈલ કેટલો ઉપયોગી છે. મોબાઈલ ફોન તો હવે લગભગ બધા જ વાપરતા થઈ ગયા છે. પરંતુ આપણી મુશ્કેલીના સમયમાં તે કેવી રીતે તમને મદદ કરે છે તે કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે ! બોલો તો ખાસા લાંબા સમયથી તમે મોબાઈલ વાપરતા હશો પરંતુ ચું તમે નીચે જણાવેલ બાબતો જાણો છો ?

- ૧) જો તમારા મોબાઈલ ફોન કવરેજ એરિયાની બહાર હોય અને તમારે કોઈને ફોન કરવાની તાકીદની જરૂર હોય તો આપના મોબાઈલમાં ૧૧૨ નંબર જોડો ! ૧૧૨ નંબર આ સમગ્ર વિશ્વમાં ઈમરજન્સી નંબર તરીકે માન્ય છે. આ નંબર (એટલે કે ૧૧૨) જોડવાથી તમારો મોબાઈલ ગમે તે નેટવર્ક શોધીને તમને નંબર જોડી આપે છે અને તેની વધુ રસપ્રદ બાબત તો એ છે કે તમારા મોબાઈલનું કીપેડ લોક હશે તો પણ આ નંબર લાગશે.
- ૨) છુપી બેટરી પાવર, જો તમારા મોબાઈલ ફોનની બેટરી ખૂબ જ લો થઈ ગઈ હોય અને ફોન લગભગ બંધ જેવો થઈ ગયો હોય તો “૩૩૭૦#” કી દબાવો આ બટન દબાવાથી બેટરીમાં ૫૦ ટકા જેટલો પાવર વધશે અને તે રીતર્વ પાવર ફરી તમે બેટરી ચાર્જ કરશો ત્યારે ચાર્જ થઈ જશો.
- ૩) તમારા મોબાઈલ ફોનનો IMEI નંબર જાણવો ખૂબજ જરૂરી છે. એ તમે *#૦૬# ડાયરીમાં લખી રાખો, આપના ફોનના ફોન કોલમાં જઈને તમે આ કી દબાવશો તો એક ૧૫ આંકડાનો નંબર સ્કીન પર આવશે. જો કયારેક તમારો ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો પોલીસ ફરિયાદ સમયે આ નંબર આપવો. પોલિસ સર્વિસ પ્રોવાઈડર મારફત આ મોબાઈલ ફોન કયા એરિયામાંથી ઓપરેટ થાય છે તે જાણી શકશો, અને કદાચ ફોન ચોરનાર વ્યક્તિને પકડી ન શકે તો આ IMEI નંબરવાળો ફોન બંધ જરૂર કરી શકે છે. જો ચોર તેમાં સીમ કાર્ડ બદલી નાખે તો પણ તેમાંથી ઇનકમિંગ કે આઉટગોઇંગ નથી થઈ શકતા. તેથી તે ફોન વાપરી નહીં શકે કે વેચી પણ નહીં શકે.
- ૪) જો તમારી કારમાં ડોર રિમોટ કન્ટ્રોલવાળા હોય (આજે તો લગભગ બધી જ કારોમાં હોય છે) ને તમે રિમોટ કારમાં જ ભૂલી ગયા હોય અને કાર લોક થઈ ગઈ હોય તો? જો આવું થાય તો ગભરાશો નહીં, તમારે સ્પેર (ચુપ્લીકેટ) રિમોટ લેવા ઘરે જવાની જરૂર નથી. તમારા ઘરે જે પણ કોઈ હાજર હોય તેના મોબાઈલ ફોન પર ફોન કરો, તેને કહો કે ઘરમાં જે રિમોટ છે તેનું UNLOCK બટન તેના મોબાઈલ પાસે રાખીને દબાવે અને તમે તમારો મોબાઈલ ગાડીના લોકથી એકાદ કૂટ દૂર રાખો. સામે છેકેથી UNLOCK બટન દબાવશો કે તરત જ તમારી ગાડીનું લોક ખૂલી જશો. ગમે તેટલા દૂરના સ્થળેથી પણ આ થઈ શકશો.

**આમ કેવની વાત ધ્યાનમાં રાખો અને આવા સંજોગોમાં તમારા
મોબાઈલની કેવાળીતા સમજો!!**

જે જે ગી માઝલેણ

હોડાંગભાઈ

શાબુ સંઘાન દ્વારા કહેવત પૂર્ણ કરો.

	"અ"		"બ"
૧	છોકરો શોભે બાપને ધેર	ક	ઉજળું એટલે દૂધ નહીં
૨	મા તેવી ઢીકરી	ખ	સો શિક્ષક ની ગરજ સારે
૩	સુખમાં સમરે સોની ને	ગ	મગર થી વેર ન કરાય
૪	સોનાની કટારી પેટે બંધાય	ધ	આઠ વાર ઉભા થવાના જ
૫	પીળું એટલું સોનું નહીં ને	ચ	ઘડો તેવી ઢીકરી
૬	કમ ખાના, ગમ ખાના	છ	વિરસ્ય ભૂષણમ्
૭	પાણી માં રહેવું ને	જ	પણ બોલનારની જુલન ન ઝલાય
૮	ક્ષમા	ઝ	દૃખ માં સમરે રામ
૯	એક માતા	ટ	તેર ટૂટે
૧૦	મારનારનો હૃથ ઝલાય	ઠ	છોકરી શોભે વરને ધેર
૧૧	સાત વાર પડો ત્યારે	સ	અને નમ જાના
૧૨	સાત સાંધો ત્યાં	દ	પણ પેટ માં ન ખોસાય

- * ખીલવું હોય પહેલા તો, જમીનમાં દટાતા શીખવું પડે!!
- * સંબંધનો સૌથી નબળો તબક્કો, જ્યારે લાગણીઓનું સ્પષ્ટીકરણ કરવું પડે!!
- એકલા ચાલવું આમ તો અધરું નથી, પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું ખૂબ જ અધરું છે?!
- * ખાનગી વાતોને ખાનગી જ રાખજો, જો વાનગી બની જશો તો તમારા કરતાં લોડોને ચાખવાની મજા આવશે!!

- શિરીષભાઈ પરીખ (ચા ગરમ)

જે એ ગોકુલશ

કે.એમ.જી. જનરલ હોસ્પિટલ ટ્રસ્ટ, બાલાસિનોર

બાલાસિનોરની કે.એમ.જી. જનરલ હોસ્પિટલ(કુણીવાળા કેમ્પસ)માં માહે જુન ૨૦૨૦ ના માસ દરમ્યાન નીચે મુજબના દર્દીઓએ લાભ લીધેલ છે.

મેડીકલ, ગાયનેક, સર્જીકલ, આંખ, માનસિક, તેમજ ઈમરજન્સીમાં કુલ ૨૭૭૨ દર્દીઓએ, અષ્ટ રે વિભાગ ૧૩૦ દર્દીઓએ તથા પેથોલોજી વિભાગમાં કુલ ૧૮૮ લાભ લીધેલ છે મેજર ઓપરેશન ૭૮ તથા માઈનોર ૩૧ ઓપરેશનો કરવામાં આવેલ છે.

કમળાબેન શાંતિલાલ પરીખ(કુવાવાળા) સુપર સ્પેશ્યાલીટી સેન્ટર માં માહે જુન ૨૦૨૦ના માસ દરમ્યાન ફીજુશીયન, ઈઅનટી, ઓર્થો, સ્કીન, ડેન્ટલ તેમજ ગેસ્ટ્રોલોજીના મળી કુલ ૧૧૩૨ દર્દીઓએ તથા અષ્ટ રે ૧૯૯ દર્દીઓએ તથા પેથોલોજી ૩૦૫ દર્દીઓએ લાભ લીધેલ છે.

કે.એમ.જી.જનરલ હોસ્પિટલ ટ્રસ્ટમાં વધુ નોંધાયેલ દાન:-

૧. મોઢી એન્ડ મોઢી ફું. યેત્રાઈ હ. શ્રી અશોકભાઈ મોઢી	: રૂ. ૩,૫૦,૦૦૦
૨. શ્રીમતી સુધાબેન સુમનરાય દેસાઈ (આણંદ)	: રૂ. ૧,૦૦,૦૦૦
૩.સ્વ.ચંદ્રપ્રભાબેન પ્રવિષાંદ્ર પરીખ (રોકડીયા)	
હ.શ્રી પ્રવિષાંદ્ર લલ્લુભાઈ પરીખ (રોકડીયા)	: રૂ. ૧,૦૦,૦૦૦
૪. સ્વ. તારાબેન શાંતિલાલ કડકીઆ	: રૂ. ૫૦૦૦

(દિવાસા નિમિતે દર્દીઓને ખાદ સામગ્રી માટે)

ડિમ્પલ રૂપેશ પરીખ દર્દી આર્થિક રાહત મિતિ યોજનામાં વધુ નોંધાયેલ દાન:-

૧. શ્રી પાર્શ્વ રૂપેશ પરીખ હ. શ્રી વસંતભાઈ પરીખ	: ૧ મિતિ
૨. શ્રી શલોક રૂપેશ પરીખ હ. શ્રી વસંતભાઈ પરીખ	: ૧ મિતિ
૩. એક અનામી દાતા- બાલાસિનોર	: ૧ મિતિ
૪. સ્વ. કમળાબેન મણીલાલ કડકીઆ(બાટલા)	: ૧ મિતિ
૫. સ્વ. તારાબેન શાંતિલાલ કડકીઆ	: ૫ મિતિ

ડિમ્પલ રૂપેશ પરીખ દર્દી આર્થિક રાહત મિતી યોજનામાં રૂ. ૧૧૦૦૦/-નો ફાળો નોંધાવી ગરીબ દર્દીઓને રાહત દરે દવાઓ આપવા સહભાગી થવા દાતાશ્રીઓને વિનંતી

કે.એમ.જી.જનરલ હોસ્પિટલ ટ્રસ્ટમાં રૂ. ૫૦૦૦/- ભરી આજીવન સત્ય થવા માટે વિનંતી.

શ્રી નિતીન પરીખ

શ્રી પરેશ પરીખ


માનદૃ મંત્રીશ્રીઓ

જે છે શ્રી ગોકુલશ



HOW TO GIVE YOURSELF AN ACUPRESSURE SESSION

આ લેખ શ્રી કનુભાઈ મગનલાલ ધારીએ (અણિયાદવાળા) ના માર્ગદર્શન હેઠળ શ્રીમતી મિનાક્ષીબેન રાજેશકુમાર દેસાઈ (લાટવાળા) એ તૈયાર કર્યો છે.



અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવ સીધા લોહીમાં ભળી જાય છે. જીવનની સર્વ કીયાઓનું નિયંત્રણ આ ગ્રંથી દ્વારા થાય છે.



અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્થાન આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પગના તળિયે દર્શાવવામાં આવ્યા છે, તેના પર દબાણ કેવી રીતે આપવું (જુઓ આકૃતિ નંબર ૨)

શિયાત્સુ સારવાર પદ્ધતિ મેરીડિયોલોજી પર આધારિત છે એમ માનવામાં આવે છે. આપણા શરીરનું સમગ્ર સંચાલન જુદી જુદી ૧૪ મેરીડિયનોમાં વહેતા 'કી' નામના જીવન પ્રવાહ દ્વારા ચાલે છે. આ જીવન પ્રવાહ ને ચીનમાં 'ચી' શક્તિ, જાપાનમાં 'કી' શક્તિ અને ભારતીય યોગ વિદ્યા આ શક્તિને 'પ્રાણશક્તિ' કહે છે.

આપણા શરીરના તમામ કાર્યો આ શક્તિને આભારી છે. આ પ્રાણશક્તિ નો સ્ત્રોત પુરા બ્રહ્માંડમાં છે. બીજો સ્ત્રોત હવા જે આપણે શ્વાસ વાટે લઈએ છે. અને ત્રીજો સ્ત્રોત ખોરાક જે આપણે ખાઈએ છે.

આ 'કી' શક્તિ ઘન અને ઋણ બળ ધરાવે છે. ચીનના લોકો 'થીન' (નેગેટીવ) ઝણાભાર ધરાવતી શક્તિ અને 'યાંગ' (પોઝિટીવ) ઘનભાર ધરાવતી શક્તિ કહે છે. આ બંને શક્તિ એક બીજાની પુરક છે. આપણા શરીરના બહિર શારીરિક કાર્યો તથા આંતરિક કાર્યો આ શક્તિને આભારી છે. આ પ્રાણશક્તિ કાયમ પ્રાણવાન રહે અને તેના માર્ગમાં કોઈ અડયણ ન આવે તો મનુષ્ય તાજગીપૂર્ણ અને નિરામય રહી લાબું આયુષ્ય ભોગવી શકે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે શરીરમાં 'થીન અને યાંગ' શક્તિ પ્રવાહનું સમતોલન ખોરવાય છે ત્યારે શરીરમાં કોઈને કોઈ રોગનો પ્રવેશ થાય છે. આ બંને શક્તિ પ્રવાહને ફરી સમતોલ કરવા માટે જે મેરીડિયનોમાં આ શક્તિનો પ્રવાહ વહે છે તે મેરીડિયનો પર આવેલા દાબબિન્દુઓ પર જરૂરી દબાણ આપવાથી ફરી આ પ્રવાહ સમતોલ બને છે ને દર્દમાં રાહત થાય છે. આપણા શરીર પર ૩૫૦ જેટલા મહિનાના દાબબિન્દુઓ આવેલા છે. આ દાબબિન્દુઓ મેરીડિયનોના અતિ સંવેદનશીલ સ્થાનો છે જ્યારે કોઈ અંગ રોગગ્રસ્ત બને છે ત્યારે તેને સંલગ્ન આ દાબબિન્દુઓ ખૂબજ આઇસ (Tenderness) બની જાય છે. તેના પર સહેજ પણ દાબ આપતા ખૂબ જ દુખાવો અનુભવાય છે. આવા દાબબિન્દુઓ શોદી તેના પર નિયત પ્રમાણમાં દાબ આપી દર્દમાંથી મુક્તિ મેળવી શકાય છે.

આપણું શરીર પંચતત્ત્વનું બનેલું છે આ પાંચે તત્ત્વોને પોતાની એક એક મેરીડિયન (ચેનલ) છે. આ મેરીડિયનનો એક માર્ગ ઘન વિજભાર ધરાવતી 'યાંગ' ચેનલનો અને બીજો માર્ગ ઋણ વિજભાર ધરાવતી 'થીન' ચેનલનો છે. આપણાં શરીરમાં 'થીન અને યાંગ' કુલ ૧૨ ચેનલો છે. આ મેરીડિયનો નો એક પ્રવાહ



જે કે શ્રી મિનાક્ષીબેન



બાજુ એ વહે છે.

મેરીડિયનો ના નામ:-

ઇન વિજભાર ધરાવતી 'થાંગ' મેરીડિયનો

૧) મોટા આંતરડાની મેરીડિયન (Li)

૨) નાના આંતરડાની મેરીડિયન (Si)

૩) ત્રેવડી ગરમી ઉત્પત્ત કરનાર મેરીડિયન (Tw)

૪) મૂત્રાશાયની મેરીડિયન (Bladder) (B)

૫) પિત્તાશાયની મેરીડિયન (Gall Bladder) (GB)

૬) જદરની મેરીડિયન (Stomach) (ST)

કણ વિજભાર ધરાવતી 'થીન' મેરીડિયનો

૭) ફેફસાંની મેરીડિયન (Lung) (L)

૮) હૃદયની મેરીડિયન (Heart) (H)

૯) હૃદયનું સંચાલન જળવનાર મેરીડિયન (Pericardium) (P)

૧૦) બરોડની મેરીડિયન (Spleen) (SP)

૧૧) યકૃતની મેરીડિયન (Liver) (Liv)

૧૨) મૂત્રપિંડની મેરીડિયન (Kidney) (K)

નિયંત્રક મેરીડિયનો

૧૩) ગવર્નર્નીગ વેસલ મેરીડિયન (governing vessel) (GV)

૧૪) કન્સેપ્શન વેસલ મેરીડિયન (conception vessel) (CV)

મોટા આંતરડાની મેરીડિયન

મોટા આંતરડાની મેરીડિયનો આ ઇન વિજભાર ધરાવતી 'થાંગ' ચેનલ છે આ મેરીડિયન પર કુલ ૨૦ દાબબિન્કુઓ આવેલા છે.

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેનો પ્રવાહ વહે છે. (જુઓ આકૃતિ નંબર ૩)

૩) મોટા આંતરડાની ચેનલ ફેફસાની કણ વિજભાર ધરાવતી 'થીન' ચેનલ સાથે સંલગ્ન (connected) છે. મોટા આંતરડાની ચેનલ પર નીચેના દાબબિન્કુઓ મુખ્ય છે.

Li-૪,૧૦,૧૧,૧૫,૧૮,૧૬,૨૦

આ ચેનલ માં વિક્ષેપ થાય તો આખી ચેનલમાં દુઃખાવો થાય, જેમકે ફોઝન સોલ્ડર, દાંતનો દુઃખાવો, કબજુયાત, કાકડાના સોજા.

Li-૪:- સ્થાન - અંગુઠાને દર્શક આંગળીની વચ્ચેના માંસલ (web.) ભાગ પર હૃથેળીની પાછળ.

આ દાબબિન્કુ પર સારવારથી નીચે જણાવેલા ફાયદા થાય છે. દાંતનો દુઃખાવો, માથાનો દુઃખાવો, સાયનસ, શરીરના ઉપરના ભાગમાં દુઃખાવો.

Li-૧૦,૧૧:- સ્થાન - કોણીને વાળતા બહારના માંસલ ભાગ પરના બિન્કુઓ.

આ સારવારથી થતાં ફાયદા - હાથ ઉંચો ન થતો હોવો, હાથમાં અણાણાટી, ઉપરના હાથમાં લક્ષ્ય મારી જવો, કોણીનો દુઃખાવો, લોહીનું ઉંચું દબાણ અને ચામડીના રોગ.

Li-૧૫,૧૬:- સ્થાન - ખભાના સાંધા પરના બિન્કુઓ.

આ દાબબિન્કુઓ ના ફાયદા - હૃથેળીમાં તાણ, માથાનો દુઃખાવો, ગરદનનો દુઃખાવો, ગરદનનું અકડાવવું, ફોઝન સોલ્ડરના દુઃખાવમાં ફાયદો થાય છે.

Li-૧૮:- સ્થાન - હડિયાના મૂળથી ૧" ના અંતરે આવેલ બિન્કુ.

દાબબિન્કુ ના ફાયદા - આ અંતઃસ્ત્રાવી ગ્રંથી નું દાબબિન્કુ છે. થાયરોઇટ અને ડાયાબિટીસ માં ફાયદો થાય છે.

Li-૧૯:- સ્થાન - ઉપરના હોઠ અને નાક વચ્ચેનું બિન્કુ.

દાબબિન્કુના ફાયદા - શરદી, નાકમાંથી લોહી નીકળવું, દાંતનો દુઃખાવો ને ફેસીયલ પેરાલિસિસ માં ફાયદો થાય છે.


Li-૨૦:- સ્થાન - રાક્ષી દાંતના મૂળ પર નસકોરા પાસે. દાબબિન્કુના ફાયદા - નાકમાં બલોકેજ, મોઢા પરના સોજા ને દાંતના દુઃખાવમાં ફાયદો થાય છે.

ફેફસાની મેરીડિયન

ફેફસાની મેરીડિયન એ કણ વિજભાર ધરાવતી 'થીન' ચેનલ છે.

આ મેરીડિયન પર ૧૧ દાબબિન્કુઓ આવેલા છે. (જુઓ આકૃતિ નંબર ૪)

આ ચેનલ મોટા આંતરડાની ચેનલ સાથે જોડાયેલી છે. ફેફસાની ચેનલ



જે જે ગોકુલને



પ્રાણશક્તિ હવામંથી શ્વાસવાટે થઈને શરીરના બધા ભાગોમાં પહોંચાડે છે.

ફેફસાની ચેનલ માં વિક્ષેપ થાય તો

કફ, ટ્રેકાશાસ, ચામડીમાં તકલીફ, ઉદાસીનતા, ફિકાશ.

આ ચેનલ પર મુખ્યત્વે નીચે જળાવેલા દાબબિન્દુઓ ઉપયોગમાં લેવામાં આવે છે.

L-૫,૬,૭,૯૯:-

L-૫:- સ્થાન - કોણીના સાંધાની બહારની બાજુ એ આવેલ બિન્દુ. દાબબિન્દુના ફાયદા - ચામડીના રોગ, કોણીમાં સોજો અથવા દુઃખાવો, આંખના પોપચાનો સોજો, કમરનો દુઃખાવો, સ્નાયુ ખેંચાવા, ખભાના સાંધાનો દુઃખાવો.

L-૬:- સ્થાન - નીચેના તરફ હાથના મદ્યભાગ પર આવેલ બિન્દુ. દાબબિન્દુ ના ફાયદા - કફ, તીવ્ર અસ્થમા, કાકડા વધવા, ખભાના સાંધાના સોજામાં ફાયદો થાય છે.


L-૭:- સ્થાન - કાંડાના સાંધાની ૩" ઉપર આવેલ બિન્દુ.

દાબબિન્દુ ના ફાયદા - પાછળના ભાગમાં માથાના દુઃખાવા માટે, ગરદનમાં મચકોડ, મોટા આંતરડા નો સોજો

L-૧૧:- સ્થાન - અંગુઠાના નખ ના મૂળની બહારની બાજુ પર આવેલ બિન્દુ.

દાબબિન્દુ ના ફાયદા - માથાનો દુઃખાવો, આંજણી, હાથમાં ચુનતમ સંવેદના માં ફાયદો થાય છે.

નાના	આંતરડાની મેરીડિયન
નાના	આંતરડાની
મેરીડિયન	આ ધન વિજભાર ધરાવતી ચાંગ ચેનલ છે. આ મેરીડિયન પર ૧૮ દાબબિન્દુઓ આવેલ છે. નાના આંતરડાની ચેનલ હુદયની ચેનલ સાથે સંલગ્ન (connected) છે. (જુઓ આફુતિ નંબર ૫)



નાના આંતરડા પરની મેરીડિયનના દાબબિન્દુઓ વિજન. ૨૯

આફુતિમાં બતાવ્યા પ્રમાણે ટચલી આંગળીના નખના મૂળથી શરૂ થઈ આ આંગળીની લાઈનમાં હથેળી પાછળ થઈને ગાલના હાડકા ના નીચેની તરફના બિન્દુ ને મળી મદ્યકર્ણ પાસે પૂરી થાય છે.

આ મેરીડિયન માં વિક્ષેપ (disharmony) થાય તો, હાથની આખી ચેનલમાં દુખાવો થાય છે. માથાનો દુઃખાવો, બહેરાશ, અથવા કાનની આજુબાજુ દુઃખાવો, ગાલ પર સોજા, પેટના નીચેના ભાગમાં દુઃખાવો થાય છે.

આ ચેનલ પર મુખ્યત્વે નીચે દર્શાવેલા દાબબિન્દુઓ ઉપયોગમાં આવે છે.

S.I-૩,૫,૬,૧૧,૧૮,૧૯

S.I-૩:- સ્થાન - ટચલી આંગળીના મેટા કાર્પલ હાડકા પરનું બિન્દુ.

દાબબિન્દુ ના ફાયદા - હાથ ઉંચો ન થવો, ખભામાં ચાસકા આવવા, વાઈ, બહેરાશ, સાયનસ, માથામાં દુઃખાવો.

S.I-૫:- સ્થાન - હથેળીની પાછળ ટચલી આંગળીની લાઈનમાં કાંડા ઉપરનું બિન્દુ.

દાબબિન્દુ ના ફાયદા - કાંડામાં દુઃખાવો, હાથમાં દુઃખાવો, ગરદનમાં દુઃખાવો, ગરદન અકળાઈ ગઈ હોય તો તેમા આ બિન્દુ ખાસ કામ કરે છે.

S.I-૬:- સ્થાન - ખભાના સાંધાથી ૩" ઉપરના બાવડાના મદ્યભાગમાં આવેલ બિન્દુ.

દાબબિન્દુ ના ફાયદા - ફોઝન સોલ્ટર.

S.I-૧૭:- સ્થાન - મોઢાના નીચેના જડબાના ખૂણા પર આવેલ બિન્દુ.

દાબબિન્દુ ના ફાયદા - નસકોરી ફૂટવી, કમરનો દુઃખાવો, કાકડાનો સોજો, ગળાનો સોજો


S.I-૧૮:- સ્થાન - કપોલ અસ્થી નીચે (મદ્યકર્ણ અને નસકોરા ની વચ્ચે) આવેલ આ બિન્દુ.

દાબબિન્દુ ના ફાયદા - દાંતનો દુઃખાવો, ચહેરાનો લકવો, આંખના સ્નાયુઓ નખળા પડી ગયા હોય તો તેમા આ બિન્દુ થી ફાયદો થાય.

S.I-૧૯:- સ્થાન - મદ્યકર્ણ સામે કપોલ અસ્થી પર આવેલ બિન્દુ.

દાબબિન્દુ ના ફાયદા - કાનમાં બહેરાશ અને ચક્કર આવવા (વાંગ)

જે જે ગોકુલને



હૃદયની મેરીડિયન

આ ઋણ વિજભાર ધરાવતી 'થીન' ચેનલ છે, આર્મ પીટ પરથી શરૂ થઈ ટચલી આંગળીના ટેરવા પર હૃદયની તરફ અંદરની બાજુ એ પુરી થાય છે. (જુઓ આકૃતિ નંબર ૫) હૃદયની ચેનલ ઘન વિજભાર ધરાવતી નાના અંતરડાની ચેનલ સાથે સંલગ્ન છે. આ મેરીડિયન પાર દાબબિન્દુઓ આવેલા છે.

હૃદયની ચેનલમાં વિક્ષેપ

(disharmony) થાય તો પસીનો, ગળામાં શોષ પડવો, હિતાશા, અશાક્તિ, ઉંઘ ન આવવી.

આ ચેનલ પર મુખ્યત્વે નીચે દર્શાવેલા દાબબિન્દુઓ છે.

H-3,4,9,9,C,6

H-3:- સ્થાન - છાતી તરફ કોણીના સાંધા પર આવેલ બિન્દુ.

દાબબિન્દુના ફાયદા - હાથ ઉંચો ન થવો, હાથનો લકવો, છાતીમાં દુઃખાવો, એન્જાયના નો દુઃખાવો.

H-4:- સ્થાન - કાંડાના સાંધાથી ૨" ઉપર અલના પર આવેલ બિન્દુ.

દાબબિન્દુના ફાયદા - હાથનું ઢંડાપણું અવાજમાં કર્કશતા.

H-9,9:- સ્થાન - કાંડાના સાંધાથી અલના ના છેડા પર આવેલ બિન્દુઓ.

દાબબિન્દુઓ ના ફાયદા - હૃદય રોગ માટે આ મહત્વના દાબબિન્દુઓ છે. ચિન્તા, રાત્રે પસીનો વળવો, ટૂંકા શ્વાસ વગેરે હોય તો આ દાબબિન્દુઓ પર દબાણ આપવું.

H-6:- સ્થાન - ચોથી અને પાંચમી આંગળીના સળ (web) નીચે આવેલ બિન્દુ.

દાબબિન્દુના ફાયદા - આંગળીના સાંધામાનો વા, હૃથેળીમાં કળતર.

H-6:- સ્થાન - ટચલી આંગળીના હૃથેળી તરફના પ્રથમ વેઢા પર આવેલ બિન્દુ.

દાબબિન્દુના ફાયદા - આ ઈમરજન્સી બિન્દુ છે. છાતીમાં દુઃખાવો, શરીરમાં અશાક્તિ, પસીનો વળવો, આંગળામાં કળતર થવું, શેત્ર પ્રદર.

ગુજરાતી મિલ્ડે

- વ.** વધે બલે અમર.
- દોષતી જવાન છે**
- ન.** નંબોતું જવુ વનમાં
હજુ હિલમા તુફાન છે
- પ્ર.** પ્રવેશ બલે કર્યો
વનમાં જીવન હજુ
બાગવાન છે
- વે.** વેચવા છે કુલ હજુ
એવા અદ્ભુત છે
- શ.** શભી જશે
થનગનાટ પણ ભન
હજુ બે લગામ છે
- મિ.** મિત્રતા રહે અતૂઠ
અમર એવું
અનુભાન છે
- લ.** લહેદ કરેશું
જીવનમર. એજ
અભિથાન છે
- ન.** નશ્ક છે હિલથી
દોષતી જીવની એજ
ઇંધર નું વર્દ્ધાન છે:

ક્ષર્વ નિવૃત છતાં પ્રવૃત મિત્રો ને સખર્ષિત છે

જીવી નોકલણ

કાઇવસ્તાર 'કૃત્તાળ'

કૃત્તિવાલ

સ્પેશિયલ કૃત્તાળી
વાતાળીથાળી રેસિપી

લીના મંજુલ ધારીઆ (હેડમાસ્ટર)



કૃત્તાળી હાંડવો

સામગ્રી

બટાકા ની છીણ એક કપ, પલાળેલા સાખુદાણા, રાજગારો અડધો કપ, શિંગોડા નો લોટ અડધો કપ, સિંગદાણા નો ભૂકો ૨ ચમચી, ૧ ચમચી દહીં, ખાંડ, આદુ-મરચા ની પેસ્ટ ૧ ચમચી, લાલ મરચું, અડધી ચમચી તજ-લવિંગ નો ભૂકો, સ્વાદાનુસાર મીઠું.

રીત

ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી પાણી થી જાડું ખીરું રાખવું, હવે ગેસ પર કઢાઈ મૂકી રાખવું, ચમચી તેલ નાખી જીરું નાખવું, ૧ ચમચી તલ નાખવા, લીમડો નાખવો, પછી બનાવેલું ખીરું પુડલા જેટલું પાથરવું, ધીમો ગેસ રાખવો. ડીશ ઢાંકી દેવી. પાંચ મિનીટ રાખવું. પછી પલટાવી ને પાંચ મિનીટ રાખવું. પૂડા જેવો હાંડવો થશે.

કેળા ના પકોડા

સામગ્રી

૨ પાકા કેળા, અડધો કપ શિંગોડા નો લોટ, મીઠું, શેકેલું જુરા પાવડર અડધી ચમચી, આદુ-મરચા ની પેસ્ટ એક ચમચી, દહીં ૨ ચમચી,

રીત

પાકા કેળા ના ટુકડા કરી, બાકીની બધી સામગ્રી ઉમેરી મિક્ષ કરી કેળા ને દબાવી દેવા, હવે તેલ મૂકી પકોડા ધીમા તાપે તળવા. ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.

મોરૈયા ના દહોંફાદા

સામગ્રી

૧૦૦ ગ્રામ બાફેલો મોરૈયો, ૩ ચમચી શિંગોડા નો લોટ, ગ્રીન ચટણી, ખજુર-આંબલી ની ચટણી, મસાલા વાળું દહીં,

રીત

બાફેલો મોરૈયો લઈ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી મિક્ષ કરી તેના ગોળા વાળવા, તેલમાં ચમચા થી લઈ તજી લેવા, પ્લેટ માં ઠંડા કરવા, પછી સહેજ દબાવવા, પછી તેમાં ગ્રીન ચટણી (સિંગા, કોથમીર, લીલા મરચા, લીંબુ અને ખાંડ) નાખવી, તેના પર ખજુર-આંબલી ની ચટણી નાખવી, પછી તેમાં મસાલા દહીં (મીઠું-મરચું-ખાંડ) નાખવું, કોથમીર નાખી સર્વ કરવું.

જે કે ગ્રીનોકલેસ

કાઈપસ્ટર 'ફૂથાળ' ફેસ્ટિવલ



રાજગારા ના વડા

સામગ્રી

રાજગારા નો લોટ ૧ બાઉલ, મસણેલા કેળા ૪ નંગા, આદુ-મરચા ની પેસ્ટ, તલ-કોથમીર-લીંબુનો રસ, દળેલી ખાંડ,

શૈલ

રાજગારા ના લોટ માં ઉપરની સામગ્રી મિક્ષ કરી કઠણ લોટ બાંધવો, થેપી ને વડા કરવા., કડાઈ માં તેલ મૂકી, લાલાશ પડતા મીડીયમ તાપે તળવા., કીશ માં તળેલા મરચા, બટાટા ની વેફ્કર કે કાતરી સાથે સર્વ કરવા.



ફૂથાળી પાતરા

સામગ્રી

રાજગારા નો લોટ ૧ બાઉલ, મોરૈયા નો લોટ ૧ બાઉલ, દોઢ ચમચી લીંબુનો રસ, લાલ મરચ્યું ૨ ચમચી, ખાંડ, અળવી ના પણ ૩ નંગા, મીઠું,

શૈલ

બાઉલ માં રાજગારા નો લોટ, મોરૈયા નો લોટ મિક્ષ કરી તેમાં લીંબુનો રસ, મીઠું, લાલ મરચ્યું, અને ખાંડ નાખી ખીરું તૈયાર કરવું, અળવી ના પાન ઉપર તે ખીરું ચોપડવું પછી તેના રોલ વાળી બાફ્વા, ઠંડા પડે પછી કાપવા., કડાઈ માં તેલ મૂકી જુરું, તલ, લીલા મરચા નાખી પાતરાને વધારવા., નીચે ઉતાર્યા પછી તેના પર દાડમ ના દાણા, અને કોપરા ની છીણ નાખી સર્વ કરો.



ફૂથાળી માલપુંદરા

સામગ્રી

સાબુદાણા નો લોટ, મોરૈયા નો લોટ, શિંગોડા નો લોટ, રાજગારા નો લોટ, (હદેક લોટ ૪ ચમચી), શેકેલો દૂધ નો મોળો માવો ૩ ચમચી, એલચી પાવડર ૨ ચમચી, કાજુ પાવડર ૨ ચમચી,

શૈલ

બધા લોટ મિક્ષ કરી દૂધ ઉમેરી જાડું ખીરું તૈયાર કરવું., પછી સ્ટફિંગ તૈયાર કરવા, શેકેલો દૂધ નો મોળો માવો, એલચી પાવડર, કાજુ પાવડર મિક્ષ કરો, કડાઈ માં ૨ ચમચી ઘી નાખી ગ્રીસ કરવું, અને બનાવેલું તૈયાર ખીરું તેના પર પાથરવું, થોડીવાર પછી ઉથલાવવું, ઉથલાવ્યા પછી તેના પર બુરું ખાંડ નાખી વચ્ચે સ્ટફિંગ તૈયાર કરેલું નાખી તેના પર બીજો પેહલે થી જે તૈયાર કરેલો માલપુંડરો છે તે મૂકી દેવો. હળવા છાથે સહેજ દબાવવું, હવે તેને ઉતારી બદામ-પીસ્તા ની કટરણ નાખી સર્વ કરો.

જે કે ગી ગોકુલના

ચેર્નોબીલ - હૈપોનાઇટ રાહિલ

જીએં પૂછેલા દરેક કોયડા નાં ઉકેલ શોધો

પદર માંથી તેર અથવા ખૌદ અથવા પદર
(બધા જ) જવાબ સાચા આપનાર - કહેનાર
બાળકો, ચુવનાંનો ને ધરના વડીલો તે પ્રમાણે
તેને બેટ આપીને પ્રોત્સાહિત કરો.

ઉદાહરણ

જવાબ

Read between
the lines

1

ECONOMY

2

JOBINJOB

3

REC ORD

A B C D E F G

5

GIVE GET

H I J K L M N

GIVE GET

O P Q R S T V

GIVE GET

W X Y Z

4

GIVE GET

7 YOUR TIME

8

MOONCEON

6

TRAVEL

CCCCCCCCCC

9

MARY

+ MARY

10

REF'ER

11

LADY
LADY
LADY

12

N
N SICK N
N

13

FA ST

14

T

15

R O O T
O O
T O O R

ફેફે ગોળાલસ

ગુજરાત માનવ મંદિર, બાલાસિનાં

અધિકમાસ નિમિત્ત વિવિધ ઉત્સવોનું આયોજન

અધિક આસો સુદ ૧ને તા. ૧૭/૦૯/૨૦૨૦થી અધિક આસો વદ અમાસને તા. ૧૬/૧૦/૨૦૨૦ સુધી ઉજવવામાં આવનાર તિથિઓની ચાદી.

તારીખ	તિથિ	ઉત્સવ	તારીખ	તિથિ	ઉત્સવ
૧૭/૦૯/૨૦	આસો સુદ ૧	સંવત્સર	૦૨/૧૦/૨૦	આસો વદ ૧	ગિરીરાજ ફુનવારો
૧૮/૦૯/૨૦	આસો સુદ ૨	દ્રિતીયા પાઠ	૦૩/૧૦/૨૦	આસો વદ ૨	હિંડોળા
૧૯/૦૯/૨૦	આસો સુદ ૩	ટકરાણી ત્રીજ	૦૪/૧૦/૨૦	આસો વદ ૨	અષ્ટ સખા મનોરથ
૨૦/૦૯/૨૦	આસો સુદ ૪	ફુલ ચોથ	૦૫/૧૦/૨૦	આસો વદ ૩	ગિરીરાજનો દૂધ અભિષેક
૨૧/૦૯/૨૦	આસો સુદ ૫	વસંત પંચમી	૦૬/૧૦/૨૦	આસો વદ ૪	કૂલ મંડળી
૨૨/૦૯/૨૦	આસો સુદ ૬	ધનધન છઠની રાત	૦૭/૧૦/૨૦	આસો વદ ૫	કૂલ મંડળી
૨૩/૦૯/૨૦	આસો સુદ ૭	મહાઓચ્છવ	૦૮/૧૦/૨૦	આસો વદ ૬	કૂલનો હિંડોળો
૨૪/૦૯/૨૦	આસો સુદ ૮	ગોપાખ્યમી	૦૯/૧૦/૨૦	આસો વદ ૭	જલ-વિહાર
૨૫/૦૯/૨૦	આસો સુદ ૯	દાનધાટી	૧૦/૧૦/૨૦	આસો વદ ૮	ગૃહ્ય મનોરથ
૨૬/૦૯/૨૦	આસો સુદ ૧૦	નંદમહોત્સવ, દર્શારા	૧૧/૧૦/૨૦	આસો વદ ૯	કુંજ મનોરથ
૨૭/૦૯/૨૦	આસો સુદ ૧૧	કૂલબંગલો	૧૨/૧૦/૨૦	આસો વદ ૧૦	કૂલ મંડળી
૨૮/૦૯/૨૦	આસો સુદ ૧૨	ચાંદી બંગલો	૧૩/૧૦/૨૦	આસો વદ ૧૧	મહાપ્રભુજીના જન્મ દિવસ
૨૯/૦૯/૨૦	આસો સુદ ૧૩	મહારાસ	૧૪/૧૦/૨૦	આસો વદ ૧૨	વામન દ્રાદસી
૩૦/૦૯/૨૦	આસો સુદ ૧૪	ચીર હરણ	૧૫/૧૦/૨૦	આસોવદ ૧૩/૧૪	નાવનો મનોરથ
૦૧/૧૦/૨૦	આસો સુદ ૧૫	વિવાર ઓચ્છવ	૧૬/૧૦/૨૦	આસો વદ અમાસ	વૃજ કમલ

નોંધ: - સમય અને મનોરથમાં ફેરફાર કરવાનો હક્ક મંદિરને રહેશે.

આમ વર્ષમાં આવતા ઉત્સવો અધિક માસ દરમ્યાન ઉજવવામાં આવશે. રૂ. ૨૫૦૧/- ન્યોછાવર આપીને વૈષણવ પોતાની પસંદગીના ઉત્સવ લખાવી શકે છે. એક દિવસના એકથી વધારે વૈષણવો ઉત્સવો લખાવી શકશે. ઈચ્છુક વૈષણવો ટ્રસ્ટીઓનો સંપર્ક સાધી નામ લખાવી શકે છે. ન્યોછાવરની પહોંચ આપવામાં આવશે. આ મનોરથનો પ્રસાદ તા. ૩૧/૦૩/૨૦૨૧ સુધી આપવામાં આવશે.

જે જે ગુજરાતી

શ્રી મદન મોહનજી મંદિર, બાલાસિનોર

અધિકમાસ નિમિત્ત વિવિધ ઉત્સવોનું આયોજન

દ્રસ્ટીશ્રી,

તા. ૧૭/૦૮/૨૦૨૦થી તા. ૧૬/૧૦/૨૦૨૦ સુધી શ્રી મદન મોહનજી મંદિર, બાલાસિનોર ખાતે અધિક માસ નિમિત્તે ઉજવનાર ઉત્સવોની યાદી મુજબ અમારા તરફથી તિથિની નોંધણી કરશો.

૧. તિથિ _____ તા. _____ ઉત્સવ _____

૨. તિથિ _____ તા. _____ ઉત્સવ _____

આ સાથે એક તિથિના રૂ. ૨૫૦૧/- લેખે _____ તિથિના રૂ. _____

મોકલાવ્યા છે.

How to pay in this corona time

ONLINE

Bank : Dena Bank, Branch : BALASINOR

A/C No : 019210003367

IFSC CODE : BARBODBBSIN

Note : inform your dates or tithi to Shri Bipinbhai Mody (Thasarawala) at BALASINOR, Cell No : +91 98253 41014.

Any one in Mumbai

Vasantbhai Parikh (Kuwawala) +91 93246 23361	Daxesh Kadakia (Latakari) +91 98331 76158
Dilipbhai Dharia (Lalakha) +91 98192 65015	Ashwin Dharia (Balbal) +91 98199 03457
Pravin K Shah +91 98215 75238	Hitesh K Shah +91 98202 03095

ફોન નંબર



શૈલેષ દેસાઈ

માણસને સંદાચ તેના મનોવિકાર પજવતા હોય છે. આ મનોવિકારો માં ઈધી અને આતૃસિ માણસને ઠરવા નથી દેતો. માણસ હંમેશા સુખ તરસ્યો છે. સુખ મેળવવા એ વલખાં મારે છે. સુખની અતિભૂખ તેને ઠરવા નથી દેતી. આ અતૃસિ એટલે અસંતોષ છે જે માણસને પારાવાર દુઃખ આપનારં પરિબળ છે. માણસને મન સુખ માટે સ્પર્ધા કરવા તેને પ્રોએ છે. સુખી થવા નહીં પણ બીજા કરતા વધારે સુખી થવા અને દેખાવા પ્રયત્ન કરે છે. પોતે પડોશી કરતાં, અન્ય સ્પર્ધાનો કરતાં સહેજ ને વધુ અદ્યાતો છે. એવા અહૂંકારથી પીડાઈ તે માનસિક સંતોષની ભૂખ, પ્રતિષ્ણાની ભૂખ, પ્રશંસાની ભૂખ, ધનની ભૂખ, વૈભવની ભૂખ માણસનું મન જ્યાં સુધી બટકતું રહે, ત્યાં સુધી એ સુખની અનુભૂતિ કરતું નથી. માણસ તૃષ્ણાઓના મહાસાગરમાં ઝૂલેલો રહે છે. તૃષ્ણા બહુ સંતાન મથી છે. એની કુઝે પ્રત્યેક પળે નવી સંતાન સૃષ્ટિ જન્મતીજ રહે છે. દેશ વાસના ને તૃષ્ણા ખોરાક માંગે છે. માણસને અધૂર્યી કામનાઓ તેને ઠરવા નથી દેતી. માણસ જેટલા અંશે પોતાની તૃષ્ણાઓનો પરિત્યાગ કરે તેટલા અંશે તે સુખી થઈ શકે. માણસ અંદરથી જેટલો શુદ્ધ બની શકે તેટલા અંશે તેનું બાધ્ય વર્તન પણ શુદ્ધ બને. જીતની હં હોઈ શકે પણ તૃષ્ણાની કોઈ હં નથી. ઈધી વિયેકનો શાત્રુ છે. ઈધી કારણે કરવાનું ન કરવાનું કરવા તૈયાર થઈ જાય છે અને ન વિચારવાનું વિચારે છે. માણસ જેમ નાનો હોય તેની ઈધી પણ નાની, માણસ જેમ મોટો તેમ તેની ઈધી ની પ્રબળતા પણ મોટી. માણસની ઈધી કરીને અંતે શું મળવાનું છે? માણસના હાથમાં ઈધી કરીને કેવળ પરિતાપ મળે છે. ઈધી કરીને બીજાનું સુખ નથી મેળવી શકતા. ઈધી એ મનનાં હાથનું રમકું છે. ઈધી એ માણસ દ્વારા ખેલ કરવો છે. ઈધી નું બીજુ નામ એટલે દાક-મત્સર છે એ સૂર્યાયે છે કે એ તરફ સંસારી કે સંત નું હું પદ અને અભિમાન માણસને ઈધીનું બનાવે છે.

હંકિતમાં મન બીજાનું જ માની લે છે દુઃખ બીજાનું જોઈને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે તેને વધુ સુખ આપજે અને મને મારી ચોગ્યતા પ્રમાણે સુખ આપજો. આમ

અંદરથી લઘુતા અનુભવે છે. ત્યારે ત્યાંથી ઈધીનો જન્મ થાય છે. લઘુતા એ મનની સંકદાશ છે. જેનું મન જેટલા પ્રમાણમાં મોકણું છે તે તેટલા પ્રમાણમાં ઈધીની આગથી મુક્ત ઈધીને કારણ જ તેઓ બીજાનું એશ્વર્ય સહી શકતા નથી. ઈધીનું માણસ બીજાનું સુખ ભસ્મીભૂત કરવાના સ્વપ્નો સેવે છે. એનામાં ગુમ રીતે રહેતી વેરવૃત્તિ બીજાને દુઃખી જોઈને પોતાને હરખ ઉપજવે છે. માણસ મહિંદ્રાંકાનાને વશ થઈને પણ જે સુખ બીજો માણસ બોગવી રહ્યો છે, તે પોતાને નહીં મળવાને કારણે બળાપો વ્યક્ત કરે છે. બીજાના સુખો જોઈપોતે દુઃખ અનુભવાય કે બીજાને દુઃખી કરીને પોતે સુખ અનુભવાય. માણસ દયાપાત્ર છે. એ પોતાની વાસનાઓ નો શું લાભ છે એટલે એની ઈધી કે દોષ વૃત્તિ માં વૃદ્ધિ થાય. તેની તરફ ક્ષમા ભવ રાખવો જોઈએ. એના પ્રત્યે કરણા દાખવવી જોઈએ. આ જગત અતિ વ્યાધિ અને એટલે આપણે તેના પ્રત્યે ક્ષમાભાવ દાખવવો. એના પ્રત્યે કરણાશીલ રહેવું. તમારાં ઈધીતાપ વધારી જગતને વધુ દુઃખી બનાવશો નહીં.

ઇશ્વરે માણસનું સર્જન આનંદ વહેંચવા કરેલું છે. ઇશ્વર મને નિર્દોષ રાખજે બીજાને ભલે મહાનતા બક્ષજો. ઈધી, દ્રેષ એમ વેરવૃત્તિ એ તમારા દિમાગથી કોઈને હણી નાખવાની ભૂલમાં કોશિષ ના કરશો. તમારા મનની પવિત્રતાને ભરખી જ્ઞાનો. અંતે તમે વિનાશની ખીણામાં ધકેલાઈ જશો, ઈધી કરવાથી એસીડીટી થાય છે. દેશ રોગનો જન્મ જેવા વિચારો ને પ્રમાણે થાય છે. એસીડીટી વધીને અસ્સર થાય છે. હસતાં માણસો શરીર થોડા જાડા હોય છે. ને બળતા સ્વભાવવાળા લોકો તેને તરછોકે છે.

.....* * *.....

જેની આંખોમાં અભી તેને દુનિયા ગમી, જેની વાણીમાં
અભી તેને દુનિયા નભી!

.....* * *.....

જીવનનો આધાર વાણી અને પાણી પર છે ! ઈશ્છા દુઃખની
માં છે !

.....* * *.....

ઉપવાસ તૂટે તો વાંધો નહિ, કોઈનું દિલ ના તૂટવું જોઈએ !

.....* * *.....

જે જે ગીતોકલેશ



Indian Festivals

ભારતીય સંસ્કૃતિકા
તમામ વાત ઉત્સવોના
દર્શનના અવેરો
હાઇમા...

આપણે જાણીએ છે કે આપણને માનવ જીવન પ્રાભ થયેલું છે એજ મોટો ઉત્સવ છે. જેમાં ઈશ્વરની ઈશ્વરતાનો ઈશ્વર સ્વયં પોતે જ આંનદરૂપ બની પ્રતના રૂપમાં પ્રેમ ભક્તિ, જ્ઞાન ના સંવર્ધન રૂપે આપણી સાથે હોય છે. પ્રત રૂપમાં ઈશ્વર મળી જાય, બીજો કોઈ હેતુ બાકી રહેતો નથી. આવો માનવ આત્મ પ્રસાદ સતુ, ચિત્ત અને આંનદરૂપ હોય છે. જેથી માનવ સ્વયં હું ને ઈશ્વર જુદા નથી તેવો અમૃતતુલ્ય અનુભવ જે ક્ષણિક સમય માટે અનુભવે છે.

ઉદાહરણ તરીકે નારદજી ને ભક્તિતપ માં ક્ષણિક અનુભવ થયો હતો. જેનું શ્રીમद્ભાગવત મહાપુરાણ પ્રમાણ છે. ભારતીય સંસ્કૃતિ અને પ્રતની નદીઓ અને ઉત્સવ ના દરિયા પુણ્યશાળી જીવાત્માને ભોગવપા મળે છે. આવું આપણે પણ આવા તીર્થરૂપ અંજલીનું સમુદ્રમંથન ના અમૃત તુલ્ય તીર્થજળનું પાન કરીએ.

ભારતના તમામ રાજ્યોમાં ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમ થી લઈને પૂર્વ સુધી પોતપોતાની સંસ્કૃતિ, ભાષા, પહેલેશ, બોલી, નૃત્ય, ગીત, સંગીત કથા વાર્તા સંત અને સદ્પૂરૂષોની સત્ય ઘટનાઓથી વ્યાપ્ત છે. આખા ભારતવર્ષમાં તથા વિશેષ કરીને રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણ ભારત સુધી ગ્રામ્યજીવનથી લઈને નાના મોટા શહેર સુધી માનવ સમૃહો પ્રતોસ્વની પરંપરા જાળવી રહ્યા છે. દા.ત. દિપાવલી, નવરાત્રી, શિવ રાત્રી, રામ અને કૃષ્ણ જન્મ જયંતી, કેવડા ગ્રીજ, બોર ચોથ, રાંધણ છઠ, હોળી, ધુળેટી, ભાઈબીજ, ગુરુપૂર્ણીમા, હરિતારીકા, દુર્ગાષ્ટમી, ધનતેરસ, કાળી ચૌદસ, વસંતપંચમી, તુલસી વિવાહ, ગુરૂ પદવો, રામ નવમી, મકરસંકાંતિ, હનુમાન જયંતિ વગેરે વગેરે...

અહીં ઈશ્વર, પરમાત્મા, ભગવાન, God, Prabhu આ શબ્દોને માનવ હૃદય સમૃદ્ધ બનાવે છે. ઉદાહરણ

તરીકે પ્રતોના માધ્યમથી માનવ જીવન નો અનેરો આનંદ જ મેળવી શકાય.

યુધિષ્ઠિર મહારાજનો રાજસ્થાની જીવન નો અનેરો આનંદ અલૌકિક સુંદરતા હોવા છતા ઈશ્વરની માયારૂપ જલમાં સ્થળ અને સ્થળ નો જલમાં પડી જવાનો અનુભવ દુર્યોધનજી ને થયો હતો. તે સમયે ક્રૌપદી માતા ક્ષારા ઉપહાસ થયો અને ઉદ્બગાર નીકળ્યા કે "અંધળા ના સંતાન આંધળા જ હોય" જેનું પરિણામ આખું ભારતવર્ષ જાણે છે.

આ જ સમયે બદલો લેવાનો તીવ્ર સંકલ્પ દુર્યોધન જેવા શત્રુના છુદયમાં ક્ષોધાંત્રિ રૂપે ઉત્પત્ત થયો અને તે ક્ષેત્રી બન્યો. જેથી ધૂતકીડા નું આયોજન થયું જેમા પાંડવોનો ધોર પરાજય થયો. ૧૨ થી ૧૪ વર્ષ નો વનવાસ ભોગવપો પડ્યો. જ્યારે યુધિષ્ઠિર ક્ષારા આ દુઃખોમાંથી મુક્ત થવા ઉપાય ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યવામાં આવ્યો, જે તેમણે આ ઉત્સવ પ્રત ની વિધી દુઃખમાંથી મુક્ત થવા ભગવાને બતાવી જેથી પાંડવો ને રાહત મળે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે તમે વૈદિક બ્રાહ્મણો ક્ષારા અનંત ભગવાનનું પ્રત અને પૂજન કરો જેમાં શ્રી કૃષ્ણ એક ઉદાહરણ આપે છે.

પહેલાના સમયમાં સુંમંત નામના બ્રાહ્મણ પોતાની ભાર્યા દિક્ષા સાથે ધર્મમય વૈદિક જીવન જીવતા હતા. એમની એક કન્યા નામે સુશીલા હતી. એક સમયે દિક્ષા માતાનું મૃત્યુ થયું તે સમયે સુંમંત ભુદેયે બીજા લભ કર્યા. પરંતુ પોતાની કન્યા મોટી થઈ જાણી તે કન્યા કૌડિન્ય અધિને પરણાવી પરંતુ સુંમંતની બીજી ભાર્યા કર્કશા નામે જેણે કન્યા વિદાય માં ઈંટ અને પથ્થરો આપ્યા.

વિદાય લઈ રસ્તામાં રાત્રી પડી જતા આ યુગલે નદીના કિનારે રાત્રી વિતાવી તેજ સમયે સવારની સધ્યા

કરી રહેલા કૌડિન્ય ઝાંખિ સદ્યામાં મગ્ન હતા. આ સમય જોઈ સુશીલા કેટલીક સ્ત્રીઓને નદીમાં અલંકૃત થયેલી સુંદર પહેરવેશ ધારણ કરી સ્ત્રીઓ કોઈ દેવતા ઓની પૂજા કરી રહી હતી. ત્યાં જઈ ઉત્સુકતાથી પૂછ્યું કે તે બધી અનંદના દોરા અને અનંતના દેવનું પુજન કરી રહી હતી. ૧૪ ગાંઠ વાળા અનંત દેવ દોરખના રૂપ માં પ્રસન્ન હતા, પ્રસાદ લઈ સુશીલા દોરો લઈ પોતાના પતિ પાસે આવી.

કૌડિન્ય ઝાંખિ એ તે દોરાને શરીર પર ધારણા ન કરતા અભિકુંડમાં પદ્ધરાવ્યો જેનો એક ભાગ વાચુ છારા જંગલમાં ઉડ્યો. તેને શોધવા, પશ્ચાતાપ થવાથી, ખુલ દિવસો ભટક્યા, નિરાશા પ્રાપ્ત થઈ. ભૂમિ પર બેભાન બન્યા. તે જ સમયે અનંત ભગવાને પ્રસન્ન થઈ દર્શન દીધા અને પોતાના પ્રતનો મહિમા સમજાવ્યો. ભગવાન શ્રી અનંતે આ પ્રત ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચૌદસના દિવસે કરવું જેમાં વૈદિક બ્રાહ્મણ છારા ગણેશ, કુળદેવી, અનંતનાગ સાથે શેષનાગનું પૂજન કરવું, નવ નાગ સાથે ગંગા, યમુના, સરસ્વતી નું સ્થાપન કરી, અલંકૃત કરી, અનંતદેવને ૧૪ ગાંઠમાં, ૧૪ લોકના દેવોનું આવાહાન કરી ૧૫ ઉપચાર પૂજન કરી નૈવેદ્ય, આરતી વગેરે કરી પોતાનો પરિવાર, બ્રાહ્મણાંદ્ય અને પરિવાર સાથે ભોજન કરવું. આ પ્રત દુઃખ, શોક વગેરે મટાડનારં છે. ધન ધાન્યની વૃદ્ધિ કરનારં છે. પિતૃ કૃપા કરનારં છે. સંતતી, સંપત્તિથી ભરપૂર કરનારં છે. મોક્ષ અપાવનારં છે. આ પ્રત કરનારના છુદ્યમાં ઈશ્વર જીવને અને પરમાત્માનો સંબંધ સત્યરૂપમાં અનુભૂત કરાવે છે. જેથી જીવને પ્રતિત થાય છે કે પોતાને મળેલું માનવ જીવન ઈશ્વર નાં અંશરૂપ છે. અણામોલ છે તેથી પ્રત ઉત્સવના માદ્યમ થી જીવનને અમૃત બનાવી જન્મ મરણના ચક્કમાંથી મુક્ત થઈ ભગવાનના છુદ્યમાં સ્થાન મેળવવું એજ સંકલ્પ સત્ય છે.

આ અનંત પ્રતનો મહિમા લખનાર, વાંચનાર, લેખનું દાન દેનાર, પ્રત કર્યાનું ગૌ દાન સમાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે.

અસ્તુ... કચ્ચાણ વસ્તુ!!

ભાગવત કથાકાર – શ્રી કમતેશભાઈ

જે જી ના કાંદાણ

અભસખા

શ્રી કુંભનદાસજી

અષ્ટછાપ સખામંડલમાં જેમનું સ્થાન પ્રથમ છે, શ્રી કુંભનદાસજી તે મદામ ભક્ત કર્યા છે. શ્રી નાથજીની કીર્તન સેવામાં મદાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ સર્વ પ્રથમ શ્રી કુંભનદાસજીને નિયુક્ત કર્યા હતા. એમનું જીવન સ્વર્ણ આરસી જેવું પ્રકાશિત અને દેવી હતું.

તેથોનો જન્મ શ્રી ગોવર્ધન પાસે જમુનાવતા ગામમાં થયો હતો. એમના પિતા એવું માનતા હતા કે કુંભ ના મેળામાં ડેરી સંતતી કૃપાથી પુત્રની પ્રાપ્તિ થઈ છે. તેથી તેમનું નામ કુંભનદાસ રાયનું. કુંભનદાસના બાળપણમાં જ એમના માતા-પિતા નું મૃત્યુ થવાથી, એમના કાકાએ એમને મોટા કર્યા. એમના કાકા ધર્મદાસજી પાસેથી જ એમને કથા, કીર્તન અને સત્સંગના સંસ્કાર મળ્યા. દાકોરજીની કૃપાથી નાનપણથી જ એમને મધુર કંઠ, કાલ્ય રૂચા અને ગાયન કલાની ભેટ મળી હતી.

શ્રી મદાપ્રભુજીની પ્રથમ ભારત યાત્રા સમયે ગિરીરાજજીમાં ભગવદ સ્વરૂપનું પ્રાગટ્ય થયું હતું, જેને મ્રજ્યવાસીઓએ દેવમન' નામ આપ્યું હતું. થોડા સમય બાદ, જ્યારે મદાપ્રભુજી ગોવર્ધન પાછા પદ્ધાર્ય તારે એક નાતું મંદિર સિદ્ધ કરીને શ્રીનાથજી ને તેમાં પદ્ધરાવી અને સદ્ગ પાડે, રામદાસ ચૌધાણ ને કુંભનદાસજીને ક્રમશઃ ભોગ, શૃંગાર ને કીર્તન સેવામાં નિયુક્ત કર્યા. કુંભનદાસજીને સાત પુત્રો હતા. પણ તે પોતાને દોઢ પુત્રા પિતા જ માનતા. એક પુત્ર એમના શ્રી કૃષ્ણાદાસજી, જેઓ ફક્ત ગાયોની સેવા કરતા પણ નામસેવામાં મન નહોતું તેથી તેને અધ્યોપુત્ર માનતા. કુંભનદાસજીના બિજા પુત્ર શ્રી ચતુર્ભુજ્યાદાસજી, પિતાની જેમ જ શ્રીજીની નામ સેવા અને કીર્તન સેવા કરતા. તેથી તેથોને કુંભનદાસજી આપો પુત્ર કહેતા. આમ 'નિરોધસક્ષણ' ગ્રંથમાં જેમ શ્રી વલ્લભાચાર્યજી કરી છે, 'પુત્રે કૃષ્ણપ્રિય રતિઃ' એટસે કે શ્રીકૃષ્ણ જેને પ્રિય છે એવા પુત્રમાં જ આસંજી રાખ્યા, એ પુષ્ટિમાર્ગના સિદ્ધાંતનું એમણે પાલન કર્યું હતું.

તે સમયાં રાજા માનસિંહ, એકવાર ભક્ત કર્યા શ્રી કુંભનદાસજીના દર્શન કરવા આવ્યા. એ સમયે કુંભનદાસજી સાન કરીને બેઠા હતા અને એમને રાજા માનસિંહની જાણ ન હતી. પોતાની ભત્રીજી પાસે તિસ્ક કરવા આસન અને આરસી માંગી. ભત્રીજીએ કહ્યું કે, 'આસન ખાઈકી

આષસખા

આરસી પડીયા પી ગઈ.' રાજાને આ સાંભળી ખૂબ જ આશ્વર્ય થયું. એમણે પછી થી ભરીજાને આ બાબત ખુલાસો માંગતા, રાજાને ખબર પડી કે વિષમ આર્થિક પરિસ્થિતિને કારણે શ્રી કુંભનદાસજ પાસે ડોઇં ખાસ સાધનો ન હતા. ઘાસની પડીને આસન અને પડીયામાં પાણી ને દર્પણ બનાવી પાપરતા. અને ગાય આ ઘાસ ખાઈને, પડીયાનું પાણી પી ગઈ એટસે ભરીજાએ એવું કઢ્યું છતું. રાજા માનસિંહ એ સમયે એમને રલજડિત દર્પણ, ૧૦૦૦ સ્વર્ણ મુદ્રાઓ અને જમુનાવતા ગામ ભેંટ માં આપવાનો પ્રયત્ન કર્યો. પણ આ નિર્ણયોભી ભક્ત કવિએ તેનો અસ્વીકાર કર્યો. તારે રાજાએ એમને, એમના મોદીનું નામ પૂછતાં તેમણે જણાવ્યું કે આ બેર અને ટેટીના વૃક્ષ જ મારા મોદી છે, જે મને આપું વર્ષ ફળ આપે છે. આવા તાગ મૂર્તિ અને નિસ્પદી શ્રી કુંભનદાસજ પાસે મહાપ્રભુજ અને શ્રી ગુંસાઈજ ની સેવા કરી. તેથોએ ૪૦૦ જોટસા કીર્તનો, ૩૩ રાગમાં રચા છે.

શ્રી કુંભનદાસજ આપા નિર, નિર્માઠી અને ત્યાગી હતા. શ્રીજના દર્શન ન થાપ તો એ વિષિત થઈ જતાં. એમાં પુત્ર ફૂષણાસ નું ગાયોની સેવા કરતા મૃત્યુ થયું, આ સમાચાર સાંભળી બેમાન થઈ ગયા. એમને દુઃખ એ વાતનું હતું કે હેઠે એમને સૂતકમાં શ્રીજનાનું દર્શન ન હોઈ થાય. આ વાતની શ્રી ગુંસાઈજને ખબર મળતાં જ તેઓ પદ્ધાર્યો. અને કઢ્યું ઊઠો, તમે સૂતકમાં પણ શ્રીજનાની દીવસમાં એકપાર દર્શન કરી શકરો. તારબાદ શ્રી કુંભનદાસજ હોશમાં આવ્યા. એ સમયે એમણે વિરછના ઘણા પદો રચા.

શ્રી કુંભનદાસજને નિય સીલાનો અનુભવ થતો. પ્રભુની બાળસીલા, ગોપ ગોકુળના ઘારા ચ્યામસુંદર અને પ્રજરમણ નટનાગર આ ત્રણેય સ્વરૂપોના અનેકવિષ પદો એમણે રચ્યા છે.

અષસખાઓમાં સૌથી વધારે, એટસે કે ૧૧૫ વર્ષ જગ્યા અને શ્રી નાથજ શ્રી વર્ષ ફળ આપે છે. આવા તાગ મૂર્તિ અને નિસ્પદી શ્રી કુંભનદાસજ પાસે મહાપ્રભુજ અને શ્રી ગુંસાઈજ ની સેવા કરી. તેથોએ ૪૦૦ જોટસા કીર્તનો, ૩૩ રાગમાં રચા છે.

નિમીખા શુઝેશ કડકીઆ (મરધા)

પ્રકીર્ણ વિભાગ

મૃત્યુ નોંધ	નવા સરનામા
<p>૧) અલકા દક્ષેસ પરીખ (ભગત) (ઉમર વર્ષ – ૫૫) ૨) સાવિત્રીબેન ઓરછયલાલ મોદી (શહેરાવાળા) (ઉમર વર્ષ – ૮૫) ૩) દિપીકા ચંદ્રકાંત ધારીઆ (ઉમર વર્ષ – ૭૦) ૪) કપિલાબેન રતિલાલ દેસાઈ (ઉમર વર્ષ – ૮૮) ૫) સરલાબેન વસંતભાઈપારેખ (ઉમર વર્ષ – ૮૨) ૬) નવીનચંક રમણાલાલ દેસાઈ (મેનપુરાવાળા) (ઉમર વર્ષ – ૮૮) ૭) ચંદ્રપ્રભા પ્રવિણચંક પરીખ (રોકડીયા) (ઉમર વર્ષ – ૮૯) ૮) અંજના રમેશચંક પરીખ (બંગડી) (ઉમર વર્ષ – ૭૯) ૯) શશીકાંત ઓરછયલાલ દેસાઈ (દેકડી) (ઉમર વર્ષ – ૮૩) ૧૦) હસમુખબેન રસિકલાલ ગાંધી (લોઢાવાળા) (ઉમર વર્ષ – ૮૬) ૧૧) મહેશ શાંતિલાલ પરીખ (ઉમર વર્ષ – ૭૫) પ્રભુ સંદ્રભાના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના </p> <p>ચોગેશ નટવરલાલ દેસાઈ વર્ષા ચોગેશ દેસાઈ બી – ૫૭, નાલંદા ૫૨, પેડર રોડ, મુંબઈ – ૪૦૦૦૨૬. મોબાઇલ નં. – ૯૮૨૦૧૨૭૭૨૩ – ૯૭૯૮૮૭૨૮૩૯ લેન્ડ લાઈન નં. – ૦૨૨-૩૫૫૩૮૮૩૪</p>	



10. Round Figure, 11. Ladies First, 12. Travel over seas, 13. Foresight, 14. Breakfast, 15. Square root.
 4give and 4get, 6. Travel over seas, 7. Your time is up, 8. Once in a blue moon, 9. Summary,
 11. Round Figure, 12. Ladies First, 13. Foresight, 14. Breakfast, 15. Square root.
HIIH નું ૩૮ :- 1. Growing economy, 2. In between jobs, 3. Broken record, 4. Missing U, 5.
HIIH નું ૩૦ :- 1) - ૧, ૩) - ૧, ૨) - ૨, ૪) - ૫, ૬) - ૬, ૭) - ૭, ૮) - ૮, ૯૦) - ૯, ૧૧) - ૧૧, ૧૨) - ૧૨, ૧૩) - ૧૩, ૧૪) - ૧૪, ૧૫) - ૧૫, ૧૬) - ૧૬, ૧૭) - ૧૭, ૧૮) - ૧૮, ૧૯) - ૧૯, ૨૦) - ૨૦, ૨૧) - ૨૧, ૨૨) - ૨૨, ૨૩) - ૨૩, ૨૪) - ૨૪, ૨૫) - ૨૫, ૨૬) - ૨૬, ૨૭) - ૨૭, ૨૮) - ૨૮, ૨૯) - ૨૯, ૩૦) - ૩૦, ૩૧) - ૩૧, ૩૨) - ૩૨, ૩૩) - ૩૩, ૩૪) - ૩૪, ૩૫) - ૩૫, ૩૬) - ૩૬, ૩૭) - ૩૭, ૩૮) - ૩૮, ૩૯) - ૩૯, ૪૦) - ૪૦, ૪૧) - ૪૧, ૪૨) - ૪૨, ૪૩) - ૪૩, ૪૪) - ૪૪, ૪૫) - ૪૫, ૪૬) - ૪૬, ૪૭) - ૪૭, ૪૮) - ૪૮, ૪૯) - ૪૯, ૫૦) - ૫૦, ૫૧) - ૫૧, ૫૨) - ૫૨, ૫૩) - ૫૩, ૫૪) - ૫૪, ૫૫) - ૫૫, ૫૬) - ૫૬, ૫૭) - ૫૭, ૫૮) - ૫૮, ૫૯) - ૫૯, ૬૦) - ૬૦, ૬૧) - ૬૧, ૬૨) - ૬૨, ૬૩) - ૬૩, ૬૪) - ૬૪, ૬૫) - ૬૫, ૬૬) - ૬૬, ૬૭) - ૬૭, ૬૮) - ૬૮, ૬૯) - ૬૯, ૭૦) - ૭૦, ૭૧) - ૭૧, ૭૨) - ૭૨, ૭૩) - ૭૩, ૭૪) - ૭૪, ૭૫) - ૭૫, ૭૬) - ૭૬, ૭૭) - ૭૭, ૭૮) - ૭૮, ૭૯) - ૭૯, ૮૦) - ૮૦, ૮૧) - ૮૧, ૮૨) - ૮૨, ૮૩) - ૮૩, ૮૪) - ૮૪, ૮૫) - ૮૫, ૮૬) - ૮૬, ૮૭) - ૮૭, ૮૮) - ૮૮, ૮૯) - ૮૯, ૯૦) - ૯૦, ૯૧) - ૯૧, ૯૨) - ૯૨, ૯૩) - ૯૩, ૯૪) - ૯૪, ૯૫) - ૯૫, ૯૬) - ૯૬, ૯૭) - ૯૭, ૯૮) - ૯૮, ૯૯) - ૯૯, ૧૦૦) - ૧૦૦, ૧૦૧) - ૧૦૧, ૧૦૨) - ૧૦૨, ૧૦૩) - ૧૦૩, ૧૦૪) - ૧૦૪, ૧૦૫) - ૧૦૫, ૧૦૬) - ૧૦૬, ૧૦૭) - ૧૦૭, ૧૦૮) - ૧૦૮, ૧૦૯) - ૧૦૯, ૧૧૦) - ૧૧૦, ૧૧૧) - ૧૧૧, ૧૧૨) - ૧૧૨, ૧૧૩) - ૧૧૩, ૧૧૪) - ૧૧૪, ૧૧૫) - ૧૧૫, ૧૧૬) - ૧૧૬, ૧૧૭) - ૧૧૭, ૧૧૮) - ૧૧૮, ૧૧૯) - ૧૧૯, ૧૨૦) - ૧૨૦, ૧૨૧) - ૧૨૧, ૧૨૨) - ૧૨૨, ૧૨૩) - ૧૨૩, ૧૨૪) - ૧૨૪, ૧૨૫) - ૧૨૫, ૧૨૬) - ૧૨૬, ૧૨૭) - ૧૨૭, ૧૨૮) - ૧૨૮, ૧૨૯) - ૧૨૯, ૧૩૦) - ૧૩૦, ૧૩૧) - ૧૩૧, ૧૩૨) - ૧૩૨, ૧૩૩) - ૧૩૩, ૧૩૪) - ૧૩૪, ૧૩૫) - ૧૩૫, ૧૩૬) - ૧૩૬, ૧૩૭) - ૧૩૭, ૧૩૮) - ૧૩૮, ૧૩૯) - ૧૩૯, ૧૪૦) - ૧૪૦, ૧૪૧) - ૧૪૧, ૧૪૨) - ૧૪૨, ૧૪૩) - ૧૪૩, ૧૪૪) - ૧૪૪, ૧૪૫) - ૧૪૫, ૧૪૬) - ૧૪૬, ૧૪૭) - ૧૪૭, ૧૪૮) - ૧૪૮, ૧૪૯) - ૧૪૯, ૧૫૦) - ૧૫૦, ૧૫૧) - ૧૫૧, ૧૫૨) - ૧૫૨, ૧૫૩) - ૧૫૩, ૧૫૪) - ૧૫૪, ૧૫૫) - ૧૫૫, ૧૫૬) - ૧૫૬, ૧૫૭) - ૧૫૭, ૧૫૮) - ૧૫૮, ૧૫૯) - ૧૫૯, ૧૬૦) - ૧૬૦, ૧૬૧) - ૧૬૧, ૧૬૨) - ૧૬૨, ૧૬૩) - ૧૬૩, ૧૬૪) - ૧૬૪, ૧૬૫) - ૧૬૫, ૧૬૬) - ૧૬૬, ૧૬૭) - ૧૬૭, ૧૬૮) - ૧૬૮, ૧૬૯) - ૧૬૯, ૧૭૦) - ૧૭૦, ૧૭૧) - ૧૭૧, ૧૭૨) - ૧૭૨, ૧૭૩) - ૧૭૩, ૧૭૪) - ૧૭૪, ૧૭૫) - ૧૭૫, ૧૭૬) - ૧૭૬, ૧૭૭) - ૧૭૭, ૧૭૮) - ૧૭૮, ૧૭૯) - ૧૭૯, ૧૮૦) - ૧૮૦, ૧૮૧) - ૧૮૧, ૧૮૨) - ૧૮૨, ૧૮૩) - ૧૮૩, ૧૮૪) - ૧૮૪, ૧૮૫) - ૧૮૫, ૧૮૬) - ૧૮૬, ૧૮૭) - ૧૮૭, ૧૮૮) - ૧૮૮, ૧૮૯) - ૧૮૯, ૧૯૦) - ૧૯૦, ૧૯૧) - ૧૯૧, ૧૯૨) - ૧૯૨, ૧૯૩) - ૧૯૩, ૧૯૪) - ૧૯૪, ૧૯૫) - ૧૯૫, ૧૯૬) - ૧૯૬, ૧૯૭) - ૧૯૭, ૧૯૮) - ૧૯૮, ૧૯૯) - ૧૯૯, ૨૦૦) - ૨૦૦, ૨૦૧) - ૨૦૧, ૨૦૨) - ૨૦૨, ૨૦૩) - ૨૦૩, ૨૦૪) - ૨૦૪, ૨૦૫) - ૨૦૫, ૨૦૬) - ૨૦૬, ૨૦૭) - ૨૦૭, ૨૦૮) - ૨૦૮, ૨૦૯) - ૨૦૯, ૨૧૦) - ૨૧૦, ૨૧૧) - ૨૧૧, ૨૧૨) - ૨૧૨, ૨૧૩) - ૨૧૩, ૨૧૪) - ૨૧૪, ૨૧૫) - ૨૧૫, ૨૧૬) - ૨૧૬, ૨૧૭) - ૨૧૭, ૨૧૮) - ૨૧૮, ૨૧૯) - ૨૧૯, ૨૨૦) - ૨૨૦, ૨૨૧) - ૨૨૧, ૨૨૨) - ૨૨૨, ૨૨૩) - ૨૨૩, ૨૨૪) - ૨૨૪, ૨૨૫) - ૨૨૫, ૨૨૬) - ૨૨૬, ૨૨૭) - ૨૨૭, ૨૨૮) - ૨૨૮, ૨૨૯) - ૨૨૯, ૨૩૦) - ૨૩૦, ૨૩૧) - ૨૩૧, ૨૩૨) - ૨૩૨, ૨૩૩) - ૨૩૩, ૨૩૪) - ૨૩૪, ૨૩૫) - ૨૩૫, ૨૩૬) - ૨૩૬, ૨૩૭) - ૨૩૭, ૨૩૮) - ૨૩૮, ૨૩૯) - ૨૩૯, ૨૪૦) - ૨૪૦, ૨૪૧) - ૨૪૧, ૨૪૨) - ૨૪૨, ૨૪૩) - ૨૪૩, ૨૪૪) - ૨૪૪, ૨૪૫) - ૨૪૫, ૨૪૬) - ૨૪૬, ૨૪૭) - ૨૪૭, ૨૪૮) - ૨૪૮, ૨૪૯) - ૨૪૯, ૨૫૦) - ૨૫૦, ૨૫૧) - ૨૫૧, ૨૫૨) - ૨૫૨, ૨૫૩) - ૨૫૩, ૨૫૪) - ૨૫૪, ૨૫૫) - ૨૫૫, ૨૫૬) - ૨૫૬, ૨૫૭) - ૨૫૭, ૨૫૮) - ૨૫૮, ૨૫૯) - ૨૫૯, ૨૬૦) - ૨૬૦, ૨૬૧) - ૨૬૧, ૨૬૨) - ૨૬૨, ૨૬૩) - ૨૬૩, ૨૬૪) - ૨૬૪, ૨૬૫) - ૨૬૫, ૨૬૬) - ૨૬૬, ૨૬૭) - ૨૬૭, ૨૬૮) - ૨૬૮, ૨૬૯) - ૨૬૯, ૨૭૦) - ૨૭૦, ૨૭૧) - ૨૭૧, ૨૭૨) - ૨૭૨, ૨૭૩) - ૨૭૩, ૨૭૪) - ૨૭૪, ૨૭૫) - ૨૭૫, ૨૭૬) - ૨૭૬, ૨૭૭) - ૨૭૭, ૨૭૮) - ૨૭૮, ૨૭૯) - ૨૭૯, ૨૮૦) - ૨૮૦, ૨૮૧) - ૨૮૧, ૨૮૨) - ૨૮૨, ૨૮૩) - ૨૮૩, ૨૮૪) - ૨૮૪, ૨૮૫) - ૨૮૫, ૨૮૬) - ૨૮૬, ૨૮૭) - ૨૮૭, ૨૮૮) - ૨૮૮, ૨૮૯) - ૨૮૯, ૨૯૦) - ૨૯૦, ૨૯૧) - ૨૯૧, ૨૯૨) - ૨૯૨, ૨૯૩) - ૨૯૩, ૨૯૪) - ૨૯૪, ૨૯૫) - ૨૯૫, ૨૯૬) - ૨૯૬, ૨૯૭) - ૨૯૭, ૨૯૮) - ૨૯૮, ૨૯૯) - ૨૯૯, ૨૧૦) - ૨૧૦, ૨૧૧) - ૨૧૧, ૨૧૨) - ૨૧૨, ૨૧૩) - ૨૧૩, ૨૧૪) - ૨૧૪, ૨૧૫) - ૨૧૫, ૨૧૬) - ૨૧૬, ૨૧૭) - ૨૧૭, ૨૧૮) - ૨૧૮, ૨૧૯) - ૨૧૯, ૨૧૧૦) - ૨૧૧૦, ૨૧૧૧) - ૨૧૧૧, ૨૧૧૨) - ૨૧૧૨, ૨૧૧૩) - ૨૧૧૩, ૨૧૧૪) - ૨૧૧૪, ૨૧૧૫) - ૨૧૧૫, ૨૧૧૬) - ૨૧૧૬, ૨૧૧૭) - ૨૧૧૭, ૨૧૧૮) - ૨૧૧૮, ૨૧૧૯) - ૨૧૧૯, ૨૧૧૧૦) - ૨૧૧૧૦, ૨૧૧૧૧) - ૨૧૧૧૧, ૨૧૧૧૨) - ૨૧૧૧૨, ૨૧૧૧૩) - ૨૧૧૧૩, ૨૧૧૧૪) - ૨૧૧૧૪, ૨૧૧૧૫) - ૨૧૧૧૫, ૨૧૧૧૬) - ૨૧૧૧૬, ૨૧૧૧૭) - ૨૧૧૧૭, ૨૧૧૧૮) - ૨૧૧૧૮, ૨૧૧૧૯) - ૨૧૧૧૯, ૨૧૧૧૧૦) - ૨૧૧૧૧૦, ૨૧૧૧૧૧) - ૨૧૧૧૧૧, ૨૧૧૧૧૨) - ૨૧૧૧૧૨, ૨૧૧૧૧૩) - ૨૧૧૧૧૩, ૨૧૧૧૧૪) - ૨૧૧૧૧૪, ૨૧૧૧૧૫) - ૨૧૧૧૧૫, ૨૧૧૧૧૬) - ૨૧૧૧૧૬, ૨૧૧૧૧૭) - ૨૧૧૧૧૭, ૨૧૧૧૧૮) - ૨૧૧૧૧૮, ૨૧૧૧૧૯) - ૨૧૧૧૧૯, ૨૧૧૧૧૧૦) - ૨૧૧૧૧૧૦, ૨૧૧૧૧૧૧) - ૨૧૧૧૧૧૧, ૨૧૧૧૧૧૨) - ૨૧૧૧૧૧૨, ૨૧૧૧૧૧૩) - ૨૧૧૧૧૧૩, ૨૧૧૧૧૧૪) - ૨૧૧૧૧૧૪, ૨૧૧૧૧૧૫) - ૨૧૧૧૧૧૫, ૨૧૧૧૧૧૬) - ૨૧૧૧૧૧૬, ૨૧૧૧૧૧૭) - ૨૧૧૧૧૧૭, ૨૧૧૧૧૧૮) - ૨૧૧૧૧૧૮, ૨૧૧૧૧૧૯) - ૨૧૧૧૧૧૯, ૨૧૧૧૧૧૧૦) - ૨૧૧૧૧૧૧૦, ૨૧૧૧૧૧૧૧) - ૨૧૧૧૧૧૧૧, ૨૧૧૧૧૧૧૨) - ૨૧૧૧૧૧૧૨, ૨૧૧૧૧૧૧૩) - ૨૧૧૧૧૧૧૩, ૨૧૧૧૧૧૧૪) - ૨૧૧૧૧૧૧૪, ૨૧૧૧૧૧૧૫) - ૨૧૧૧૧૧૧૫, ૨૧૧૧૧૧૧૬) - ૨૧૧૧૧૧૧૬, ૨૧૧૧૧૧૧૭) - ૨૧૧૧૧૧૧૭, ૨૧૧૧૧૧૧૮) - ૨૧૧૧૧૧૧૮, ૨૧૧૧૧૧૧૯) - ૨૧૧૧૧૧૧૯, ૨૧૧૧૧૧૧૧૦) - ૨૧૧૧૧૧૧૧૦, ૨૧૧૧૧૧૧૧૧) - ૨૧૧૧૧૧૧૧૧, ૨૧૧૧૧૧૧૧૨) - ૨૧૧૧૧૧૧૧૨, ૨૧૧૧૧૧૧૧૩) - ૨૧૧૧૧૧૧૧૩, ૨૧૧૧૧૧૧૧૪) - ૨૧૧૧૧૧૧૧૪, ૨૧૧૧૧૧૧૧૫) - ૨૧૧૧૧૧૧૧૫, ૨૧૧૧૧૧૧૧૬) - ૨૧૧૧૧૧૧૧૬, ૨૧૧૧૧૧૧૧૭) - ૨૧૧૧૧૧૧૧૭, ૨૧૧૧૧૧૧૧૮) - ૨૧૧૧૧૧૧૧૮, ૨૧૧૧૧૧૧૧૯) - ૨૧૧૧૧૧૧૧૯, ૨૧૧૧૧૧૧૧૧૦) - ૨૧૧૧૧૧૧૧૧૦, ૨૧૧૧૧૧૧૧૧૧) - ૨૧૧૧૧૧૧૧૧૧, ૨૧૧૧૧૧૧૧૧૨) - ૨૧૧૧૧૧૧૧૧૨, ૨૧૧૧૧૧૧૧૧૩) - ૨૧૧૧૧૧૧૧૧૩, ૨૧૧૧૧૧૧૧૧૪) - ૨૧૧૧૧૧૧૧૧૪, ૨૧૧૧૧૧૧૧૧૫) - ૨૧૧૧૧૧૧૧૧૫, ૨૧૧૧૧૧૧૧૧૬) - ૨૧૧૧૧૧૧૧૧૬, ૨૧૧૧૧૧૧૧૧૭) - ૨૧૧૧૧૧૧૧૧૭, ૨૧૧૧૧૧૧૧૧૮) - ૨૧૧૧૧૧૧૧૧૮, ૨૧૧૧૧૧૧૧૧૯) - ૨૧૧૧૧૧૧૧૧૯, ૨૧૧૧૧૧૧૧૧૧૦) - ૨૧૧૧૧૧૧૧૧૧૦, ૨૧૧૧૧૧૧૧૧૧૧) - ૨૧૧૧૧૧૧૧૧૧૧, ૨૧૧૧૧૧૧૧૧૧૨) - ૨૧૧૧૧૧૧૧૧૧૨, ૨૧૧૧૧૧૧૧૧૧૩) - ૨૧૧૧૧૧૧૧૧૧૩, ૨૧૧૧૧૧૧૧૧૧૪) - ૨૧૧૧૧૧૧૧૧૧૪, ૨૧૧૧૧૧૧૧૧૧૫) - ૨૧૧૧૧૧૧૧૧૧૫, ૨૧૧૧૧૧૧૧૧૧૬) - ૨૧૧૧૧૧૧૧૧૧૬, ૨૧૧૧૧૧૧૧૧૧૭) - ૨૧૧૧૧૧૧૧૧૧૭, ૨૧૧૧૧૧૧૧૧૧૮) - ૨૧૧૧૧૧૧૧૧૧૮, ૨૧૧૧૧૧૧૧૧૧૯) - ૨૧૧૧૧૧૧૧૧૧૧૯, ૨૧૧૧૧૧૧૧૧૧૧૦) - ૨૧૧૧૧૧૧૧૧૧૧૦, ૨૧૧૧૧૧૧૧૧૧૧૧) - ૨૧૧૧૧૧૧૧૧૧૧૧, ૨૧૧૧૧૧૧૧૧૧૧૨) - ૨૧૧૧૧૧૧૧૧૧૧૨, ૨૧૧૧૧૧૧૧૧૧૧૩) - ૨૧૧૧૧૧૧૧૧૧૧૩, ૨૧૧૧૧૧૧૧૧૧૧૪) - ૨૧૧૧૧૧૧૧૧૧૧૪, ૨૧૧૧૧૧૧૧૧૧૧૫) - ૨૧૧૧૧૧૧૧૧૧૧૫, ૨૧૧૧૧૧૧૧૧૧૧૧૬) - ૨૧૧૧૧૧૧૧૧૧૧૧૬, ૨૧૧૧૧૧૧૧૧૧૧૭) - ૨૧૧૧૧૧૧૧૧૧૧૭, ૨૧૧૧૧૧૧૧૧૧૧૮) - ૨૧૧૧૧૧૧૧૧૧૧૧૮, ૨૧૧૧૧૧૧૧૧૧૧૧૯) - ૨૧૧૧૧૧૧૧૧૧૧૧૯, ૨૧૧૧૧૧૧૧૧૧૧૧૦) - ૨૧૧૧૧૧૧૧૧૧૧૧૦, ૨૧૧૧૧૧૧૧૧૧૧૧૧) - ૨૧૧૧૧૧૧૧૧૧૧૧૧, ૨૧૧૧૧૧૧૧૧૧૧૧૨) -

શ્રીમદ્ ભગવદ્ ગીતા

એક અસામાન્ય ગ્રંથ

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ, બે અસામાન્ય વિભૂતિઓ વચ્ચેનો વાર્તાલાપ છે જે ગ્રંથ ત્રૈ આપણે મળ્યો છે. કુર્સ્કેત્રની ભૂમિ ઉપર અને ઘર્મયુદ્ધની પૃષ્ઠભૂમિ પર અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે થયેલો અદ્ભૂત અને અસામાન્ય વાર્તાલાપ એટસે શ્રીમદ્ ભગવદ્ ગીતા!!

અર્જુનને નિમિત્ત બનાવી ને ભગવાન શ્રીકૃષ્ણએ જે ગીતા સંદેશ આપ્યો છે તે આધ્યાત્મિક જીવન અને ભૌતિક જીવન માટે પણ તેટલો જ ઉપયોગી છે. જીવન એક સફેદ અને કાળા તંતુઓના બનેલા વસ્ત્રપટ જેવું છે. જીવનમાં સુખ-દુખ, જ્યોતિરજ્ઞાન, હૃતાશા -મિરાશા, દાનિ-સાલ સફળતા-નિષ્ફળતા મોહ-વીમોહ વગેરે આપવાના જ.

આધ્યાત્મિક જીવનમાં પણ રાગ, દ્રેષ્ણ, ઇષ્ટ, અભિમાન, કામ, કોધ, લોભ, મોછ વગેરે આપવાના જ. આ બધામાંથી કેવી રીતે માર્ગ કાઢવો તેનું માર્ગદર્શન ગીતામાં મળે છે. ગીતા એ મુખ્ય જીવનની મેન્યુઆસ છે. તેમાં વેદ અને ઉપનિષદ્દોનો નિચોડ આપેલો છે. તેમાં જીવ, જગત અને જગતીશ નું જ્ઞાન મળે છે. આપણને નવાઈ લાગશે કે ફક્ત આધ્યાત્મિક દ્રષ્ટિએ જ નહીં પણ વાજિંગત રીતે અને સામાજિક રીતે પણ ભૌતિક જિંગાની સફળ સુધી અને શાંત કેવી રીતે બનાવી તેનું માર્ગદર્શન પણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે. સમાજ અને રાષ્ટ્રને સુદૃઢ બનાવવા ના વિચારો રાખવાના દરેક નેતાઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી માર્ગદર્શન લેનું જ જોઈએ.(પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજીએ ગીતાના શ્લોકો પર આધારિત પ્રગ્રહો દ્વારા અપોસ્ટેય લક્ષ્મી impersonal wealth ઉભી કરી કેટલાય ગામેની શક્ષ બદલી નાખી છે.... સામાજિક કાંતિ) ગીતા, એ જ્ઞાનીઓ માટે જ્ઞાન-ર્સ, કર્મયોગીઓ માટે માર્ગદર્શન અને ભક્તો માટે ભક્તિનો સાગર છે. ગીતામાં કાવ્યઓ, સાહિત્યરસિકો અને તત્ત્વજ્ઞાનીઓ અને મોટીવેશનસ સ્પીકર માટે મુદ્દાઓનો ભંડાર છે. ગીતામાં વિધાશીઓ, યુવાનો, સ્ત્રીઓ વૃદ્ધો દરેક માટે પોતિટિય સંદેશ છે.

સાઇકલ પંક્ચર થઈ જાય તો તેમાં હવા કેવી રીતે ભરવી એ ગીતા નો વિષય નથી, પણ જો તું પ્રયત્ન કરીશ અને જ્ઞાન મેળવીશ તો સાઇકલ તો શું પણ વિમાન ના ટાયર માં પણ તું હવા ભરી શકીશ એ ગીતા નો વિષય છે।

અતિગમતના દેનામાં હાર(defeat) આવે તો નિરાશ થઈશ નહીં પરંતુ પ્રયત્ન કરીશ તો "બાઉન્સબેક" કરી શકીશ એ ગીતા નો વિષય છે. જ્ઞાનત્રંભી રમત કેવી રીતે રમવી તેના વિશે ગીતામાં માર્ગદર્શન છે. કિડેટની રૂપતની જેમ જીવન-રમતમાં ફાસ્ટ બોસ્ટિંગ, ગુગાતી બોસ્ટિંગ, સ્પન બોસ્ટિંગ તથા હારજીત વગેરે પ્રશ્નો આવશે જ. આ બધાનો સામનો કરતા કરતા goal ઉપર ફૂક્સ કરી વર્ક કર્પ કેવી રીતે મેળવવો તેના વિશે માર્ગદર્શન મળશે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા રમતમાંથી out થવાનો ડર, જીવનમાંથી મુત્યુનો ડર, પાપનો ડર, અસફળતાનો ડર વગેરે ડર કાઢી નાખે છે.

ગીતા એ સંત જ્ઞાનેશ્વર, સ્વામી વિષેકાંદ, લોકમાન્ય તિલક, ગાંધીજી, પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી, તથા વિદેશી તત્ત્વજ્ઞાનીઓ જેવા કે ઇમર્ગરન તત્ત્વ થોમસ કાર્લોઈસ વગેરે અને સ્વયં ભગવાન યોગેશ્વર નો પ્રિય વિષય છે!

ગીતા એ ભગવાન યોગેશ્વર નો શ્વાસ છે!!

Geeta is not the Bible of Hinduism but Geeta is the Bible of Humanity

વિશ્વમાં પ્રથમ અણુ બોમબ બનાવનાર વેણાનિક ઓપનેશ્વર દ્વારા જ્યારે પ્રથમ અણુ વિસ્કોટ કરવામાં આવ્યો ત્યારે જે ઊર્જા અને તેજ પ્રકટ થયું તે જોઈને તેના મોટામાંથી અનાયાસે જ ગીતાના અગ્નિયાર્મા આધ્યાત્મય 'વિશ્વકૃપ દર્શન' નો એક શ્લોક સરી પડેલો!!

બ્રિટન દેશના મહાન તત્ત્વજ્ઞાની થોમસ કાર્લોઈસ એ તો ભગવદ્ ગીતાથી એટલા બધા પ્રભાવિત હતા કે અમેરિકાના મહાન તત્ત્વજ્ઞાની ઇમરસન જ્યારે બ્રિટન પદ્ધતાન્ય તારે તેમણે આ ગ્રંથ તેમને બેટ રૂપે આપેલો. અને ત્યારબાદ ઇમરસન પણ આ ગ્રંથથી એટલા પ્રભાવિત થયા કે એમના દ્વારા આપું અમેરિકા મુક્ત વિચારોથી પ્રભાવિત થયું. મહાના ગાંધીજીએ શ્રીમદ્ ભગવદગીતા માંથી ફક્ત જે શબ્દો ઉપાડેલા એક શબ્દ એટસે 'અહિસા' અને બીજો શબ્દ એટસે 'અભ્યમ'. ફક્ત આ બે શબ્દો ની તાકાતથી તેઓ અંગેજ સલ્લનત સામે લડયા. અને ભારતને સ્વતંત્રતા આપાવી.

લોકમાન્ય તિલકે 'ગીતા રહસ્ય' નામનું પુસ્તક લખ્યું સંત જ્ઞાનેશ્વરી 'જ્ઞાનેશ્વરી' નામનું પુસ્તક લખ્યું છે.

આ થઈ તત્ત્વજ્ઞાનીઓ, પેણાનિકી, સંતો અને મહાનુભાવો ની વાતા! આજના જ્યાનાના મેનેજમેન્ટ ગુરુ અને મોટીવેશનસ સ્પીકર પણ ગીતાના તત્ત્વજ્ઞાન નો ઉપયોગ મેનેજમેન્ટ માટે પાપરવાનું કરે છે. આજના જ્યાનાના એક સફળ મોટીવેશનસ સ્પીકર શ્રી વિપેક બિંદ્રા પણ પોતાની સફળતાનું રહસ્ય શ્રીમદ્ ભગવદ્ ગીતાને ગણાવે છે! શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કુસ ૭૦૦ શ્લોક આપેલા છે. તેમાંથી પણ ૭૪ શ્લોક શ્રીકૃષ્ણ દ્વારા બોલવામાં આપેલા છે, ૮૪ શ્લોક અર્જુન દ્વારા, ૮૭ લોક સંજ્ય દ્વારા, અને ૦૧ શ્લોક ધૂતરાણ દ્વારા બોલવામાં આપેલા છે. શ્રીમદ્ ભગવદગીતા આ ચારેખ પાણો સંસારી જ્યો હતા. એમનામાંથી કોઈએ પણ સં-યાસ લીધો નહોતો. ચારેખ જણ ગૃહસ્થ હતા. આમ ગીતા એ ગૃહસ્થીઓ માટે પણ અમૂલ્ય ગ્રંથ છે. પોતાની દિવ્ય દૃષ્ટિથી આ વાર્તાલાપ જોનાર અને સાંભળનાર અને તેનું વર્ણન કરનાર સંજ્ય માં તો એવી નીડરતા આવી ગઈ કે તેણે પોતાના શહેનશાહ શ્રી ધૂતરાણને મોટે કહી દીધું કે : હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીપદારી અર્જુન છે ત્યાં જ શ્રી, વિજ્ય, વિભૂતિ, તેમજ અચળ નીતિ છે એવી મારો સ્પષ્ટ મત છે.

યત્ યોગેશ્વર: કૃષ્ણ: યત્ પાણો ધૂતુર્ધી:

તત્ શ્રી:વિજ્યથો ભૂતિ, ધ્રુવા નીતિ: મતિ મમ !!

જ્યોતિપુંજ

e-JYOTI PUNJ

August – 2020

ॐ
ગણોરામા
દમ:

"કુંમેશ્વર સુરીલાક અને પરીલાક
લાંઘન નો આમાચ શાખાવો."

Publishing day 20th

of every month

WPP License No.

MR/TECH/WPP-147/
South/2018-20

Regd.No.MCS / 050 / 2018—20

Posted at Mumbai Patrika
Channel Sorting Office,

Mumbai—400 001

on 20th & 21st of every month

Printed, Published &
Edited by Bankim Rajni-
kant Parikh on behalf of

Shree Balasinor Na-
vyuvak Sangh
& Printed at

Lohana Hitechhu,
6/B Mohatta Bhavan,
3rd Floor,
E. Moses Road, Worli,
Mumbai—400018

& Published at
118/120,
Ardeshar Dadi Street,
2nd Floor, V.P. Road,
Mumbai—400004

Editor:

Bankim Rajnikant Parikh

